

શ્રી યગોપ્રાથિ  
નૈન ગંથમાળા।

દાદાસાહેબ, ભાવનગર.  
ફોન : ૦૨૮૮-૨૪૨૫૩૨૨  
૩૦૦૧૮૮૬

# પ્રતી-સંઘ

ાર્થિક અધિવેશન  
૩૦ એપ્રીલ, ૧૯૫૦



સંપાદક :

સત્યહેવ વિધાલંકાર,  
સ્વાગત મન્ત્રી-પ્રથમાધિવેશન.

સુધર્માસુદી

અહિસક સમાજ રચનાની દિશામાં  
 આણુવતી-સંધની સ્થાપના એક નક્કર  
 પગલું છે. આણુવતી-સંધનું દિલ્હીમાં જે  
 પહેલું વાર્ષિક અધિવેશન ડૉ મી એપ્રિલે  
 ભરાયું તેનો આ અહેવાલ ગુજરાતી  
 જગતની સેવામાં અર્પણું કરતાં અમને  
 પરમ સંતોષ અને આનંદ થાય છે. આ  
 અહેવાલ થી કાંઈક ખ્યાલ આવરો કે  
 આ પ્રયત્ન કેટલો વખતું યેલો છે. એનો  
 વ્યાપક આવકાર એ એની ઉપયોગિતા  
 અને લોકપ્રિયતા સૂચવે છે. અમને આશા  
 છે કે આ અહેવાલ ઉપયોગી અને  
 લાભકારક નીવડણો. આ સંખ્યમાં  
 જેમને વિશેષ માહિલી જોઈતી હોય  
 તેમને આદર્શ સાહિત્ય સંધના મુખ્ય  
 કાર્યાલય, સરદારશાહર, બિકાનેર,  
 ( રાજ્યસ્થાન ) અથવા શાખા કાર્યાલય,  
 નયા બજાર, દિલ્હી એ સરનામે પત્ર  
 વહેવાર કરવા વિનંતિ છે.

—પ્રકારીક.

અહિસક  
આયુતી-સંદ  
પગલું છે. આ  
પહેલું વાર્ષિક  
ભરાયું તેનો  
જગતની સેવ  
પરમ સંતોષ  
અહેવાલ થ  
આ/પ્રેયતન ?  
વ્યાપક આવ  
અને લોકપ્રિ  
છે કે આ  
લાલકારક  
નેમને વિશ  
તેમને આદ  
કાર્યાલય,  
( રાજ્યસ્થાન  
નયા બજાર  
વહેવાર કર

# આજુદ્રતી-સંઘ

પહેલું વાર્ષિક અધિવેશન  
દિલ્હી-૩૮ એપ્રીલ, ૧૯૫૦



સંપુર્ણ :  
સત્યદેવ વિદ્યાલંકાર,  
સ્વાગત ભન્તી-પ્રથમાધિવેશન.

મૂલ્ય આડ આના.

પ્રકાશક—

પ્રચાર વિભાગ,  
આદર્શ-સાહિત્ય-સંઘ,  
સરદાર શહર (રાજ્યસ્થાન)

---

## સર્વાધિકાર સુરક્ષિત

---

વિજયસિંહ ચોપડા  
'પ્રચારાધ્યક્ષ'  
માણીલાલ વૈઘ,  
'પ્રચાર મન્ત્રી'

મુદ્રક—  
જમનાલાલ જૈન,  
શ્રીકૃષ્ણ પ્રિટિગ વકર્સ,  
વધો

## અનુક્રમ

સ્પષ્ટિકરણ	...	...	...	
નિવેદન	...	...	...	૧-૨૦
વાર્ષિક અધિવેશન	...	...	...	૧
સ્વાગત ભાષણ	...	...	...	૬
આણુપ્રતી-સંધની સ્થાપના				
મુનિ શ્રી નથમલજીનું ભાષણ	...	...	...	૧૪
શુલ સંદેશ	....	...	...	૧૫
સંક્ષિપ્ત વાર્ષિક વિવરણ	...	...	...	૧૬
આચાર્યશ્રીનું ભાષણ	...	...	...	૨૩
પ્રતાળહણ-સંસ્કાર	....	...	...	૩૨
ખીનં ભાષણો				
(૧) જીવનનું નૈસર્ગિક માપ	....	...	...	૩૩
(૨) અંતરાત્માનું ભણાજગરણ	...	...	...	૪૦
(૩) એક વ્યક્તિની શક્તિ	...	...	...	૪૩
આચાર્યશ્રીના આશીર્વાદ	...	...	...	૪૭.
પરિશિષ્ટ ૧ આણુપ્રત અને નિયમો	...	...	...	૫૦
પરિશિષ્ટ ૨ શુલેચ્છાના સંદેશાઓ	...	...	...	૬૨
પરિશિષ્ટ ૩ આણુપ્રતી-સંધનું અંતરંગ અધિવેશન	...	...	...	૭૧

## ગ્રાચાર્ય શ્રી તુલસી દ્વારા સ્પષ્ટિકરણ

અણુત્તી-સંધના સંઅંધમાં કેટલુંક સ્પષ્ટિકરણ આવશ્યક છે. આ સંધ લખપતિ-કરોડપતિ મારવાડીઓના જીવન-ઉત્ત્થાનની જ સંસ્થા છે, એ માન્યતા ભરાયર નથી સંધનો ઉદેશ વ્યાપક છે. તે કોઈ પણ જાતિ, ધર્મ, દેશ અને વર્ગ બેદ વિના માનવમાત્રના નૈતિક ધોરણુને ઊંચું લાવવા ધર્યે છે. એના નિયમો વ્યાપારીઓના જીવનમાં દાખલ થયેલી અદીઓનો જે રીતે વિરોધ કરે છે, તેજ રીતે મજૂર, ખેડત અને રાજ્યાધિકારી આદિ અધા વર્ગના મનુષ્યોમાં દાખલ થયેલી અદીઓનો વિરોધ કરે છે. આ પ્રસંગ પર 'પ્રતી' થનારા ૧૨૧ અણુત્તીઓ માં પણ લિન લિન પ્રાન્ત, ધર્મ તથા વર્ગના લોકો છે. એ વાત સાચી છે કે તેમાં મારવાડી વ્યાપારીઓ વચ્ચારે છે.

'ત્યાગ એક વર્ષ ને માટે જ કેમ?' એ ભાષ્ટમાં પણ લોકોમાં કેટલીક ગેરસમજ છે. એથી શાંકા કરવામાં આવે છે કે વર્ષ પછી કઢાય આ ત્યાગનું પ્રમાણું વધારી હેવામાં આવે. એમાં વાસ્તવિક સ્થિતિ એ છે કે અણુત્તીઓ તો આજીવન ક્રત પાતનનો સંકલપ કરીને જ સંધમાં દાખલ થયા છે. પરંતુ મેં અણુત્તી સંધના જે નિયમો નક્કી કર્યા છે, તે જીવનમાં ક્યાં સુધી વ્યવહાર્ય છે, તેનો અનુભવ લેવા માટે જ આ પ્રથમ અવસર પર માત્ર એક વર્ષના ત્યાગ કરાવ્યા છે. એક વર્ષની મુદ્દત અણુત્તીઓની, ચકાસણી માટે નહિ. પણ, અણુત્તી-સંધના નિયમોની ચકાસણી માટે છે.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રતિશાઓમાં પરિવર્તન થઈ શકતું નથી તેથી આ અવસરપર જો હું ફક્ત ૮૮ નિયમો નો આજીવન ત્યાગ કરાવી હેત, તો પછી એમાં સંશોધન કરવાને માટે સ્વતંત્ર રહેત નહિ. અને હજ એમાં સંશોધનની આવશ્યકતા હું માનું છું. તેથી આ પ્રથમ પ્રસંગપર માત્ર એક વર્ષના ત્યાગ કરાવવામાં આવ્યા છે.

## નિવેદન

આષ્ટુબતી-સંધનું પહેલું વાર્ષિક અધિવેશન દિલ્હીમાં ૩૦ એપ્રિલ  
રવિવારના ખીજ પહોરે ભારે ઉત્સાહથી શાંત અને ગંભીર વાતાવરણમાં  
ભરાયું. કોઈ પણ આયોજનની સહૃદતાનો આધાર જનતા અને દેશમાં  
થનારી તેની પ્રતિક્રિયા ઉપર રહેલો છે. દેશના વિશિષ્ટ મહાપુરુષો અને  
સમાચાર પત્રો એ પ્રતિક્રિયાના સૂચક છે. અધિવેશન માટે આવેલા  
સંદેશાંચો અને પ્રાપ્ત થયેલી શુલેચણાંચો પરથી દેશના વિશિષ્ટ  
મહાપુરુષોના દઘિઅંદુનો ઘ્યાલ આવી શકે છે તથા સમાચાર પત્રોમાં  
થયેલી દેશવ્યાપી ચર્ચાઓ તેમના અભિપ્રાયની જાળ થાય છે. એ અનેનું  
સાથે અવલોકન કરતાં સંધ પ્રત્યે પોતાના દેશનો લોકમત કેવો છે, તેની  
ઝાંખી કરી શકાય છે.

સંધના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસી જ્યપુરથી અલવર,  
અરતપુર, આગરા, મધુગા, વૃદ્ધાવન, ડોસી, પલવલ આદ્ય સ્થાનની ૩૫૦  
માછલની પગપાળા યાત્રા કરતાં અહીં પદ્ધાર્યા, તેનો મુખ્ય ઉદેશ રસ્તામાં  
ગામે જામની જનતાને સત્ય અને અહિસાનો સંદેશ આપવાનો, નીતિમય  
જીવનની હાકલ કરવાનો. અને ધર્મમય જીવન ગાળવાનો આદેશ આપવાનો  
હતો. તેઓશ્રીએ છી એપ્રિલની સવારે અહીં પદ્ધારતાં જ પોતાના  
ભાષજુમાં એ ઘોષણા કરી હતી કે— “અહિસા કાયરોનો નહિ, પણ  
વીરાનો ધર્મ છે અને વીરોજ તેનો મૂર્ખું પ્રચાર કરી શકે છે. જનતામાં  
કૃલાયેલી નેતિક બહીઓને મિટાવવા માટે, આને અહિસાનો સાર્વજનિક  
પ્રચાર આવશ્યક છે. એ ભાવનાથી પ્રેરાઈને હું દિલી આગ્યો છું. ‘કહેવા  
કરતાં કરવું ભલું’ એ સિદ્ધાંતમાં હું વધારે માનું છું. મને  
મૂર્ખ ભાતરી છે કે સ્થાનિક જનતા અને જનતાના પ્રતિનિધિ-નોતાઓ

અહિસાના સાર્વજનિક પ્રચારમાં મને પૂરો સાથ આપશે. જ્યાપુરમાં દેશરત્ન રાજેન્દ્ર બાધુના પૂર્વવાધી મેં કણું હતું કે છસોથી વધારે સાધુ-સાધ્વીઓની સાથે સંઘની સંપૂર્ણ તાકાત હું અહિસા અને વિશ્વમૈત્રીના પ્રચારમાં વિશિષ્ટ રીતે કામે લગાડવા ચાહું છું. એ ઉદ્દેશ્ય દર્શિ સમક્ષ રાખીને આકે અહીં આવ્યો છું.”

આ ભિરાન અથવા ઉદ્દેશ્યની પૂર્તિ માટે આખુન્તી-સંઘનું પ્રથમ વાર્ષિક અધિવેશન પણ આચાર્યશ્રીના દિક્ષિના કાર્યક્રમનું એક નિર્મિત અંગ હતું. એની તૈયારીઓ ખડુ જલદી કરવામાં આવી. એથી એને માટે ન તો યોગ્ય પ્રચાર થઈ શક્યો કે ન તો આમંત્રણો સમયસર મોકલો શકાયાં. ધણા ખરા વિશિષ્ટ મહાનુભાવોનો અમને દૃપકો મળ્યો કે તેઓને અમારું આમંત્રણું સમયસર મળ્યું ન હતું અને કેટલાકોએ આમંત્રણ મળવા છતાં તે એટલું મોઢું હતું કે પોતાનો સમય અન્ય કાર્યક્રમમાં આપી દીધો હતો, તેથી અહીં આવી શક્યા નહિ. વળી એ જોઈને અમને ખેદ ઉપને છે કે કેટલાક મહાનુભાવોને અમારાં આમંત્રણો રૂપી એપ્રિલ પણી મળ્યા કે જ્યારે અધિવેશનની પૂર્ણાંહુતિ થઈ ગુંધી હતી. આમ છતાં જે કૃપાપત્રો અને સંદેશાઓ અમને પ્રાપ્ત થયા છે, તે અત્યાર્ત આશાજનક, ઉત્સાહપ્રદ અને રસ્તીંદાયક છે. એથી સંધ અને તેના કાર્યક્રમની ઉપર્યોગિતા પર સારો પ્રકાશ પડે છે. તેમાં ના કેટલાક ‘પરિશિષ્ટ ૨’ માં જોઈ શકાશે.

સમાચાર-પત્રોમાં થયેલી ચર્ચા પણ વિરોધ ઉત્સાહપ્રદ, રસ્તીંદાયક અને આશાવધ્દીક છે. દિક્ષિમાં સહુને એવો અનુભવ થયો કે મહાત્મા ગાંધી પણી, જનતાના જીવનની અને તેના હૈનિક વ્યવહારની સરલ ભાષામાં સીધી અને સાફ વાત કરનારા જે અન્ય કોઓ મહાત્મા હોય, તો તે આચાર્ય શ્રી તુલસી છે. તેમની તપશુદ્ધ વાણીમાં જે સ્વાભાવિક આકૃત્યાં છે, તેથી જનતા સહજમાં જ મંત્રમુદ્ધ અની ગઠ. સમાચાર-પત્રો પર પણ તેનો સુંદર પ્રભાવ પડ્યો. જ્યાં ચારે બાજુ બોર અનીતિ છવાઈ

ગાઈ છે, ત્યાં આચાર્ય ઓ તુલસીનો આ ઉપહેશ અલિનવ આશાપૂર્વક અદણુ કરવામાં આવ્યો. દિલ્લીની અહારના સમાચાર પત્રોમાં પણ આચાર્યશ્રીના ઉપહેશો તથા ભાષણો અને તેમાં પ્રકૃટ કરવામાં આવેલા વિચારેનું હાંડિક સ્વાગત કરવામાં આવ્યું. ૨૧ વી એપ્રિલે આચાર્યશ્રીએ કેરલાક સંપાદકો, પત્રકારો અને પત્ર-પ્રતિનિધિઓને પહેલી મુલાકાત આપવાની રૂપો કરી હતી. તે વખતે દિલ્લીના આગેવાન હિન્દી દંનિક ‘હિન્દુસ્તાને’ લખ્યું હતું કે—

‘૬૪૦ અહિસંક ‘સૈનિકો’ દેશમાં પગપાળા પ્રવાસ કરતા ગામ ગામ દૂભીને અહિસા-ધર્મનો પ્રચાર કરતા નૈતિક ભૂમિકાને જીચે લાવવાના કામમાં લાગી ગયેલા છે. આ ‘સૈનિકો’ નૈતે ‘તેરાપંથી’ સંસ્થાના સાથું અને સાધીઓ છે, કે જે ‘સમાજભાંથી ઓછું’ લઈને વધારે આપવાનું’ વત ધારણ કરતા સામાન્ય જનતામાં માનવધર્મનો પ્રચાર કરી રહ્યા છે.

‘તેરાપંથી’ સમ્પ્રદાયના નેતા આચાર્યશ્રી તુલસીએ આજ સાયં-કાલે પત્ર-પ્રતિનિધિઓની સમક્ષ ઉકા સૂચના આપતાં એ હર્ષાભ્યું હતું કે જનતાનું નૈતિક-ઉત્થાન કરવાના ઉદ્દેશ્યથી ગત વર્ષમાં આણુતતી-સંઘના નામથી એક સંસ્થા સ્થાપવામાં આવી છે, તેના મુખ્ય ઉદ્દેશી એ છે કે—

[૧] જાતિ, વર્ણ, દેશ અને ધર્મનો લેલભાવ રાખ્યા વિના માનવ-માત્રને સંયમે માર્ગ તરફ આકર્ષિત્વા.

[૨] મનુષ્યને અહિસા, સત્ય, અચૌર્ય, અલયર્ય અને અપરિગ્રહ આદિ તરફોની ઉપાસનાનો વ્રતી બનાવવો.

[૩] આધ્યાત્મિકતાના પ્રચાર દ્વારા ગૃહસ્થ જીવનના નૈતિક ધોરણને જીન્યું લાવવું.

[૪] અહિસાના પ્રચાર દ્વારા વિશ્વમૈત્રી અને વિશ્વરાતિનો પ્રચાર કરવા.

આગામી ૩૦ મી એપ્રિલે હિન્દીમાં અખુબતી-સંઘનું વાર્ષિક અધિકારીને વેશન ભરાશે.

આચાર્યશ્રી તુલસી કે જેએ નૈન શૈવતાંથર તેરા પંથના પ્રગતિશીલ અને ક્રાંતિકારી નેતા ગણ્ય છે, તેઓ શ્રીમદ્ લાકડાની પાટપર બેસીને, પત્રકારોને જનતામાં સંધમ અને ચારિત્રનું વાતાવરણ ઉત્પન્ન કરવા માટે અનુરોધ કર્યો. એમની બને બાળુ તેરા પંથી સાધુ અને સાધીઓ વિરાજમાન હતા. એમના મુખ પર સદેદ વસ્ત્રની પદ્ધીઓ (મુહુપત્તીઓ) પાંધેલી હતી.

આચાર્ય શ્રી તુલસીએ વધારામાં કહ્યું ‘આધ્યાત્મિક ઉત્ત્રતિ વિના કેવલ જૌતિક ઉત્ત્રતિ માનવતાની નૈતિકતાનો વિનાશમાર્ગ’ છે. આજના નીતિ-વિહીન જીવને માનવને પતનની ચરમ સીમા પર લાવીને મૂકી દીધો છે. નૈતિકતાની સહાયથીજ માનવતાની પ્રતિષ્ઠા હોઈ રહ્યે છે. તેથી આજના પ્રત્યેક રાજ્યનૈતિક નેતા, સાર્વજનિક કાર્યકર્તા અને ધર્માચાર્યનું પ્રથમ કર્તવ્ય એ છે કે જનતાના નીચે ગંગેલા નૈતિક ધોરણને જીચે લાવવાનો વિના વિલંબે પ્રથત્ન કરવો. જી ચે આંદેલું નૈતિક ધોરણ જ અંધા સુધારાઓનું મૂલ છે.”

મુખ્યકના સુપ્રસિદ્ધ શાષ્ટ્રવાહી દૈનિક ‘ફી પ્રેસ જર્નલ્સ’ પોતાના મુખ્યપૃષ્ઠ પર ‘સ્વાર્થીની વિરુદ્ધ સાધુઓની યુદ્ધ વોધણું’ ના ભથ્યાણ નીચે મહત્વપૂર્ણ સમાચાર પ્રકટ કર્યા હતા. તેમાં લગ્નું હતું કે ‘તેરસૂત્રી કાર્યક્રમના શાસ્ત્રાસ્ત્રી સંજ્ઞાત થઈને શૈવ શુદ્ધ વસ્ત્રધારી સાતસો સાધુ ભારતના ગામ-ગામમાં દૂચ કરશે અને સ્વાર્થ, અલિમાન તથા ધર્મિની વિરુદ્ધ યુદ્ધવોધણું કરશે. આ ધર્મવીરોના નેતા આચાર્ય શ્રી તુલસીએ દિલ્હીની એક પત્ર-પરિષદમાં એ વાત જહેર કરી કે એમનો તેરસૂત્રી કાર્યક્રમ એવી દાખિથી બનાવવામાં આવ્યો છે કે જેનાથી જનતાનું નૈતિક ઉત્થાન થાય અને તે દ્વારા દેશની અધી સમસ્યાઓનું નિરાકરણ થાય. નૈન શૈવતાંથર તેરા પંથીઓના નવમા આચાર્યે દેશની

જગતામાં સ્વાર્થ, અલિમાન અને ધર્યાની વંચી રહેલી દુર્ભાવના માટે એહ પ્રકટ કર્યો. આચાર્યશ્રીએ કહ્યું કે ‘ધર્મમાં પણ એર્ધમાની, આડંબર અને ડગાધારે મૂળ ધાર્યાં છે, તથા એ વિચારવું પણ મુશ્કેલ ધર્ય પડ્યું છે કે કોણું કોને સુધારી શક્યો અને દુનિયા આ સંકરમાંથી કેવી રીતે પાર ઉત્તરી શક્યો ? તેમણે ‘કરો—આ ન કરો’ ની એક લાંબી યાદી તૈયાર કરી છે. જેમાં જણાવ્યું છે કે ‘અન્ય જાતિ તથા રાષ્ટ્ર પર આકર્મણ ન કરો. જીવનની મૂલકૂત આવશ્યકતાઓથી વધારે સ’પ્રદાન કરો. શરાંખ અને માંસનો ઉપયોગ ન કરો. આત્મરક્ષા માટે પણ કાર્ય પ્રાણીની હિસા ન કરો. અપ્રાકૃતિક મૈથુનમાં ન હસાયો. વર્તમાન શિક્ષા-પ્રણાલીમાં સુધારો કરો. સંયમ અને ઘન્યર્થની તાલીમ લ્યો. જીવનમાં આધ્યાત્મિક દિષ્ટનો વિકાસ કરો.’”

જે કે ઉપરના સમાચારમાં આચાર્યશ્રીના તેરસૂતી કાર્યક્રમનું પ્રતિપાદન નેચુંએ તે રીતે કરવામાં આવ્યું નથી, તો પણ એનાથી એટલો ઘ્યાલ જરૂર આવે છે કે તેઓશ્રીના દિલ્લી પધારવાનું અને પોતાના વિચારો પ્રકટ કરવાનું કેવું દેશબાપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મદ્દાસના ‘હિંદુ’ પત્રમાં પણ આ આશયના સમાચારો પ્રકટ થયા હતા. સમાચાર પત્રોમાં અણુવતી-સ્થંધના પહેલા અધિવેશનની ચર્ચા પણ ધણી થઈ. બધા પત્રોમાં મુખ્ય સમાચાર તરીકે આકર્ષણી રીતે તેને અગ્રસ્થાન આપવામાં આવ્યું. એ બધાનો સંગ્રહ કરવામાં આવે, તો ખાસું એક દળદાર પુરુષનું તૈયાર થાય. એની ચર્ચા ધંગંડ અને અમેરિકાના સમાચાર પત્રોમાં પણ વિશિષ્ટ રીતે થઈ છે. દિલ્લીમાં રહેલા અનેક વિદેશી પત્રોના અભરપત્રીઓ અને પ્રતિનિધિઓ આચાર્યશ્રીને ખાસ મળવા માટે આવવા લાગ્યા અને તેમના પ્રત્યેનું આકર્ષણી દિનપ્રતિદિન વધતું ગયું. દાખલા તરીકે ન્યુયાર્ક (અમેરિકા) ના સુપ્રસિદ્ધ સાન્તાછિક ‘ટાઇમ’ના ૧૫ મી મેના અંકમાં ‘એટામિક વોસ’ (અણુપ્રત) ના મથાળા નીચે આ સમાચારો પ્રકટ કરતાં જણાવ્યું હતું કે—

‘અન્ય અનેક સ્થાનોની કેટલીક વ્યક્તિઓની માફક એક દુર્ઘતો પાતળો, ડિંગણો અને ચમકતી આંખોવાળો ભારતવાસી જગતની વર્તમાન શિથતિની વણી ચિંતા કરે છે. તે ૩૪ વર્ષની વયના આચાર્ય તુલસી છે કે જે તેરાપંથી નૈન સમાજના આચાર્ય છે. આ સમાજ એક ધાર્મિક સમુદાય છે, જે અહિસામાં પૂરેપૂરો માને છે. શ્રી તુલસીરામજીએ સને ૧૯૪૮ માં અણુપ્રતી-સંધ નામની એક સંસ્થા સ્થાપેલી છે. તેના સભ્યો ૧૪૮ પ્રતિજ્ઞાઓ લે છે, જે પ્રતિવર્ષ કુમશઃ વૃદ્ધ પામે છે.

ગ્રામ સપ્તાહમાં ખંડે એવી ધોખણા કરી છે કે એના સભ્યોની સંખ્યા ૭૫ પરથી ૨૫ હજાર સુધી પહોંચી છે. એમાં અનેક લખપતિ-કરોડપતિઓ પણ છે. સંધના મંડપમાં શ્રી તુલસીરામજીના અનેક શિષ્યો લાલ, પીળી અને વાદળી પાદવીઓ પહેરીને એકડા થયા કે જ્યાં તેઓશ્રી પોતે એક જીંચા મંચ ઉપર વિરાજમાન થયા હતા. એક રિષ્યે ૧૪૮ પ્રતિજ્ઞાઓ બધાની સમક્ષ વાંચી સંભળાવી. બાદમાં શ્રી તુલસીરામજીએ જીંચા સ્વરે પૂછ્યું કે ‘કેમ તમને આ પ્રતિજ્ઞાઓ-સ્વીકાર્ય છે?’ જનતાએ ઉત્તર આપ્યો કે ‘હા, અમે બધા એમાં સહમત છીએ.’

પ્રતિજ્ઞામાં લખ્યું છે કે ‘લાંચ લર્ચશું નહિ અને આપીશું પણ નહિ. જુડા રેશનકાર્ડ અનાવીશું નહિ. ટીકીટ બિના મુસાફરી કરીશું નહિ. ખોટા હાથદસ્તક અનાવીશું નહિ. આત્મહત્યા કરીશું નહિ. દૂધમાં પાણી અને આટામાં કોઈ અનાવડી પદાર્થ ભેદવીશું નહિ. કોઈ કુમારિકાના વિવાહ સંબંધી જુદું બોલીશું નહિ. આંખળા છોકરીને દેખતી કહીશું નહિ વગેરે.

‘સમસ્ત ભારતને આ પ્રતિજ્ઞાઓ આપી રહ્યા પણી, શ્રી તુલસીરામજી-ખાડીના જગતને પણ આ પ્રતિજ્ઞાઓ આપવાની ધારણા રાખે છે.’

આ સમાચારોમાં કેટલું ક બ્રમપૂર્ણ પણ છપાયું છે. ૨૫ હજારની સંખ્યા અણુપ્રતીઓની નહિ પરંતુ તેરસ્યાં યોજનાના તેર નિયમો.

સ્વીકારનારાઓની છે. પરંતુ સમાચારમાં તે અને બેગી કરી નાખેલી છે. આણુપ્રતીઓની સંખ્યા ૬૨૧ ની છે, જેમાંના બધા લખપતિ કે કરોડપતિ પણ નથી. આ રીતે સંબન્ધાન અધિવેશનની ચર્ચા સમુદ્રપારના એવા સમાચાર પત્રોમાં થઈ છે કે જેએ ભારત અંગ્રેજી કોર્ટ ચર્ચા ભાગ્યેજ કરે છે.

સ્વદેશના કેટલાક સમાચારપત્રોની ચર્ચા કરવી પણ અપ્રાસંગિક નહિ ગણ્યાય. ગાંધીવાહી વિચારધારાના ખાસ પોષક શ્રી કિશોરકાલ મશરૂમાળાનું ધ્યાન પણ આ તરફ આકૃષ્ણિત થયું. તેમણે ‘હરિજન’ માં ‘આણુપ્રત’ શિર્ષક એક લાંબા લેખમાં એની ચર્ચા કરી છે. એનો જે સાર એમના ‘હરિજન સેવક’ ના ૨૦ મી મેના અંકમાં પ્રકાશિત થયો છે, તે અહીં રજુ કરીએ છીએ. તેઓ લખે છે કે—

“નૈતોમાં ‘તેરાપંથી’ નામનો એક સંપ્રદાય છે. જૈનધર્મના સિદ્ધાન્તોની બાબતમાં તેની માન્યતા અને દઃષ્ટ અંતિમ સ્વરૂપનાં છે. તેના અનુયાયીઓની સંખ્યા લાખ-એ લાખની કહેવાય. તેમાં મોટા ભાગે રજ્યપૂતાનાનો વેપારી વર્ગ છે.

“શ્રી તુલસી નામે એક પ્રભાવશાળી વ્યક્તિ હાલમાં તેરાપંથીના આચાર્ય પદે છે. જનતામાં યુદ્ધ પછી નૈતિક પતન થયું છે. તેમાં કાલા બજાર, મોંધવારી વગેરે અપ્રમાણિકતા માટે વેપારી વર્ગ મુખ્યત્વે જવાઅદાર છે. તેથી છેક્ષણ કેટલાક વખતથી શ્રી તુલસીજી આ નૈતિક પતન પ્રત્યે સામાન્યપણે જનતાનો અને ખાસ કરીને તેમના અનુયાયી-ઓનો આત્મા જાગૃત કરવા પાછળ પોતાનું ધ્યાન આપી રહ્યા છે.

“તાત્ત્વિક દઘિએ જૈન સિદ્ધાન્તોની સંપૂર્ણ સિદ્ધિ માટે સંસારી જીવનના સંપૂર્ણ સંસાર-ત્યાગની અપેક્ષા રહે છે. પરંતુ મોટા ભાગના માણુસો માટે ત્યાગ શક્ય નથી. તેથી સંસારી માણુસોને ધર્મમાં દાખલ થવાનું સરળ કરવા માટે ‘આણુપ્રત’ ની પદ્ધતિ ચોનાઈ છે. ‘આણુપ્રત’ એટલે પ્રતોનું મર્યાદિત પાલન કરતાં આગળ વધવું. માનો કે એક

માણુસને અહિંસા કે અપરિગ્રહમાં અદ્ધા છે, પરંતુ એનું સંપૂર્ણ પાલન કરવાની શક્તિ નથી. અણુપ્રતની પદ્ધતિ પ્રમાણે તે ક્રમશઃ પાલનમાં આગળ વધે. એ મર્યાદા આંધે કે અમુક પ્રકારની હિસા તે નહીં કરે; કે અમુક હંદ્યો વધારે કે અમુક રીતે ધનતું ઉપાર્જન નહીં કરે. આવાં પતોને 'આણુવત' કહે છે. એક વખતે જૈનોમાં આ પ્રથા વણી પ્રચલિત હતી એમ ગણ્યાય છે.

"જનતામાં આ પતોને ફરી લોકપ્રિય કરવા માટે આચાર્ય તુલસીએ 'અણુવતી-સંધ' નામની એક સંસ્થાની સ્થાપના કરી છે. તેમાં જાતિ, વર્ણ, દેશ, ધર્મ કે ક્ષીપુરુષના ભેટભાવ વિના હરકોઈ દાખલ થઈ રહે છે. સત્ય, અહિંસા, અત્યર્થ, અર્સતેય, અપરિગ્રહ, સાધના, આત્મચિંતન વગેરે પતોનું અમુક દરજને પાલન થાય જ તે માટે નિયમોપનિયમ અનાચાર્ય છે. ડેટલાક નિયમ એવા સ્પષ્ટ છે કે સૌ કોઈ પાસેથી એના પાલનની અપેક્ષા રાખવામાં આવે. ડેટલાકને હજુ વધારે કઢક કરવાનીયે જરૂર ગણ્યાય. પરંતુ હક્કીકત એ છે કે યુદ્ધ પણી માણુસ સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યના પાલનમાં વણો પણત પણો છે. તેથી સ્પષ્ટ ફરજને પણ વત તરીકે ગણ્યાવવી પડે છે. જે કે દરેક ધર્મના અનુયાયીએ માટે આ સંધ ખુલ્લો રાખવામાં આગ્યો છે, અને અહિંસા સિવાયના ખીજન નતોના નિયમો સામાજિક અને અસાંપ્રદાયિક દર્ષિયી વડાયા છે; પરંતુ અહિંસા પતના નિયમો એક ધાર્મિક સંપ્રદાયની ચુસ્ત દર્ષિયી વડાયા છે; દાખલા તરીકે શુદ્ધ શાકાહાર ચાહે તેટલો ધ્યાપ હોય તો યે હિંદુમાં પણ માત્ર જૈન અને વૈષ્ણવના અમુક નાના વર્ગ સિવાય ખીજાયો છાંડાં, માંસ અને, માછલાંનો આહાર કે એની સાથે સંકળાયેલો ધંધો છોડવાની પ્રતિસા લેવા તૈયાર ન થાય. એ પ્રમાણે જ રેશમતો ઉપયોગ અને તેના વેપારની વાત છે. ( એ નોંધવા જેવી વાત છે કે તેમાં મોતી અને મોતીના વેપારનો નિષેધ કરાયો નથી; તેમાં યે રેશમ જેટલી જ જીવહિસા સમાયેલી છે, અને એનો બ્યાપાર જૈનોમાં બ્યાપક છે.)

“ પ્રતોના નિયમોનો વિગતો જવા હેતાં, અપ્રામાણિક અને અશુદ્ધ જીવન વહેવાર સામે જનતાનો આત્મા જગૃત કરવાનો આ પ્રયાસ પ્રશાંસનીય છે. મે માસના પહેલા અડવાડિયામાં અણુવતી સંઘની પહેલી સભા મળી હતી, અને એવા સમાચાર મળ્યા છે કે પાંચસો જેટલા વેપારીઓએ સંઘના નિયમોપનિયમ પ્રમાણે પ્રતોના પાલનની પ્રતિગ્રાલીધી હતી. હું આશા રાખ્યું છું કે પ્રતિગ્રાલીધી કરનારાએ પ્રતનાં શાખ અને હાઈનું પાલન કરશે અને સમગ્ર સમજતું નૈતિક ધોરણ જાંચે ઉડાવવા માટે પ્રેરણા ઇપ નીવડુશે. ( અણુવતી સંઘવિષે વધારે માહિતી નોંધતી હોય તેણે મંત્રી, આદર્શ સાહિત્ય સંઘ, સરદાર શહેર ( ગાજસ્થાન ) ને લખ્યાનું. ”

આ ઉદાર સહાનુભૂતિપૂર્ણ ચર્ચામાં શ્રી મશરુવાલાએ ડેટલીક એવી વાતો લખેલી છે કે જેનું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે. અહિસાનાં નિયમોમાં માંસાહારના પૂર્ણ ત્યાગ અને વિશુદ્ધ શાકાહારના વિધાનમાં તેઓને પંથના દાખિકોણની છાપ પડી છે અને તેમણે એને જૈનો અને વૈષ્ણવોની નાની સંખ્યા સિવાય ભીજને માટે અવ્યવહાર્ય બતાવી છે. પરંતુ અમે તેમને ખાતરી આપીએ છીએ કે આ નિયમોમાં નથી તો કોઈ સાંપ્રદાયિક દાખિબિંદુ કે નથી તો કોઈ સાંપ્રદાયિક આગ્રહ. પરિયમમાં પણ એ વિચારધારા નોરથી આગળ વંચી રહી છે કે ‘મનુષ્યનું વિશુદ્ધ લોજન શાકાહાર જ છે, કે કે માંસ-મદ્દાળી તથા ધંડા આદિથી રહિત પૂર્ણ નિરામિષ હોવું જોઈએ.’ અહિસાની દાખિએ ભોજનના સંબંધમાં આ આદર્શ જ વ્યવહાર હોએ શકે છે. એમા ભધ્યમમાર્ગની વ્યવસ્થા સામાન્ય ઇપથી કરી શકાય નહિ. મહાત્મા ગાંધીની દૃષ્ટિ પણ એજ હતી. રેશમ અને રેશમના જિદ્દોગ અથવા વ્યાપારને નહિ; પરંતુ અત્યારે તો તેના પ્રયોગ અથવા વ્યવહારને જ વર્જિટ ફરાબ્યો છે. મોતીએના વ્યવહારને, રેશમના વ્યવહારની માદક વર્જિટ ફરાવવાની સૂચના વિચારણીય છે, આચાર્યશ્રીનું તે તરફ ધ્યાન છે. અત્યારે પ્રત્યેક

પ્રતાનું અણું લઈને અધા પ્રતોનું ક્રમશઃ વધારે અને વધારે પાલન કરવું અને કરાવવું છે. એથી તે નિયમોને અત્યારે વધારે કડક બનાવી શકાય નહિ કે જેને તેઓ ઢીલા સમજે છે. પરંતુ તે ઢીલા રહેવાના નથી. પ્રતિવર્પ તેની ચકાસણી થશે અને એઝાયતા મુજબ, તેને કડક બનાવવામાં આવશે. એક આણુ શ્રી મશરૂવાલા નિયમોને ઓછા કડક બનાવવાની વાત કરે છે અને ભીજુ આણુ તેના ઢીલાપણુંની ફરિયાદ કરે છે. એમની સહૃદ્ય દષ્ટ માટે અમે અત્યંત આભારી શ્રીએ.

હિલ્લીના 'હિંદુસ્તાન ટાઇમ્સ' ની સાંજની આવૃત્તિમાં કાર્બનની સાથે સંધની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે—

'ચમતકારનો યુગ હજુ સમાપ્ત થયો નથી. ચારે ખાળુ ફેલાયેલા અંધકારમાં અમને હિંદુ આતે આશાનું એક કિરણ દેખાયું છે. જ્યારે સેંકડો પાપી એક જ પ્રભાતમાં ધર્માત્મા બની જય છે, લારે નિરાશાવાદ દૂર કરીને અમારે સત્યયુગના આગમનને સ્વીકારવું પડે છે.'

ધતિહાસમાં એવા ઉદ્ઘાટણે તો મળે છે કે જ્યારે એક યા શીજ પાયમાં ફેલાલા સ્ત્રી કે પુરુષ વર્ષો પણ દદ નિશ્ચયથી ગ્રાયરિચ્ચત કરીને તેનાથી પીડ ફેરવી પાછા હડી ગયા હોય. તેમણે એવું વ્યક્તિગત રીતે કરેલું છે. ડોર્ચ સંસ્થા અથવા સમાજના સભ્ય તરીકે નહિ. જીવનની પવિત્રતાને માટે થયેલી આ સામ્રાહિક જાગૃતિ એક એવી ઘટના છે, જે ભાગ્યેજ જોવામાં આવે છે.

'જ્યારે શરાખી પણ સામ્રાહિક સંબંધપમાં શરાખને છોડી દે છે, જ્યારે ડાડુએ પણ એકત્ર થઈને સભ્ય નાગરિક અનવાનો નિશ્ચય કરે છે અને અનુચ્છિત પૈસા પર ફૂલેલા-ફૂલેલા બ્યાપારીએ પણ એકત્ર થઈને સંચાચથી જીવન ગાળવાનું આંદોલન શરૂ કરે છે, ત્યારે એનાથી પ્રભાવિત ડાણું નહિ થાય? વર્ષમાં અધા દ્વિસો તો એવા હોતા નથી કે જેમાં સંચાઈ અને લદાઈને એકત્ર કરીને ફુનિયાને માટે તેનું પ્રદર્શન કરી શકાય.'

તેથી નૈતિક સુધારણાને માટે જે સામૂહિક પ્રયત્ન કરવામાં આવે, તે પર જનતાનું ધ્યાન ખેંચાવું જોઈએ અને તેની પ્રશંસા પણ કરવી જોઈએ. ગયા રવિવારે જે છસો વ્યક્તિઓએ ભવિષ્ય કાલમાં કાલા ભાજર યા ચોએ આજર ન કરવાની ગંભીર પ્રતિસા ગ્રહણ કરી છે અને તે રીતે જેમણે પોતાના જીવનનો એક નવો અધ્યાય લખ્યો છે, તેઓ માત્ર આહુકેણા ધન્યવાહના જ નહિ પણ સમસ્ત નાગરિકોના ધન્યવાહના અધિકારી છે. તેઓએ આ સત્તપ્રતિસા આચાર્ય તુલસીની સામે અણુવતી સંબન્ધના પ્રથમ વાર્ષિક અધિવેશન-સમયે ગ્રહણ કરેલી છે. આ સંબન્ધની સ્થાપના માનવ જીવનની બધી બદીઓમાંથી મુક્ત થવાને માટે કરવામાં આવી છે. અથા પ્રકારની બદીઓ પર વિજ્ઞ મેળવવાને માટે જે આ સમ્મલિત અથવા સામૂહિક આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, એની ગંભીરતાનો ખ્યાલ તો એ વિસમયજનક ઘટનાથી આવે છે કે આચાર્ય તુલસી કે જેઓ આ સંગઈન અથવા આંદોલનનું દિમાગ છે, તેઓ રાજ્યપૂતાનાના રેતાલ મેદાનો પર પગે ચાલીને દિલહીની પાકી સડકો પર પહોંચ્યા છે કે જેથી તેઓ આ સંબન્ધના ઉંચા આદર્શો અને સિદ્ધાંતોનો યોગ્ય પ્રચાર કરી શકે.”

કલકત્તાના અંગ્રેજ દેનિક ‘હિન્દુસાન સ્ટાન્ડ’ ના તા. ૨ જુનના અંકમાં લખ્યું હતું કે ‘લગભગ ૫૦૦ લખપતિ અને કરોડપતિઓ કે જેમાંનો મોટો ભાગ મારવાડી છે, તેમણે કહેવા મુજબ એવી પ્રતિસા કરી છે કે કાલા ભાજર આદ્ય પહાર્થીમાં સેળમેળ અને અસત્ય આચરણ આહિનો અનૈતિક વ્યવહાર તેઓ પોતાના વાપાર રોજગારમાં કરશે. નહિ. આ દેશના વેપાર-ધંધામાં અસત્ય આચરણ ખૂબ જોગ જીપર છે, તેથી સમાજ જીવનમાં એકી રહેલી નીનિનું સબળ ધોરણ તૂઠી જવાનો ભય ઉભો થયો છે, તે પ્રસંગે કેટલાક વાપારીઓનું-વાપાર ધંધામાં અસત્ય આચરણ નહિ કરવાનું—આ આંદોલન દેશભરમાં સ્વસ્થ વાપાર-ધંધાને જન્મ આપી શકશે. આ દિશામાં અણુવતી

સંધના આચાર્ય તુલસીએ ને પહેલ કરી છે તેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.”

કલકૃતાનાં સુપ્રસિદ્ધ હેનિક ‘આનન્દ બજાર પત્રિકા’ એ ‘નૂતન સત્યયુગ’ ના શીર્ષકથી એક લાંબો અગ્રલેખ લખતાં જણાયું હતું કે—

“તો શું કલિયુગનું અવસાન થયું છે? સત્યયુગ ફરી પ્રગટવાનો છે? નવી હિલ્ડી થી તા. ૩૦ મી એપ્રિલને રેઝ એક સમાચાર સાંપડે છે કે મારવારી સમાજના કેટલાય લખપતિ અને કરોડપતિ લોકોએ એવી પ્રતિશા કરી છે કે તેઓ કાળા બજાર કરશે નહિ. એ ચાર નહિ પરંતુ છસો લખપતિ-કરોડપતિઓએ એવું વચન આપ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના કાળા બજાર કરશે નહિ. એની પાછળ ઇતિહાસ છે. પ્રયોજન છે અને તેના પ્રેરક આચાર્ય તુલસી છે કે જેમણે માનવ જાતની સમર્પણ બદીઓની જડમૂળ ઉખાડવાને માટે એક આંદોલનની શરૂઆત કરી છે. એના સમર્થનમાં આ પ્રતિજ્ઞાએ લેવાઈ છે.

‘માનવ જાતના અકલ્યાણુમાં દુર્નીતિ અને કાળા બજારે ને ભાગ લજાયો છે, તેનો છેવટે આ છસો લખપતિ-કરોડપતિઓએ જહેરમાં રૂપીકાર કર્યો. એ છસોનાં નામો પ્રગટ થયા હોત તો ઢીક હતું. તેઓ કાળા બજાર કરશે નહિ; જુઠા રેશન કાર્ડ બનાવશે નહિ; જુગાર ઘેલશે નહિ; જીમીન, મકાન, સોના-ચાંદી, લોજન સામગ્રી, ધી-તેલ-મેરી-આટા તથા દૂધ વેચતાં કાર્ધ એષ્ટું-વંટું કરશે નહિ તથા કાર્ધ જાતના અસર્ય આચરણનો આશ્રય લેશે નહિ. તેઓએ કુચારે પણ કાલાખજાર કર્યા હતા કે નહિ, કોઈ વાર માલની સેળબેળ કરી હતી કે નહિ અથવા અસર્ય આચરણ કર્યું હતું કે નહિ, તેની અમને ખરાર નથી. આ પ્રતિજ્ઞાઓમાં એ સંખ્યાધી કાર્ધ લખેલું નથી. મોટા મોટામાં જ નહિ પરંતુ સાધારણ વેપારીઓમાં પણ આ બદીઓ ફેલાયેલી છે. કાળાખજાર અને સેળબેળ તો દેશબ્યાપી બદી અતી ગઈ છે. નાના

વ्यापारीઓ એવું કહે છે કે પહેલા અમને પણ લખપતિ-કરોડપતિ બની જણા હો પડ્યી અમે પણ માનવ જાતિની સુધારણા માટે પ્રાયર્થિયતા કરી લઈ શું. 'કાળાભજાર કરીશું નહિ, સેળબેળ કરીશું નહિ'-એ બધા નિર્ણયો ધણા સુદર છે. પરંતુ એને જે વ્યવહારમાં લાવવા હોય તો તે માટે દૃદ્ધયનું પરિવર્તન પણ કરવું પડશે. એ માટે પહેલા પાપની કષુલાત કરીની આવશ્યક છે. એનું ૦૮ નામ પ્રાયર્થિયતા છે. મનુષ્ય ગમે તેટલો પાપી એને કાળાભજારિયો કેમ ન હોય પણ જીવનના અંતિમ ભાગમાં વિશેષ કરીને વિવેકની જાગૃતિ થતા એને પ્રાયર્થિયતા અહણ કરતાં તેના ચરિત્રની શુદ્ધિ થઈ જાય છે. સરદાર પટેલે દિલ્હી સમજૂતીના સંઅધમાં સંદિઝ્ય લોકને મનુષ્યની અંદર રહેલી મનુષ્યતા પર વિશ્વાસ રાખવાને કલકત્તાના ભાષણુમાં ઉપદેશ આપ્યો હતો કે 'માણુસે પહેલા ગમે તેવું કાં ન કર્યું હોય, પરંતુ મૃત્યુશાસ્યા પર પણ તે પ્રાયર્થિયતા કરી શકે છે-એ પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ.'

દમણાં શેડ રામકૃષ્ણા દાલમિયાએ પણ એક જહેરાત બહાર પાડી છે. એનો સાર એ છે કે ૧૯૨૦ થી ૧૯૩૦ સુધી મારી યુવાવસ્થામાં હું ગ્રસિદ્ધ સટોડિયો હતો. તે વખતે સંયોગો અનુસાર અનેક વાર મારા લેણુદારોને હું પૂરા રૂપિયા ચૂકવી શક્યો નથી. લખાણ-પત્રી નહિ. હોયાથી તેને ચૂકવવાનું કાયદેસર જરૂરી ન હતું. એમાંથી ધણા લેણુદારો આજે જીવિત નથી. એ બધું યાદ કરતાં મારું દૃદ્ધ લારે અની જય છે. એ જારને હળવો કરવા માટે નિર્વાસિતોની સહાયતા અય્યે હું પાંચ લાખ રૂપિયા દાનમાં આપી રહ્યો છું. આ દાન પ્રાયર્થિયતારૂપ છે. હું એ કામ માટે નિયુક્ત થયેલી સમિતિને દરેક મહિને રૂપિયા પચીશ દળાર આપીશ. આ દેણું મારા લેણુદારો તરફની છે. નિર્વાસિતોને જે સુખનો અનુભવ થશે, તેનાથી લેણુદારોના આત્માને શાંતિ થશે.

પહેલાં વ્યાપારમાં જે કંઈ ભૂલો કરી હોય, તેને માટે સાર્વજનિક રૂપથી પ્રાયર્થિયતા કરવું અને પૈસા આપી ડેવા તે પાપના વિનાશનો મુખ્ય.

ઉપાય છે. દિલ્હીમાં છસો લખપતિ કરોડપતિ મારવાડીઓએ પ્રતિજ્ઞાઓ અહણ કરી છે, તેમાં પૂર્કૃત પાપનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. પાપ નથી કર્યું તો પ્રતિજ્ઞા લેવાની આવશ્યકતા પણ ન હતી. તો પણ એનું મૂલ્ય કું? :

દિલ્હીમાં જે મારવાડીઓએ પ્રતિજ્ઞાઓ લાખા છે, તે સિવાય દેશમાં અજાઓને આવી પ્રતિજ્ઞાઓ લેવાની જરૂર નથી, તે વાતમાં અદેખર કાંઈ તથ્ય નથી. કાળાયજર અને સેળબેળ કરનારા મારવાડીઓ ઉપરાંત પીળ પણ ધણું છે. છતાં એ વાત સાચી છે કે વ્યાપારના ક્ષેત્રમાં મારવાડીઓનો પ્રભાવ વિશેષ છે. તેમાંથી જે છસો લખપતિ-કરોડપતિ પણ કાળાયજર કે સેળબેળ નહિ કરે, તો વ્યાપારધંધામાં સત્યયુગનાં મંડાણ થશે.

અમે આચાર્ય તુલસી મહારાજને સવિનય અનુરોધ કરવા માગીએ છીએ કે તેઓ કલકત્તા નગરીમાં પદ્ધારે અને અહીં હજારો દ્વિવાગ્યાઓને એવી પ્રતિજ્ઞા અહણ કરાવે કે તેઓ દ્વિધમાં પાણી બેળવસે નહિ-તથા અનાવટી દ્વિધમાં મશાલો બેળવીને તેને સાચા દ્વિધ તરીકે અપાવવાની ડાર્શાપ કરશે નહિ. માત્ર એક વર્ષ માટે આ પ્રતિજ્ઞા લેવગવાને જે તેનું વાસ્તવિક પાલન કરાવવામાં આવશે તો તેથી લાખો લોડેના તન, મન અને આત્માનું વિશેષ કલ્યાણ થઈ શકશે. અધ્યા લખપતિ-કરોડપતિ નથી. હજારો કમાનાગાઓનું સ્થાન પણ સમાજમાં કાંઈ કંઈ નથી. તેથી સરસિયામાં મિદીનું તેલ બેળવવાની, ધીમાં ચરણી મેળવવાની અને ઓછું આપવાની સમસ્યા કલકત્તાના બજારમાં એટલી વિકટ છે કે એક શેર માણલીની કિંમત ચૂકવવા છતાં પૂરી એક શેર ધરે લઈ જવાનો પ્રસંગ કદાચિત-કોઈક વાર જ આવતો હશે. આવી તો કેંઠલીએ સમસ્યાઓએ આપણું જવનને બગાડી સંકુમય અનાવી હોય છે.

મહાત્માજી પ્રેમ, સ્તુત્યતા, અદ્વિસા, સત્ય, ધર્મ આહિના ઉપહેરથી કાળાયજર અને સેળબેળને દ્વારા કરવામાં સહ્ય થઈ શકયા નહિ આચાર્ય

તુલસી મહોદ્ય માનવજાતિની અદીઓને દૂર કરવાના આંદોલનમાં સક્ષેપ થઈને જે વેપારીઓને સલ્લનિષ્ઠ બનાવી શકે, મહાસભાવાદી અને ખીનમહાસભાવાદી સામાન્ય જનતામાં તથા સરકારી અધિકારીઓમાં ફેલાએલાં અસત્ય આચરણો અને દુર્લીલિને દૂર કરી શકે તો મહાત્માજીના સ્વરૂપ મુજાહનું રામરાજ્ય પૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થશે. દિલ્લીમાં લખપતિ-કરોડપતિઓએ આત્મહત્યા ન કરવાની પણ પ્રતિજ્ઞા લીધી છે. આત્મહત્યા મહાપાપ તો છે પણ તેઓ તો પ્રતિજ્ઞા ન લેવા છતાં પણ આત્મહત્યા કરત નહિ, તેવો અમને વિશ્વાસ છે. ”

સમાચારપત્રોની આ ચર્ચામાં કેટલીક અમમૂલક અને અત્યક્તિવાળી ચાતો પણ દ્વારાખલ થઈ ગઈ છે. એનું મુખ્ય કારણ એ છે કે તેમણે પૂરેપૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો નથી. દિલ્લીની સમાચાર-પ્રેપક સંસ્થાઓએ જે સમાચારો મોકલ્યા, તે પણ વિશેષ અમનું કારણ બની ગયા. સંઘના વાર્ષિક અધિવેશનમાં તે દિવસે મારવાડીઓની સંપ્રાણ વિશેષ હતી. એ-અદી હજાર સ્થી-પુરુષો તો ખાસ એ અધિવેશન માટે જ અહાર ગામથી આવ્યાં હતાં. એમની વેશભૂપા જુદા પ્રકારની હોય છે. એમની રંઘેગરંગી પાદડીઓ તરફ જ લોડાનું ધ્યાન પોતાના તરફ આકર્ષી લે છે. અને એ એક બાંંત ધારણા-ઝોડી કલ્પના લોડાના મનમાં વર કરી ગઈ છે કે પ્રત્યેક મારવાડી બાપારી જ હોય છે અને તે લખપતિ કે કરોડપતિ હોય છે, તથા એમનું કામ કાળા બજર કે નક્કાખોરીના વિના ચાલી શકતું નથી. તેથી જે છસો વ્યક્તિઓએ તે દિવસે અણુવતી અનવાનો નિર્ધય કર્યો, એ દરેકને મારવાડી માની લેવામાં આવ્યા અને તે દરેક લખપતિ કે કરોડપતિ છે તેવું નિગાધાર અનુમાન કરવામાં આવ્યું. વળી પ્રતિજ્ઞાઓમાં કાળા બજર ન કરવાનો, નક્કાખોરી ન કરવાનો, લાંચ રસ્તે ન લેવા-આપવાનો, સેળભેળ ન કરવાનો અને નક્કી વસ્તુઓ ન અનાવવાનો જે ઉદ્દેશ કરવામાં આવ્યો, તેણે એ ધારણાને વધારે દદ અનાવાની. એથી સમાચારપત્રોમાં જે સમાચારો પ્રગટ થયા તેમાં મોટા

ભાગે છસો લખપતિ-કરોડપતિ મારવાડીએનો જે ઉષેખ કરવામા આવ્યો-  
સમાચાર આપનારાએ એ વાત પણ ભૂલી ગયા કે છસા અણુવત્ત  
લેનારાએમાં ટેટલીક તો મહિલાએ પણ હતી. અને વ્યાપારીઓ સિવાય  
એમાં સાધારણ જનતા પણ ઓછી ન હતી. પ્રાય: બધા વર્ગના લોકો  
એમાં સામેલ હતા. રાજ્યના અધિકારોએ, સંપાદક, લેખક તથા એવા  
અન્ય લોકો જે કટાય મારવાનિવાસી અથવા મારવાડી હોય, તેટલા જ  
કારણે તેમને લખપતિ-કરોડપતિ કેમ કહી શકાય? આ ખાંતિ ને લીધે જ  
કેટલાક સમાચાર પત્રોએ તેના પર કટાક્ષો કર્યા છે અને આ આખા  
આયોજન પરતે સંદેહ તથા અવિશ્વાસ દર્શાવ્યો છે.

સંદેહ તથા અવિશ્વાસ તો દૂર કરી શકાય છે, અને તે ધીરે ધીરે દૂર  
પણ થઈ જશે. બંગ અને કટાક્ષ કરનારા લોકો જ્યારે અણુવત્તી સંધનું  
નક્કર કાર્ય જોશે ત્યારે એમનું દિમાગ અને દિલ સાછે થએ જશે. પરિસ્થિતિની  
ચોખવટ કરવા માટે એટલું જણ્ણાવી દેવું આવક્ષ્યક છે કે અધા અણુવત્તીઓ  
નથી તો મારવાડી કે નથી લખપતિ-કરોડપતિ. આ તો જનતા માટેનું  
આહોલન છે. જે સર્વ સાધારણના વ્યક્તિગત અને સાર્વજનિક જીવનનું  
ધોરણું જિંસું લાવવાની હિસામાં કરવામાં આવેલો એક સુનિશ્ચિત પ્રયત્ન  
છે. કે જેની પાણી પ્રેરક-શક્તિના રૂપમાં આચાર્ય શ્રી તુલસી જેવા  
મહાન સાધક જિલ્લેલા છે અને અણુવત્તીઓની પણ પ્રાય: એક વર્ષની  
અનુભવપૂર્ણ સાધના રહેલી છે.

ભીજે ખમ એ વાતને લીધે ફેલાવા પામ્યો કે આ પ્રતિજ્ઞાઓ એક  
જ વર્ષ ને માટે કેમ લેવામાં આવી? કેટલાક સમાચારપત્રોએ એના  
પર બંગ પણ કર્યો છે. તેઓ કહે છે કે ‘એ પણ મંભવિત છે કે ભીજ  
વર્ષ આ પ્રતિજ્ઞાઓમાં કાંઈ વધારો ન થાય અથવા એક વર્ષ પછી વ્યાપારી  
લોકો એ જોશે કે ધમાનદારીની નીતિથી ડાઢ પણ લાલ થઈ શકે છે  
કે નહિ અને તેને વ્યાપાર-ધ્વાનું સાધન અનાવી શકાય છે કે નહિ?  
આવો સંદેહ, આશાંકા કે આક્ષેપ જાંચામાં જાંચા, પવિત્રમાં પવિત્ર અને

મહાનમાં મહાન કાર્યના સંબંધમાં પણ કરી શકાય. આ સંદેશના ભૂળમાં પણ મોટી ભાંતિ એ જ છે કે આ સંધ વાપારીઓની જ એક સંસ્થા છે અને તેનું મુખ્ય લક્ષ્ય વાપારીઓની જીવનની સુધારણા છે, એમ માની લેવામાં આવ્યું છે. આ એક ભીજી અનેક ભાંતિઓનું કારણ બની ગઈ છે.

જે આદ્વિતનનો પ્રારંભ સંગડન અથવા સંસ્થાના રૂપમાં કરવામાં આવ્યો છે, તે એક વર્ષ પછી અંધ થઈ જશે, તેવી શાંકા કરવી નિરથ્યે છે. અને વ્યક્તિગત હાનિ-લાભનું સ્થાન સંગડન અથવા સંસ્થામાં ગોણ હોય છે. અન્યથા તે સંગડન કે સંસ્થા પ્રગતિ કરી શકતી નથી. એક વર્ષની મુદ્દત નક્કી કરવાનું કારણ આચાર્યશ્રીએ પોતે અનેક વાર સ્પષ્ટ કર્યું છે. એક પત્રપરિવિદમાં પણ તેઓશ્રીએ કલ્યાણ હતું કે સાધકને એક વર્ષ અનુભવ કરવા માટે મળી જાય છે, તેમાં તે પોતાની ખાત્રી કે કમનેરીને પારખી શકે છે. સસ્થાને પોતાના સભ્યોના અનુભવોનો લાભ મળી શકે છે અને આવશ્યકતા તથા અનુભવ પ્રમાણે પ્રતિશાશ્રોત્યા તથા પ્રતોમાં ઉચ્ચિત પરિવર્તન કરી શકાય છે. કોઈ પણ પરીક્ષણ કે પ્રયોગની સફ્ફલતા તથા વિસ્ક્લતા પર દાખિલ રાખવી આવશ્યક છે, દેશ-કાલ-પાત્રનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે. સંધનું જે સંગડન માનવના ક્રિયાશીલ તથા પ્રગતિશીલ જીવન સાથે સંબંધ ધરાવે છે, તેનું કોઈ પણ વિધાન કે તેના કોઈ પણ નિયમો પત્થર જેવા જડ હોઈ શકતા નથી. તેમાં નરમાશની પણ જડા છે. એક વર્ષની મુદ્દત એટલા માટે રાખવામાં આવી છે કે તે જીવનની ક્રિયા અને પ્રગતિની સૂચક છે. પાછળ રહેવાનો પ્રશ્ન તો સાધકને માટે પેદા જ થતો નથી. કદાચ કોઈ પોતાની કમનેરીનો શિકાર બની પણ જાય, તો તેથી શું ? આટલા લોકો નિત્ય ભરણ પામે છે, તેથી જગતનો વ્યવહાર કદી બંદ પડ્યો ખરો ? જગત પ્રગતિશીલ છે. પ્રગતિશીલ સંસ્થાએ પણ જગતના પ્રવાહની માફિક આગળ વધતી જ રહે છે. અરેખર અણુદતી-સંધ પણ એવી જ સંસ્થા છે.

એ ભૂલવું ન જોઈએ કે પ્રત્યેક સંસ્થા, સંગડન, આંહોલન કે મિશન ને વણું સ્થિતિમાંથી પસાર થવું પડે છે. તે સ્થિતિઓ છે—ઉપેક્ષા, મજાક અને વિરોધ. એમાંથી પાર ઉત્તરાય તો સફ્ફદ્રતા પ્રાપ્ત થાય છે. ધર્મા સમય સુધી દરેક સંસ્થા, સંગડન તથા આંહોલનની ઉપેક્ષા કરવામાં આવે છે. લોકો તેને નકામા સમજુને તેના તરફ નજર પણ નાખતા નથી. જ્યારે તે વધવા અને ફેલાવવા લાગે છે, ત્યારે તેની મજાક કે ડેકડી કરવામાં આવે છે. અધા તેના તરફ આંગળી ચોધે છે. પરંતુ ત્યારે પણ તેની પ્રગતિ આલુ રહેતાં તેનો વિરોધ કરવામાં આવે છે, તેના પર અણુખટતા આસ્ક્રોપો કરવામાં આવે છે, તેના સંબંધમાં બ્રમ ફેલાવવામાં આવે છે અને તેના માટે જૂહે પ્રચાર પણ કરવામાં આવે છે. વિરોધના બધા ઉપાયો કામે લગાડવામાં આવે છે. ધીર, વીર, સાહસી, હૃતનિશ્ચય અને દઢસંકલ્પી જ્યારે આ બધા વિરોધને વિનોદ માનીને હસતા-ખેડતા પોતાના માર્ગ પર આગળ વધતા જાય છે, ત્યારે સફ્ફદ્રતા તેનું સહર્ષ સ્વાગત કરે છે. ત્યારે ભીજન લોકો પણ તેનું સ્વાગત, અભિનંદન અને અનુકરણ કરવા લાગી જાય છે. સમાજ સુધ્યારણા માટે કરવામાં આવેલા બધા પ્રગતિરીલ આંહોલનો અને માનવ-કાયાકલ્પ કરનારી બધી કાંતિઓનો ધૂતિહાસ એજ છે. આ બધા ગ્રૂપોમાંથી ઓછા કે વતા અંશે તેમને પસાર થવું પડે છે.

આણુપ્રતી-સંધ પોતાની પ્રારંભિક અવસ્થામા છે. અચિત તે ઉપેક્ષા કરવા યોગ્ય સ્થિતિમાં તો નથીજ. તેની ડેટલીક મજાક અને વિરોધ કરવાનું પણ શરીર થઈ ગયું છે. એનો અર્થ એ નથી કે અમે સફ્ફદ્રતાની સમીપ પહોંચી ગયા છીએ, એવી બધી બ્રાન્ટ ધારણાઓમાંથી અમારે યત્નપૂર્વક અચ્યવાનું છે. આત્મવંચના બધાથી વધારે ભયાનક અભિશાપ છે. અણુપ્રતીએ તો એનાથી ખાસ અચ્યવું જોઈએ. આક્રમણનો ઉદ્દેશ અહીં એઠલા માટે કરવામાં આવ્યો છે કે આપણે કાર્યની ઉપેક્ષા, મજાક કે વિરોધથી ગલગણવું જોઈએ નહિ. અણુપ્રતીનો

માર્ગ ખુલ્લા પગે તરવારની ધાર પર ચાલવાં જોવો છે. એરિસ્ટોટલને જેરનો ખાલો પીવડાવવામાં આબ્દો હતો, ધર્શને રૂલીપર લટકાવવામાં આબ્દો હતો. મહભેદ સાહેબને અતિ લીધણ વિરોધનો સામનો કરવો પછ્યો હતો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીને પ્રાર્થના સ્થળમાં જ રામનામનું સ્મરણ કરતાં કરતાં ગોળાનું નિશાન બનાવવામાં આવ્યા. આ યુગના આઠથા મોટા અહિંસાના ઉપાસકને પણ હિંસાનો શિકાર અનવું પડ્યું. એની સાથે આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આ અધા મહા-પુરુષોની સાધનાને નષ્ટ-અષ્ટ કરનારા મોટા ભાગે તેમના પોતાનાજ અનુયાયીઓ હતા. ‘ન ધર્મો ધાર્મિકેવિના’ ધાર્મિક લોકો વિના ધર્મ રહી શકો નથી. જે આચરણમાં જ સજ્જવ થઈ ને રહી શકે છે, તેને પોથીઓમાં, પાનામાં, ભાદ્રિઓમાં કે મડોમાં સજ્જવ કે જીવીલ અનાવીને રાખી શકાય ખરો? અણુવતી-સંધના પ્રતો અને પ્રતિરોધોનો સંબંધ પણ આપણા જીવન અને આચરણની સાથે છે. કોઈ પણ વિરોધ એનો વાળ સરખે વાંકો કરી શકનાર નથી. પરંતુ આપણા ચરિત્રમાં નાની સરખી ભૂલ કે કમણેરી હશે તો એને ત્યારે ઢોકર લાગવાનું કારણ મળશે.

ધણુભાગે એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવે છે કે આ અણુવતો અહણ કરનારાઓના જીવન પર શું અને કેવી અંસર થાય છે? આ પ્રશ્ન પૂછનારા સજ્જનો પરિશિષ્ટ (૩) માં આપેલી અણુવતી-સંધની અંતરંગ અધિવેશનની કાર્યવાહી અને આચાર્યશ્રીનું વાર્ષિક અધિવેશનમાં અપાયેલું ભાષણ જરા ધ્યાનથી વાંચવાની કૃપા કરે. એનાથી તેઓનું કેટલું કે સમાધાન જરૂર જ થઈ જશે. પરંતુ અણુવતોના યથાર્થ પાલનથી જીવનમાં થનારું પરિવર્તન તો દરેકને માટે પોતાના અંત:કરણું અનુભવ કરવાનો વિષય છે. તે વર્ષનિન લેખન કે ગ્રદ્ધર્ણનનો વિષય પણ નથી. તેથી આ પ્રશ્નનો બરાબર ઉત્તર તો આ મતોનું યથાર્થ પાલન કરીને પોતાન ચાંત:કરણથી જ પ્રાણી કરવો જોઈએ.

એક વાત વધારે. એમ કહેવામાં આવે છે કે આચાર્ય શ્રીતુલસીને અણુગ્રતી-સંધના સંરથાપક કહેવા તે ખોદું છે. આચાર્યશ્રીએ અણુગ્રતોની શોધ કરવાનો કે એને નવીન આદર્શના રૂપમાં જગતની સામે રજુ કરવાનો દાવો કયારે પણ કર્યો નથી. બીજા કોઈએ પણ એ વિષે એવું કહ્યું નથી. સત્ય અને અહિસાનો સિદ્ધાન્ત મહાત્મા ગાંધીની અગાઉ પણ વિદ્યમાન કર્તો. પરંતુ એનો ને પ્રયોગ તેમના પોતાના અને આપણા જીવન પર ‘સત્યાગ્રહ’ અને ‘અહિસાતમક અસહ્યોગ’ ના આવિજ્ઞાર સ્વરૂપે કરવામાં આવ્યો તે ખરેખર જ નવીન હતો. એ રીતે આચાર્ય શ્રીતુલસીનું અણુગ્રતી સંધના નામથી કરવામાં આવતું સંગઠન અને તેના દ્વારા દરેક મનુષ્યના જીવનના નૈતિક ઉત્થાનને માટે કરવામાં આવનારો પ્રયોગ પણ જરૂર નવીન છે. કાન્નિતકારી પ્રયોગો આવી રીતે જ નવીન હોય છે અને આવીજ રીતે નવીન ધૃતિહાસનું નિર્માણ કરે છે. આશા રાખવી જોઈએ કે અણુગ્રતી-સંધનો આ પ્રયોગ પણ એક નવીન ધૃતિહાસનું નિર્માણ કરવામાં સફ્લ થશે.

અણુગ્રતી સંધના પ્રથમ અધિકેશનનું આ વિવરણ, અમને આશા છે કે અનેક ભ્રાંતિઓ અને ખોટી માન્યતાઓને દૂર કરવામાં સહાયક થઈ શકશે. એનાથી સંધનો પરિવ્યક્ત મેળવવામાં જોઈતી સહાયતા મળી રહેશે. અણુગ્રતોનો સ્વીકાર કરીને કલ્યાણ માર્ગના પથિક બનવા માટે પણ આ વિવરણ અનેકાને પ્રેરણું તથા સહાયતા આપી શકશે.

ને ભાઈઅહેનો આ ભંખંધમાં વધારે જાણવા ધૂમ્બાતા હોય અને વિરોધ સાહિત્યનું અધ્યયન કરવા ચાહતા હોય તેઓ ‘આદર્શ’ સાહિત્ય સંધ’ નયા બજાર, દિલ્હી ના સરનામે પત્રવ્યવહાર કરવાની કૃપા કરે.

હિન્દુ

૩ જૂન શનિવાર.

સત્યદેશ વિદ્યાલંકાર,

સ્વાગત મંત્રી.

# આણુવતી-સંઘ

પહેલું

## વાર્ષિક અધિવેશન

પ્રાયઃ દેશમાં સર્વત્ર ફેલાયેલી—અનૈતિકતા, બ્રષ્ટાચાર અને લાંચ રક્ષણતની અદી આહિના—કદાચારની વિરુદ્ધ તે એક રક્તાણીન કાંતિની જોરદાર લહરી હતી કે જેનો ઉંગમ તે દિવસે દિલ્હી શહેરના મુખ્ય સાર્વજનિક કેન્દ્ર ટાઉન હોલમાં થયો. વડવૃક્ષના નાનકડા ભીજને વાવવા સમાન તે ગંભીર અને શાંત અનુષ્ઠાન જે દ્વારા નિશ્ચયથી કરવામાં આવ્યું, તે જે રંગ પડી રહ્યું તો એમાં દેશનો કાયાકલ્પ કરવાની પ્રયંક રક્તિ રહેલી છે. બ્યક્તિની દર્શિને અન્તમુખી બનાવીને તેને આત્મચિંતન અને આત્મપરીક્ષણમાં નિમગ્ન કરનારી આ પ્રવૃત્તિ શાંત હોવા છતાં પોતાની અંદર અતિપ્રયંક રક્તિ ધરાવે છે. એનું દિવ્ય સ્વરૂપ એની ગંભીરતાથી આંકી રકાય છે. આ ભવ્ય સમારોહ તે દિવસે ૩૦મી એપ્રિલ રવિવારને રોજ દિલ્હીના ટાઉનહોલમાં આણુવતી સંધના પ્રથમ વાર્ષિક અધિવેશનના રૂપમાં એના સંસ્થાપક આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ અને સંરક્ષણ નીચે આશાતીત સર્વતાની સાથે થયો. દિલ્હીની બપોરની સખ્ત ગરમીમાં પણ હજર રહેલી સાત થી આડ હજર બ્યક્તિઓએ પહેલેથી છેદે સુધી બધી કાર્યવાહીમાં પૂરે પૂરી શાંતિથી ભાગ લીધો. ચાંદની ચોકમાં આવેલા દિલ્હી મ્યુનિસિપાલટીના ટાઉન હોલની પાછળના ભાગમાં એક સાઢો મંડપ બનાવવામાં આવ્યો હતો. તે માનવમેદનીથી ઉભરાઈ ગયો. આચાર્યશ્રી તુલસી લગભગ સવા વાગે પખાર્યા. ટાઉન હોલ તરફના એક ઊંચા આસન પર તેઓ વિરાજમાન થયા. તેઓની અરાખર સામે પત્રકારો અને દિલ્હીની વિશિષ્ટ બ્યક્તિઓને બેસવાની ગોડવણું હતી. ડાખી બાળુ

મહિલાઓને એસવાની વ્યવરથા હતી, જેમાં અણુગ્રાત ગ્રહણ કરનારી મહિલાઓ પણ સામેલ હતી. સાધુ સંત અને સતીજીઓ પણ ધર્ણી મોડી સંખ્યામાં હાજર હતાં.

બધી હાજરી સાત થી આડ હળવના આશરે હતી. લગભગ અઠી હજાર સ્ક્રીપુરષો બહારથો પદાર્થી હતાં. દિક્ષીની જનતા અને આસ માણુસો એ બધી કાર્યવાહીમાં ગંભીરતાથી લાગ લીધો. બપોરનો સમય હોવા છતાં વાતાવરણ અત્યંત શાંત અને ગંભીર રહ્યું. અધિવેશનને સાર્વજનિક સમારોહનું સ્વરૂપ આપવા છતાં ધાર્મિક સમારોહ જેવી ગંભીરતા છવાયેલી હતી. આચાર્યાની તથા સાધુસંતો અને સતીજીઓની હાજરીમાં અધિવેશનને અત્યંત ગંભીર, શાંત અને ધાર્મિક સ્વરૂપ પ્રાપ્ત રહ્યું હતું કોઈ પણ ધાર્મિક સમારોહ આ પ્રકારના વાતાવરણમાં આટલી શાંતિથી થયાનો આ અવસર અપૂર્વ હતો. તે દશ્ય ખરેખર જોવા જેવું હતું કે જ્યારે હાજર રહેલા અણુગ્રતીઓએ આચાર્યાની સામે જિલા થઈને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી. મુનિશ્રી નગરાજજીએ અહિસા, સત્ય અસ્તેય, અનુભર્ય અને અપરિશ્રદ્ધ સંખ્યા પ્રતિજ્ઞાઓ અક્ષરશઃ બરાબર વાંચી અને પાંચે વાર અણુગ્રતીઓએ જિલા થઈને પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી.

### અધિવેશન પ્રારંભ

દોઢ વાગ્યાના સુમારે આચાર્યાની અધિવેશન શરૂ થયાની ઘેણણા કરી. નમસ્કાર-મંત્રના ઉચ્ચારણની સાથે મંગલ તરીકે તેઓશ્રી નીચેના પદો ઘોલ્યા અને તેનો ભાવ પણ સરલ રાખ્યોમાં વ્યક્ત કર્યો.

### મંગલાચરણ

ણમો અરિહંતાણં ।  
ણમો સિદ્ધાણં ।

णमो आयरियाणं ।  
 णमो उवज्ञायाणं ।  
 णमो लोए सब्वसाहूणं ।  
 सिद्धाणं णमो किच्या, संजयाणं च भावओ ।  
 अत्थधम्मगद्दं तज्जं, अणुसिद्धिं सुणेह मे ।  
 चक्षारि मंगलं । अरिहंता मंगलं । सिद्धा मंगलं ।  
 साहू मंगलं ।

केवली-पन्नत्तो धम्मो मंगलं ॥  
 बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्  
 त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् ।  
 धाताऽसि धीरशिवमार्गविद्येविधानात्  
 व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि ॥  
 तुभ्यं नमाखिभुवनार्त्तिहराय नाथ,  
 तुभ्यं नमः क्षितितलामलभूषणाय ।  
 तुभ्यं नमाखिजगतः परमेश्वराय,  
 तुभ्यं नमो जिनभवोदधिक्षोषणाय ॥  
 एवं स्तु णाणिणो सारं जं न हिंसइ किंचन ।  
 अहिंसा समयं चेव, एयावन्तं वियाणिया

शानीनी शानप्राप्तिनो सार ए छे କେ ଡାଇନି ହିସା କରିବି ନହିଁ。  
 ଅହିସାନୋ ଏବଜ ଭାର୍ଗ ଏକ ଭାତ ବିଜାନ ଛେ.

रागो य दोसो बीअं कम्मबीअं,  
 कम्मं च मोहप्पभवं वदन्ति ।  
 कम्मं च जाई मरणस्स मूलं,  
 दुक्खं च जाई मरणं वयन्ति ॥

રાગ અને દ્રોષ, એ એ કર્મનાં ખીજ છે. કર્મ મોહથી પેઢા થાય છે. જરૂર-મસ્તયુનું ભૂલ કર્મ છે. જરૂર-મસ્તયુને દુઃખ કહેવાય છે.

દુક્ખબં હયં જસ્સ ન હોઇ મોહો,  
મોહો હઓ જસ્સ ન હોઇ તણ્ણા ।  
તણ્ણા હયા જસ્સ ન હોઇ લોહો,  
લોહો હઓ જસ્સ ન કિંચણાઈ ॥

તેનું દુઃખ હણાયું છે, જેને મોહ નથી. તેનો મોહ હણાયો છે, જેને તૃણા નથી. તેની તૃણા હણાઈ છે, જેને લોલ નથી. તેનો લોલ હણાયો છે, જેને ડાઈ પણ પ્રકારની આસક્તિ નથી.

ઇમં ચ મે અથિ ઇમં ચ નાથિ,  
ઇમં ચ મે કિચ્ચભિમં અકિચ્ચં ।  
તં એવમેવં લાલપ્પમાણ,  
હરા હરાંતિ ત્તિ કહં પમ્પાઓ ॥

આ માંનું છે, આ માંનું નથી. આ મારે કરવાનું છે, આ મારે કરવાનું નથી. એવી એવી કલ્પનાએ કરતાં કાલ લઈ જય છે, ત્યાં પ્રમાદ કેવી રીતે કરાય ?

વિયાળિયા દુક્ખવિબદ્ધણં ધણં,  
મમત્તબંધં ચ મહાભયાવહં ।  
સુહાવહં ધર્મધુરં અણુત્તરં,  
ધારેહ નિબ્વાણ ગુણાવહં મહં ॥

એમ સમજે કે-ધન દુઃખને વધારનાંનું છે, ભમત્વ-અંધન ભણા-ભયંકર છે. ધર્મ જ સુખાં અને સર્વાંત્રેષ્ટ છે, ભણાનું છે અને નિર્વાણનો ઉપાય છે. તેનો સ્વીકાર કરો.

ન તં અરી કણઠછેત્તા કરેઝ,  
જં સે કરે અપ્પળિયા દુર્લ્પા ।  
સે નાહિય મચ્યુ મુહું તુષ્ટે,  
પચ્છારગુતાવેણ દ્વાવિહૂણો ॥

જેવો અનર્થ કંદ્ધેદ કરનારો શન્નુ નથી કરતો, તેવો અનર્થ ગોતાની દુષ્પ્રવૃત્તિએ કરે છે. ભૂત્યુના મુખમાં જઈ પડતાં એનું ભાન થાય છે. પછી દ્વારીન પુરષો પર્યાતાપ કરે છે.

અપ્પાહુ ખલુ સમય રક્ષિત્યબ્વો,  
સાંબંધિણહિં સુસમાહિણહિં ।  
અરક્ષિતો જાઇ પહું ઉવેઝ,  
સુરક્ષિતો સંબદ્ધુહાણ મુજ્જાઝ ॥

આત્માની સતત રક્ષા કરવી જોઈએ. એનો ઉપાય ધર્મદ્વિધોની સમાધિ છે. અરક્ષિત આત્મા જન્મ-મરણાની વૃદ્ધિ કરે છે અને સુરક્ષિત આત્મા સર્વ દુઃખોમાંથી મુક્તા થાય છે.

### પ્રાર્થના

આ મંગલપાઠ પછી સતીજીએ નીચેની પ્રાર્થના કરી.

સંતસ્ત જગતકે તુમહી,  
ભગવન વિશ્રામ હો;  
તુમ અનધ અરૂપ અરૂજ હો,  
પ્રાણોંકે પ્રાણુ હો.  
તુમ સર્વદર્શી સમદર્શી,  
સંતત નિષ્કામ હો;

તुમ હો પ્રતીક સમતા કે,  
વૈષમ્યસે પરે.  
હમમેં ભી સમતાકે પ્રતિ,  
નિધા ઉદામ હો;  
મતપક્ષ વિવજ્ઞિત તુમ હો,  
કૃત-સત્ય હે પ્રભો.  
તુમ સત્યગવેપક તો કિર,  
હક્કા કયોં કામ હો;  
રાગાદ્ધિષ્ઠ જેતા,  
સખકે આણુઘમ;  
વિધિ-હરિ-હર જિનકા કુછ ભી,  
ચાહે હિર નામ હો.

મુનિ શ્રીનથમલખાએ અધિવેશનનો નક્કો થયેલો કાર્યક્રમ વાંચી  
સંભળાવ્યો.

### સ્વાગત-ભાષણ

હિન્દીના યશસ્વી પત્રકાર શ્રીસત્યહેન વિદ્યાલંકારે ગમભીર અને  
સ્થિરવાણીમાં સ્વાગત-ભાષણ વાંચ્યું તેમણે કહ્યું કે—

પૂજય આચાર્યશ્રી સન્તસર્તીજ ! આણુવતી લાઈ અહેનો અને  
અન્ય ઉપસ્થિત સન્જળનો !

આપનું સ્વાગત કરતાં પહેલાં આ અપોરની સખત ગરમીમાં  
આપને અહીં આવવા માટે જે તકલીફ આવી છે, તેના માટે  
આપની પાસે ક્ષમા ભાગવા છચ્છું છું. દિક્ષીના અપોર કેટલા  
ગરમ હોય છે, તેના સામાન્ય ખ્યાલ હોવા છતાં, અમે એ કલ્પના  
ન કરી શક્યા કે એત્રણ દ્વિસમાં જ ગરમીનો પ્રકોપ આટલો

અથે વધી જશો. આ ગરમીને જોતા કેટલાક સજજનોએ સુચયવું હતું કે અધિવેશન મુલતાવી રાખવું અને તેના સમયમાં ફેરફાર કરવો. પરંતુ અણુવતીને માટે એ શોભાસ્પદ ન હતું કે તેઓ પોતાના પહેલા જ સાર્વજનિક વત કે સંકલપમાં કુદરતથી હારી જાય અને સમય અથવા દિવસમાં ફેરફાર કરે. અમે વિચાર કર્યો કે અણુવતીઓને આપણે જે અગ્નિપરીક્ષામાં મૂકવાના છે. તેનો પ્રારંભ, લલે અણુ-ઇપમાં જ થાય. છતા શા માટે પૂર્વયોજના મુજબ જ ન કરવો કદળા જે લાભઅહેનો આ અધિવેશનને માટે જ દૂર દૂર થી પદ્ધાર્યા છે, તેમની અગવડનો વિચાર પણ કરવો રહ્યો. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપ અધા અને બહારથી પદ્ધારેલા લાભઅહેનો ગરમીના ઉપરવને, ઉતારાની અગવડને, ખાવાવીવાની મુશકેલીને અને આવવા જવાની તકલીફને ભૂલી જશો. આ આશા અને વિશ્વાસથી હું આપ અધાનું હાર્દિક સ્વાગત કરે છું.

### મારે સંકોચ

જ્યારે મને સ્વાગત મંત્રી થવા ઉપરાંત સ્વાગત ભાષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી, ત્યારે મને સંકોચ થયો અને હું ભારે મુંજવણુમાં પડી ગયો. અણુવતી-સંઘનો પહેલો પરિચય ગયાં વિષે હું જયપુર ગયો, ત્યારે થયો હતો. સંઘની પરિચય-પુરિતકા હું એક જ શાસે જોઈ ગયો. પણ મેં એનું અધ્યયન પણ કર્યું. તે જ વખતે હું સંધ તરફ આકર્ષિત થયો હતો. સંઘના આ અધિવેશનની ચર્ચા થતાં એને દૃઢ્યંગમ બનાવવા માટે દૂરી એક વાર હું એનું વાચન કરી ગયો. આપણા દેશ અને દેશવાસીઓ માટે એની આવસ્યકતાનો અનુભવ હું પહેલાં જ કરી ચૂક્યો હતો. તેથી મારા સંકોચ અને મુંજવણુને દૂર થતાં બહુ વાર ન લાગી. એટલે મારા સાથીઓના નિર્ણયને મેં આજા ગણુંને માથે ચંદાવ્યો. પરંતુ સ્વાગતનું કામ કર્યું મામૂલી નથી. મહારાજ યુધિષ્ઠિરના રાજતિલક પ્રસંગે સ્વાગતનું

તામ લગતાનું શ્રીકૃષ્ણને સોંપવામાં આવ્યું હતું. એમના જેવી વિદ્બસ્તા, યોગ્યતા, અનુભવ, કાર્યકુશલતા અને અધ્યાધી વધારે તો અલૌકિક ગુણ અને અલૌકિક વક્તિત્વ નેનામાં નથી, તે સ્વાગતનો ભાર તથા તેની જવાઅદારી ડેવી રીતે ભેપાડી શકે? પરંતુ એ વાતનો મને પરમ સંતોષ છે કે આખુશ્રતી-સંધ એવા માણસોની સંસ્થા છે કે જેઓ જીવનમાં વધારેમાં વધારે સ્વાવલંખી અનવાની ધૂંચા રાખે છે, જે દુનિયાને ભારત્ય ન થતાં બીજાનો ભાર પોતાના ખલા પર ઉડાવવાને ચાહે છે, અને જેઓ દુનિયાની પાસેથી ઓછામાં ઓછું લઈને તેને વધારેમાં વધારે આપવાની સાધના અંગેની તૈયારીમાં જોડાઈ જવાને ધૂંચે છે. એવા ભાઈ-અહેનોના સ્વાગતનો ભાર અને જવાઅદારી હોઈ જ શું શકે?

### કાંતિકારી-સ્વરૂપ

આખુશ્રતી-સંધ એક સંસ્થા, સંગડન, આદ્દાલન અને યોજના છે, કે જેની આગળ, આજના લોકોચારને દેખતાં, ‘કાન્તિકારી’ વિરોધણ વિના સંકોચે-વિના સંદેહે લગાડી શકાય તેમ છે. કર્મમાં કર્મ મારે આકર્ષણું તો એના એ કાંતિકારી સ્વરૂપને લીધે જ થયું છે. સંપ્રદાયિકતા અને સમ્પ્રદાયવાદમાં જ નહિ, પરંતુ ધર્મ-કર્મના આજકાલના ઇપરંગમાં મને જરા જેટલીયે અદ્ધા કે વિશ્વાસ નથી. મારા મિત્રો ધૂટથી મને ‘નાસ્તિક’ કહી રહ્યા છે. તથી આ સંધમાં હું જોડાયો તે અંગે તેમાંના ડેટલાકને આચ્યર્ય, સંદેહ અને અવિશ્વાસ પણ છે. છેલ્લા થોડા દિવસોમાં એક મોટા સરકારી અધિકારીએ મને પૂછ્યું કે ‘તમે પણ શું એ સંપ્રદાયના છો?’ મેં એમને તરત જ ઉત્તર આપ્યો કે હું બધા સંપ્રદાયનો છું, અથવા બધા કોઈ પણ સંપ્રદાયનો નથી. જે કંઈ બધા સંપ્રદાયોમાં સમાન ઇપથી છે, તેને જે માને છે, તે બધા સંપ્રદાયોને સ્વીકારવાનો દાવો કરી શકે છે. અને જે કંઈ એક ખીણથી વિરુદ્ધ છે, તેને નહીં માનતારાનો બધા તિરસકાર

કરી શકે છે. સમાજમાં કાંતિ કરવાની આકંક્ષા રાખનારાઓ માટે આ તિરસકાર જ સરુથી મોટા પુરસકાર છે. તેથી એવા કાંતિકારીઓએ એ લોકાપવાદને અમૃત માનીને, પોતાના લક્ષ્ય પર અડગ રહીને, સ્વીકૃત ભાગ્ય પર આગળ જ વધ્યા કરવું જોઈએ.

### નક્કર સંસ્થા

મને એમાં જરા પણ સંદેહ ક શંકા નથી કે અણુઓંબ અને હાઈસ્ક્રોઝન બોંખના આ જમાનામાં અણુવતી-સંધ જેવી એક નક્કર સંસ્થાની આવશ્યકતા માત્ર આપણા દેશને જ નહિ, પરંતુ એ મહાયુદ્ધોના લીધણું આધાતથી અલાંત ધવાચેલા વિશ્વની સમર્સત દુઃખી જનતાને પણ છે. બધા સંપ્રદાયે! અને ધર્મમાં જે કંઈ ઐષ્ટતમ સારભૂત તરવ છે, તેનો સમાવેશ સંધની લગભગ ૮૦ પ્રતિશત્તાએ અથવા સૂત્રોમાં થઈ જય છે. આ સૂત્રોને માનવ જીવનની એવી રૂપરેખા કહી શકાય તેમ છે કે જેનો સ્વીકાર બધા ધર્મો, સંપ્રદાયો, વર્ગો, જાતિઓ, દેરોં અને રાષ્ટ્રોના લોકો કોઈ પણ બેદ કે સંક્રાચ વિના કરી શકે છે.

### પૂર્વ અને પરિચયમની દર્શિ

ભાઈઓ અને ભહેનો !

પૂર્વ અને પરિચયમની દર્શિમાં સહુથી મોટા મૌલિક તફાવત એ છે કે પ્રથમની દર્શિ અંતરંગ છે, જ્યારે ખીજની દર્શિ અહિરંગ છે. આ ખીજ પ્રકારના લોકો બધી સમસ્યાઓને ભાલ્ય દર્શિએ જ જુઓ છે. અમેરિકને પોતાની રક્ષા માટે આટલાંટિક મહાસાગરના આ કિનારે થૂરોપના દેરોમાં કિંદેખંદી કરવી આવશ્યક જણ્ણાય છે. ખીજ બાળુ તે પ્રશાંત અને હિંદી મહાસાગરમાં મથકો જમાવવાનું આવશ્યક સમજે છે. તેને એ વાતની ચિંતા કે શીકર નથી કે તેમાં કેટલા નાના મોટા ખીજ દેરો કીડાની ભાડુક અગદાઈ જશે. એ મહાયુદ્ધોમાં લાએ.

માનવનું અલિહાન આચ્છા પણ આ લોકો કંઈ શાખ્યા નથી. તેઓ પોતાના એ જ માર્ગ પર અસર્ખાતિત ગતિએ નિરંતર ચાલ્યે જ જય છે. વિનાશની નવામાં નવી અને ભીષણુમાં ભીષણ શોધોના હિલ કે પાવનારા સમાચારો યમરાજના સંદેશ રૂપે દર ચાર-૭ માસે સાંભળવામાં આવે છે. ઇઝવેલ્ટ, ચર્ચિલ, સ્ટેલિન, હિન્દુર, મુસોલિની, ટોને અને તેમના જેટણા પણ સાથીએ છે. તે બધા ઈંધર, ધર્મ અને શાંતિના નામે જ આ બધું કરતા હતા. આજે પણ તેવા નામે જ બધું કામ ચાલી રહ્યું છે અને અણુભોંઅના ગર્ભમાંથી વિશ્વશાંતિને જન્મ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ આજે પણ મનુષ્ય ઈંધર, ધર્મ અને શાંતિથી તેટલો જ દૂર છે કે જેટણો તે વિશ્વયુદ્ધમાં અને તેની પહેલાં હતો.

પશ્ચિમની વિચારધારા અને જુદા જુદા વાહો યુદ્ધવિપ્યક શોધોની આદળા નિર્ણય જવાનું મુખ્ય કાગળું એ છે કે તે મનુષ્યની અંદર હુદ્દાઈ રહેલી મહત્વાને ન જગાડતા તેને બલારથી છાંજેકરણ મારવાનો પ્રયત્ન કરે છે. એમના પ્રયત્નનું ધ્યેય વક્તિ કે તેનો આત્મા નથી. પરંતુ સમાજ અથવા સમાજ છે કે જેની આગળ વક્તિનું નથી તો કોઈ અસ્તિત્વ કે નથી કોઈ મહત્વ. આજે સમાજનું સ્થાન પણ રાષ્ટ્ર લઈ લીધું છે. આ રાષ્ટ્રવાદ પણ—જેમાં વક્તિ માત્ર તોપ-અન્દુક અને ગોળાચોનો ઘોરાક બની ગઈ છે—કેટલું ભીષણ રૂપ ધારણ કરી રહ્યો છે ? જે ધર્યા, દ્વાષ, વેમનસ્ય તથા કાલુષ્ય માત્ર અમુક વ્યક્તિએ પૂરતાં મર્યાદિત હતાં, તે રાષ્ટ્રવ્યાપી બની ગયાં છે. એનું પરિણામ એ આવ્યું છે કે ધાત-પ્રતિધાત અને હિસા-પ્રતિહિસામાં પડી ગયેલો આજનો મનુષ્ય પોતાના હાથે જ પોતાના વિનાશની ચિતા રચવા લાગી ગયો છે. અને આચર્ય તો એ છે કે આ મૂર્ખતાપૂર્ણ વિનાશને જીવન માની લેવામાં આવ્યું છે. યુદ્ધમાં શાંતિ અને વિનાશમાં જીવન માનવનારા પશ્ચિમના મનુષ્યને યુદ્ધ અને શાંતિ ક્યારે, કેમ અને ક્યાંથી ભળી શકે ?

## આપણી માન્યતા

આપણી માન્યતા પશ્ચિમની આ માન્યતાથી સર્વથા લિન્ન છે. આપણે એમ માનીએ છીએ કે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં મહાનતા છુપાયેલી છે, જે પશુતા મનુષ્યના સર્વ અંગ પર છવાઈ જવા દુંચે છે, તેનો પ્રતિકાર આ મહાનતાને જાગૃત કરવાથી જ થઈ રાડે છે. તેથી આપણા બધા ધર્મો, બધા સંપ્રદાયો, બધા ધર્માચાર્યો અને બધા મહાપુરુષો મનુષ્યની આ સ્વાભાવિક મહાનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. ‘ઉઠો, જગો અને ત્રણતાને પ્રાપ્ત કરો’ ની વોષણા સંભવતઃ દુનિયામાં લારથી સંભળાઈ રહી છે, જ્યારથી આ સૂષ્ટિમાં મનુષ્યે પોતાની આંખો ઉઘાડી છે. જરા કદ્યના તો કરો કે નિર્જવ જણાતા અણુમાં પ્રલય મચાવનારી લયંકર શક્તિને જગાડનારા માનવ આત્માર્મા કેટલી પ્રયંડ શક્તિ કેટલી તેજસ્વિતા અને કેટલી મહાનતા છુપાઈ રહેલી હશે? આ અણુવતી-સંધ એ શક્તિને જગાડવાનો એક વિનાન્દ્ર પ્રયાસ કરવાનું દુંચે છે. જે અણુ અને હાઠડોજનની શક્તિને લગતી શોધાઓને વિજ્ઞાનનાં જગતમાં મહાન કાંતિનું નામ આપી શક્યા છે, તો આત્માની આ અદ્ભુત શક્તિને જાગૃત કરનારા અને મનુષ્યની આ રીતે શુદ્ધ કરનારા પ્રયત્નને કાંતિ અને પ્રાથમિક કાંતિ તું નામ કેમ ન આપી શક્ય? અણુવતી-સંધ આ દર્શિથી એક મહાન કાંતિકારી પ્રયોગ છે. માનવની મહાનતાને દાંકી દેવાનો પ્રયત્ન કરનારી પશુતાનો એક સથલ અને સુનિશ્ચિત પ્રતિકાર છે. અનૈતિકતા તરફ લઈ જનારા વોર અંધકારને દૂર કરનારી એક દિવ્ય પ્રકાશ છે. અનાચાર અથવા ભ્રષ્ટાચારના ઊંડા ખાડામાં ઉધા મોઢે ગખડાવી પાડનારી કુપ્રવૃત્તિઓથી બચવાનો સીધો માર્ગ બતાવનારી એક સુસ્પષ્ટ ચેતાવણી છે.

## વિશ્વનો કાયાકલ્પ

પ્રત્યેક મનુષ્યનો આત્મા જયારે આ રીતે જગી ઉંશો, ત્યારે સમાજ, રાજ્ય તથા વિશ્વનો કાયાકલ્પ થઈ જશે. તેથી આ નાના સરખા પ્રયત્નમાં

પણ વિશ્વનો કાયાકદ્વારા કરવાની મહાન શક્યતા છુપાયેલી છે. આપણી આજની કદમ્પનાઓનું સ્વર્ગ નાનું હોઈ શકે છે, પણ તેનાથી પ્રેરાયેલા પ્રયત્નોનું આવતી કાલે આવનારું પરિણામ આપણી તે કૃકદ્વના કરતાં સેંકડોગુણું-હજારોગુણું વધારે ભોડું, વિશાળ અને બ્યાપક હશે તેમાં કોઈ શક નથી. આ અદ્ધા, વિશ્વાસ અને આશાથી આપણે આપણા આ પ્રયત્નમાં નવેસરથી ઝુકી પડવાનું છે. એ જ આપણા આ અધિવેશનનું લક્ષ્ય છે.

### ભાગ્ય બંધનની અસરદિલતા

એક વર્ષત એવો હતો કે જ્યારે વ્યક્તિપર ધર્મ અને સમાજ વ્યવસ્થાનો અંકુશ અહુ કડક હતો. આજે રાજ્યનો અંકુશ ચારે બાજુ ફેલાયેલો છે. સરકારી કાયદાઓને બધી ભીમારીઓની રામાણુ દવા માનનારાઓની આંખો પોતાના દેશની આજની સ્થિતિથી ઉધરી જવી જાઈએ. રાજનીતિમાં મહાત્મા ગાંધીના સલ્ય અને અહિસાના મહાન પ્રયોગને હસી કાઢનારાઓએ અને સ્વરાંજ્ય મળી જતાં સરકારી કાયદા-એની જાહુરી લક્ષીથી સર્વ કંઈ ચપડી વગાડીને કરી લેવાની શેખાઈ કરેનારાઓએ પણ આજે એ જોઈ લીધું છે કે સરકારી કાયદાઓ જાંખ્યામાં નેટલા વધતા જાય છે અને નિયંત્રણમાં નેટલા કંડોર બનતા જાય છે, તેટલાજ પ્રમાણુમાં અનીતિ કાળાભાજર, ખષ્ટાચાર, લાંઘિશ્વત અને અનાચાર વધી રહ્યો છે. ધર્મનાં બંધનો અને સમાજની વ્યવસ્થા શિથિલ પડી જતાં અને સરકારી કાયદાઓનું દેવાળું નીઊળતાં માત્ર એક જ માર્ગ બાકી રહ્યો છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાને માર્ગ કંઈક બંધન, વ્યવસ્થા, મર્યાદા અથવા નિયંત્રણનો સ્વીકાર કરે અને સંચ્ચાઈ તથા ધ્રમાનદારીથી એનું રૂપાલન કરે. અણુગ્રતી-સંધની સ્થાપનામાં આ જ મૂલભૂત તત્ત્વ છે. પ્રત્યેક અણુગ્રતી સ્વયં પોતાનો સાક્ષી છે, સ્વયં શિધ્ય અને ગુરુ પણ છે. સંસારી મનુષ્યમાં આ સહજ અને સ્વાભાવિક ભાવનાને જાગૃત કર્યી એજ અણુગ્રતી-સંધનું

સંસ્થા અને સંગડનના રૂપમાં સહૃદી મોકું કામ છે. એટલા માટે જ આહિસા, સલ્ય, અસ્તેય, બળચર્ચ અને અપરિગ્રહના ગ્રત પાલનની નિષ્ઠા ને વ્યક્તિગત જીવન હોવું જોઈએ, તે આ સંસ્થા અને સંગડનનો મૂળભૂત આધાર છે.

### રાજ્યીય ઉપયોગિતા

આપણા લોકશાહી રાજ્યે પોતાના માટે સંપ્રદાયનિરપેક્ષ આદર્શનો સ્વીકાર કર્યો છે. તેના એ આદર્શને પુષ્ટ કરવા માટે એવી સંસ્થાઓ અને સંગડનોની ખાસ આવશ્યકતા છે. ને સંપ્રદાયની સંકીર્ણતા, અનુદારતા અને અસહિષ્ણુતાથી તદ્દન રહિત હોય. આપણી આ સંસ્થાનું સ્વરૂપ એવું જ છે. સર્વે ખર્મો, સંપ્રદાયો, વર્ગો અને શ્રેણીઓના લોકો માટે એનો માર્ગ ખુલ્લો છે. આજે પણ એમાં બધા લોકો સામેલ છે. તેથી રાજ્યીયતાપ્રધાન પ્રવૃત્તિ ન હોવા છતાં આ સંઘ રાષ્ટ્રનાં શક્તિ અને બધામાં અભિવૃદ્ધિ કરનારો છે. રાજ્યીય દર્શિએ પણ એની ઉપયોગિતા નિર્વિવાદ છે.

કેટલાક લોકોને એ વાતનો વાંધો છે કે એક ખાસ સંપ્રદાયના આચાર્ય જ એના નાયક કેમ છે? તેઓને એમાં સાંપ્રદાયિકતાની ગંધ આવી રહી છે. તે સંબંધી એટલું જ જણાવવાનું કે આચાર્યશ્રીના વિચારો અને ઉપરેશોમાં સાંપ્રદાયિકતાની છાયા જરા પણ નથી. તેઓ એનો નિરંતર વિરોધ કરી રહ્યા છે. આચાર્યશ્રીએ પોતે જ આ સંસ્થાને અસાંપ્રદાયિક આકાર આપ્યો છે. તેઓ તો તેરા પંથને પણ એક સંપ્રદાય ન ગણુંતાં એક કાંતિ માની રહ્યા છે. તેઓ એને મારી પંથ ન કહેતાં તેરા પંથ એટલે ભગવાનનો કે માનવનો પંથ કહે છે. તેથી એવી કાઈ આશાંકા કે સંદેહ પ્રગટ કરવો નકામો છે. ભગવાન કૃષ્ણને પણ છેવટે અજૂનને કહેવું પડ્યું હતું કે ‘મામેક શરણ વ્રજ’ તે ‘મામેક’ માં નેને સંકીર્ણતા કે સાંપ્રદાયિતા દેખાતી નથી, તેમણે આ સંસ્થા અને સંગડનના આ સ્વરૂપમાં પણ ભંદેહ કે રાંકા

કરતા ન બોધાયે અને તેને સફળ અનાવવામાં પોતાનો પૂરો સહકાર આપવો બોધાયે.

હું કરી એક વર આપ અધાનું હાર્દિક સ્વાગત કરે છું.

## આણુપ્રતી-સંઘની સ્થાપનાનું મહત્વ મુનિશ્રી નથમજુનું ભાષણ

સ્વાગત-ભાષણ પછી અણુપ્રતી-સંઘની સ્થાપનાનું મહત્વ દર્શાવતાં મુનિ શ્રી નથમજુનાએ પોતાના હૃદયાદી મર્મસ્પર્શી ભાષણમાં કહ્યું કે—

અણુપ્રતિદિના યુગમાં અણુપ્રતી-સંઘની સ્થાપના એક મહત્વ પૂર્ણ બટના છે, એ જૌતિકતા પર અધ્યાત્મનો વિજય છે. માનવ જુદા જુદા સંગઠનો, જીતાયો અને વર્ગમાં રહેતો આવ્યો છે. જ્યારે જ્યારે જેવી આવસ્યકતા હોય છે ત્યારે ત્યારે તેવો જ સમૂહ બને છે; એ હિસ્સ આગળ કે પાછા. આ સંઘનું સ્વરૂપ શાશ્વતિક છે. છતાં એનું વર્તમાન સ્વરૂપ સામયિક આવસ્યકતાનું પરિણામ છે. અનૈતિકતાથી ઉદ્દેશિત માનવનો સ્વર ધીમો અને ઠંડો પડી ગયો છે. શ્રદ્ધા અને કર્મનો મેળ રહ્યો નથી. કથની અને કર્ણથીમાં પૂર્વ અને પરિચયમ જોટલું અંતર છે. સત્ય માન શાનનો વિનોદ જ રહી ગયું છે. શુષ્ક તર્કવાદના આડામાં હૃદય વિલીન થઈ ગયું છે. ભારતીય તત્ત્વવિદ્યાએ કંદુ છે કે સખની શોધ અને આચરણ એ પૂર્વમાર્ગ છે. શાન પાંગળું છે, કર્મ આંધળું. શ્રદ્ધાને મસ્તક હોતું નથી, શાનને હૃદય. પૂર્ણ બનતું હોય તો બધાને સમન્વય કરીને ચાલો. ચાલનારો થોમી જવાને છંચિતો નથી. એને ઇક્ષા એક હિસા કે સંકેત બોધાયે. આચાર્ય શ્રીતુલસીએ તે તમને આપેલ છે. સેંડડો અક્ષિતાએ ચાલવાને તૈયાર થઈ છે. ગૃહસ્થાએ જૌતિક દુનિયાના ભગમગાટમાં રહેવા છતાં, જે ૬૬ સંકલ્પ કર્યી છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.

હું છાયણું છું કે આ પ્રવૃત્તિઓ દાખિંગાળુમાં પવિવર્તન જાવે. ડાખિંગ મેરી છે. એથી જીવન સુધરતું નથી. સુધરણા કોઈ બાબુ વરતું નથી. તે આત્માની અંતર્ગત પ્રવૃત્તિ છે. કાર્ય દદ ભાવનાની મર્યાદા તોડી શકતું નથી. લોડા કહે છે કે બુરાઈઓ બહુ વધી ગઈ એ ચાચું પણ છે. પરંતુ તે છેક્યાં? એ પણ વિચાર્ય હશે? જરૂરમાં કોઈ બુરાઈ હોઈ શકતી નથી. જે ભજાઈ કરવાનું જણુતા નથી તે બુરાઈ પણ કેવી રીતે કરે? ભજાઈ અને બુરાઈનું પંત ખીજને માનવા એ ભૂત છે. તેથી આપણા ઋષિઓએ ‘સંપિકરણ અધ્યગમશ્વરાણ’ ‘પોતે જોતાને જ જુણો અને સુધારો’ એવો ઉપદેશ આપ્યો. અથુતી સંધનો આધારસ્થય એજ છે. એને સમજુ લેવાથી દુનિયાની કોઈ સમસ્યા મુંઝી રાકશે નહિ, એવો મને વિશ્વાસ છે.

### શુલ-સહેશ

સ્વાગત મંત્રી શ્રી સત્યહેઠ વિદ્યાર્થ કારે અધિવેશન અંગે આવેદા સહેશાએ સ ભળાવતાં કણું કે આપણે અધિવેશનનું કાર્ય આ સ્વરૂપમાં જલદી શરૂ કરી શકયા નહિ. સ્વાગત સમિતિ તરફથી નિમંત્રણે! મોકલવામાં બહુ વિદાંય થઈ ગયો. આપણા બડા પ્રધાન પંડિત જગતાદ્રલાલ નેહળણે આપણા પર એ પત્રો પાડવ્યા છે અને બન્ને પત્રોમાં સમયના અભાવથી હાજર રહેવાની તથા વિસ્તૃત સહેસો મોકલવાની આશક્તિ પ્રકટ કરી છે. આચાર્યશ્રી એ દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિની વિનંતિથી ‘ગવનર્મેન્ટ હાઇસ’ માં પદ્ધાર્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદભાઈની સાથે અનેક ચિંઠા પર અને ભાસકરીને અથુતી-સંધની આખતમાં ઘણો વાર્તાવાપ થયો. રાષ્ટ્રપતિ આ સંધ પ્રત્યે ઘણી અભિરૂચિ ધરાવે છે. તેઓએ સફ્ફૂલતાની આશા રાખતાં એવો અભિપ્રાય પ્રગત કર્યો કે પ્રચાર, ઉપહેસા અને સહિષ્ણુતાથી તેઓનો સહેલ દૂર કરો કે જેઓને આમાં સંકીર્ણ સાંપ્રદાયિકતા નજરે પડે છે. કાલે અમે શિક્ષા મંત્રી મૌજાના અસુલ કવામ આજના સાહેબને ત્યાં ગય હતા.

શિક્ષાપ્રેમી પ્રો. હુમાયું કંઈપુરને પણ મળવાનું થયું. મહાસભાની કારોભારીની એક તથા અન્ય કાર્યોનાં કારણે તેઓએ અહીં પધારવાની અશક્તિ જાહેર કરી. તે પણ અમને કેટલાક સહેશાઓ પ્રાપ્ત થયા છે. ને ખીજી પ્રાપ્ત થશે એવી આશા છે. તે બધા આપ અધિવેશનના વૃત્તાંતમાં વાંચી શકશે. શ્રીયુત રાજગોપાલાચારી, મુખ્યમંત્રી ગવર્નર್ચરાજ મહારાજસિંહ, વડા પ્રધાન શ્રી બાલ ગંગાધર એર, ઓરિસાના તત્કાલીન વડા પ્રધાન શ્રી હરિકૃષ્ણ મહેતાબ, શાંતિનિકેતનના શ્રી ગુરુદ્યાલ મલ્લિક તથા અન્ય સજ્જનોના સહેશાઓ તેમણે વાંચી સંભળાવ્યા.

પ્રાપ્ત થયેલા બધા સહેશાઓ આ વિવરણના છે પરિશિષ્ટમાં આપેલા છે.

### સંક્ષિપ્ત વાર્ષિક કાર્ય-વિવરણ

મુનિશ્રી નથમલજી સ્વામીએ સંધની પ્રગતિનો નીચે જણાવેલો હુંબાલ વાંચી સંભળાવ્યો :—

- સંવત ૧૯૬૮ ના ભાદ્રવાં માસમાં જ્યારે આચાર્ય શ્રીતુલસીના અભે શ્રી નૈન વૈતાંબર તેરાપંચ સંસ્થાના આચાર્યપદનો ભારે ખોજે આવ્યો, ત્યારથી તેઓનું વૈયક્તિક લુચ લોકલુચનમાં પલટાઈ ગયું. બાબીશ વર્ષના એક નવુદ્વારાન હોવાના કારણે તેઓના વિચારમાં નવીનતમ કાર્યક્રમ અને કાર્ય કરવામાં અભિનવ ચેતના. અને અભિનવ સ્કૂર્ટ હતી. ફૂલ એ આવ્યું કે થોડા જ વર્ષોમાં લાઘે મતુષ્યોના હૃદય પર તેમના અદ્દર લાનોની રેખાઓ અંકિત થઈ. અનીતિના ધોર અંધકાર તરફ જઈ રહેલી જનતાને એકાએક પ્રકાશ જ દર્શિગોચર થવા લાગ્યો. જુદા જુદા પ્રાંતોના અનેક વિષ્યાત વિચારક પુરુષો તેઓની સામે પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા કે. “આજે ભારતની જનતાનું જે નૈતિક પતન થઈ રહ્યું છે, તેને ક્ષીધ.

અટકાવવા માટે કોઈ જુવંત પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. એના માટે દેશના ધર્માચારોએ વધારેમાં વધારે જ્ઞાનાર છે. આજના યુગની રંગદંગ જેતા આ સંખંધમાં તે ધર્માચારોની પાસેથી વધારે આશા રાખવામાં આવે છે કે જેઓ સાંપ્રદાયિકતાથી તહુન દૂર અને સાર્વજનિક વૃત્તિના પૂર્ણિદેપે પોષક હોય. આપમાં અમને આવશ્યક બધી શક્તિ-એનો પૂરેપૂરો સમન્વય દેખાય છે. તેથી આપ કોઈ વ્યવસ્થિત યોજનાથી જનતાના જુવનમાં ધર્મજીનો ફેરફાર કરવાનો પ્રયત્ન કરો.”

આ રચનાઓથી પ્રેરાધને વિં સંં ૨૦૦૩ માં નૈતિક નિયમોનો એક તેરસ્કૃતી કાર્યક્રમ જનતાને માટે તૈયાર કરવામાં આવ્યો. એક વર્ષના પ્રયત્ન પછી લગભગ ત્રીશ હજાર વ્યક્તિઓએ એ તેર નિયમોનો સ્વીકાર કર્યો. આ સુંદર પરિણામ જ જનતાની સુધુમ આધ્યાત્મિકતા ( નૈતિકતા ) નું પ્રતીક હતું કે જે આચાર્યવરે આ દિશામાં પગલું લારતાં આવ્યું હતું.

આ રીતે પોતાના તેર વર્ષના અનુભવોના આધાર પર સાંગોપાંગ આધુનિકી-સંબન્ધના નિયમ-ક્રિપનિયમોની સંકળના કરી વિં સંં ૨૦૦૫ ના ઝાગણું શુદ્ધ ર ને રોજ સરદાર શહર ( રાજસ્થાન ) માં એની સ્થાપના કરવામાં આવી.

### સ્થાપના-સમારોહ

પ્રાતઃકાલનો મંગલ અવસર હતો. આચાર્યવર શુભવેપોપેત કાંઈ પણ પર વિરાજમાન હતા. એક બાજુ સાંધુ સમાજ અને ધીજી બાજુ સાધ્યી સમાજ ગંભીર મુદ્રામાં ઐડો હતો. ચારે બાજુ સ્થાનિક તથા અહારથી આવેલાં હજારો સ્વીપુરુષો આચાર્યશ્રી તરફ ધ્યાન લગાવીને તેમનો પવિત્ર સંદેશ સાંભળવાને આતુરતાથી ઐડો હતા. ચાર સાધ્યીઓએ ઉલા થઈને શાંત-સ્વરથી મંગલગીત ગાયું અને ત્યાર બાદ આચાર્યવરે પોતાની ગંભીર વાણીમાં ઉદ્ઘાટન-ભાષણું પ્રારંભ

કંદો. તેઓ શ્રીએ પોતાના ભાગણુભાં અણુપ્રતી-સંઘની આવસ્યકતા, ડિદ્ધેશ્ય અને તેની રૂપરેખા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો. તે ઉદ્ઘાટન સહેશ “ અણુપ્રતી-સંઘ અને અણુપ્રત ” પુસ્તિકાના પૃષ્ઠ ૬ પર છ્યાયેલો છે. ઉદ્ઘાટન ભાગણું પણી ખહેલો. કાર્યક્રમ મંગલ-ભાવના સાથે સમાપ્ત થયો.

થીને કાર્યક્રમ સવારના લગભગ નવ વાગ્યે શરૂ થયો. કમરાઃ વિધાન અને અણુપ્રત, જે હજુ સુધી અપ્રકાશિત હતા, તે વાચ્યા સંભલાવવામાં આવ્યા. પતોની સુગમતા, કદિનતા અને નવીનતા વગેરેને લીધે લોકાનાં હર્ષ, ભય, કુતુહલ, વિજાસા આદિ જુદા જુદા ભાવો અને જુદા જુદા રસોનો જાળું ઉદ્રેક થઈ રહ્યો. એ પ્રમાણે બાંને કાર્યક્રમ પૂરો થયો.

ત્રીને કાર્યક્રમ મધ્યાહ્નના ૧ વાગ્યે શરૂ થયો. તાપ કોરથી પરી રહ્યો હતો. છતાં જનતા જીવટી પડી. પ્રતિશાઓ અણુણ કરવાનું કાર્ય શરૂ થયું. પ્રતોની કદિનતાને બેતા ધણા ખરા અવલોકનકારોનું માનવું એમ થયું હતું કે આ જનતા કદિન પતોનું પાલન કરનારા તો હજારોની સંખ્યામાંથી પાંચ-દશ જણ્ણા ૧૨ નીકલરો. પરંતુ જ્યાં નામ જાહેર કરવાનો આઆર્યશ્રીનો આહેશ થયો કે એક એક કરતાં ૭૫ વ્યક્તિઓ અણુપ્રતી બનવા માટે ઉભી થઈ. પહેલા પ્રસંગે ૧૨ ગ્રાન્ટ થયેલી આ આશાતીત સફલતા અણુપ્રતી-સંઘની ઉજાજવલ ભવિષ્યની સૂચક હતી.

આચાર્યવરે તેઓને શાંતરસથી ભરપૂર હૃદયરપશ્ચાં પવિત્ર સહેશો આપો અને બાર માસ સુધી નિયમ-કિર્પનિયમના પાલનની પ્રતિશાઓ અણુણ કરાવી. અગણ્યિત નર-નારીઓના જ્યથોષ સાથે ઉદ્ઘાટન-સમારોહ આનંદપૂર્વક સમાપ્ત થયો.

પણ એ દિવસ સુધી અનેક વક્તાઓના અણુપ્રત સંખ્યાંથી ભાગણ્ણો. થતાં રહ્યાં અને જનતાને યથોચિત પ્રકાશ મળતો રહ્યો.

## પ્રચાર

જનતામાં જેમ જેમ બતોનો પ્રચાર થયો, જેમ જેમ અનેક વ્યક્તિઓ અણુગતી જનવાને માટે આવવા લાગી. પાંચ કે દસ દિવસમાં જ્યારે પણ લોકોની ભાગશી થતી, ત્યારે ત્યારે ‘ગતશ્રદ્ધાનું’ આયોજન કરવામાં આવતું; નિયમો સંભળવવામાં આવતા અને ગતશ્રદ્ધા કરનારાઓનાં નામ લખી લેવામાં આવતાં, એ રીતે ડાઈ આયોજનમાં દસ, ડાઇમાં દોસ અને ડાઈ ડાઇમાં તેથી વધુ નામો પણ આપ્ત થતાં. આ પ્રકારના આયોજનો સરદાર શહેરમાં થયા અને રતનગઢ, ચૂરુ, ઝોણપુર અને જયપુર વગેરે શહેરામાં પણ થયા કે જ્યાં જ્યાં આચાર્ય-વરનું શુભાગમન થયું. આજ વૈશાખ શુદ્ધ ૧૨ સુધીમાં ૫૦૮ વ્યક્તિ પોતાના જીવનની અનેક બુરાધ્રાંઓ છોડીને અણુગતી અનેલી છે. એક એક આયોજનમાં આચાર્યવરને બધ્યે કલાક કેટલો સમય આપવો પડતો અને પોતાના દિવ્ય સંહેશથી જનતાને નૈતિક-અનુરાગ તરફ વાળવી પડતી હતી. વ્યાધીથી સમાપ્તિ તરફ જનારો આ આદર્શ હતો. જુદા જુદા સર્વજનિક ભાગણ્ણામાં આચાર્યશ્રીએ અણુગતી-સંધની રૂપરેખા પર પ્રકાશ પાડ્યો અને નિયય-કીયનિયમો સંભળાવ્યા. પરિણામે જનતાએ સર્વત્ર અણુગતી-સંધનું હાર્દિક સ્વાગત કર્યું. એ ઉપરાંત આ વધે દેશરત્ન ડૉ. રાજેન્દ્રપ્રસાદ, સમાજવાદી પંથના પ્રમુખ શ્રી જયપ્રકાશ નારાયણ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સંચાલક શ્રી જોલવલકર અને જાંતિવાદી સંમેલનના સંચોજક શ્રી એલેક્ઝાંડર આહિ સેંકડો વિશિષ્ટ વિચારક આચાર્યશ્રીના સહવાસમાં આવ્યા, જેમની સામે આ યોજના રાખવામાં આવી. પ્રાય: બધાએ તેનો સ્વીકાર કર્યો. ડૉ. રાજેન્દ્રપ્રસાદ એમાં વધારે રસ લીધો અને કેટલોક સ્વચ્છનાંઓ પણ કરી.

## મુરકેલીએ

અમ અને સમયના પ્રમાણુમાં પરિણામ ઘણું સુંદર છે. પરંતુ કેટલીક મુરકેલીએ નહાવાને લીધી થવો જોઈતો પ્રચાર થઈ શક્યો નથી. એક તો

એનું બેદ્વાટન ફાગળું માસમાં થયું કે જ્યારે આચાર્યવરના સેંકડો શિષ્ય સાધુ-સાધ્વીઓ માહ માસમાં જ તેઓશીના આદેશ અનુસાર જુદા જુદા પ્રાંતોમાં વિહાર કરી ચૂક્યા હતા. તેથી ભારતવર્ષના લિન્ન લિન્ન લાગેમાં વિચરનારા સાધુ-સાધ્વીઓને પ્રચાર માટે આ નવો કાર્યક્રમ આપી શકાયો નહિ. ખીજું આચાર્યવરનું ગયું વર્ષ મોટા લાગે વિહારમાં જ પસાર થયું. તેથી સમયના અભાવે જોઈએ તેવો પ્રચાર ન થાય તે સ્વાક્ષાવિક હતું. એક કારણ એ પણ હતું કે આ ચોજના જનતાને માટે તદ્દન નવી હતી. અધા નિયમોથી વાકેક થતું અને તેમાં દર્શાવ્યા પ્રમાણે આજના આ અનૈતિક વાતાવરણમાં જીવનને ધર્યું એ એઝું મુશ્કેલ ન હતું. હવે જ્યારે જનતાને અણુત્તી સંધનો પૂરેપૂરો પરિચય મળો ગયો છે, ત્યારે એનો પ્રચાર દેશના ખૂલ્ખેખૂલ્ખામાં થઈ રહ્યો છે, માર્ગમાં થતી નડતરો ધીમે ધીમે દૂર થતી જાય છે અને આશા છે કે આગામી વર્ષનું પરિણામ ધણું સુંદર આવશે અને અણુત્તી-ઓની સંખ્યા સેંકડોમાંથી સહસ્રોની અની જશે.

### કેળવણી

આચાર્યશ્રીએ અણુત્તીઓને કેળવવા માટે યથાવસર પ્રયત્નો કર્યા છે. તે માટે કેટલાક ખાસ પ્રસંગો ચોજવામાં આવ્યા હતા. આ પ્રસંગોએ અણુત્તીઓ આચાર્યશ્રીની સમક્ષ પોતે અનુભવેલી કુટીઓનો ઉલ્લેખ કરતા અને આચાર્યશ્રી તેમને નિયમોમાં સુદ્દર રહેવા માટે સાવધાન કરતા. એ સિવાય તેમને ખીજું પણ એક પ્રકારની સામયિક શિક્ષા આપવામાં આવતી, જેના લીધે તેઓ પોતાના જીવનને ઉત્તરાત્તર વિકાસો-મુખ કરવાની પ્રેરણા મેળવતા. એનું પરિણામ સર્વથા સંતોષજનક જણાયું છે. આ પ્રકારના પ્રસંગો સરદાર શહેર, રતનગઢ, ચુરુ, ફંટોફુર, જયપુર વગેરેમાં મળો ને નવ વાર ચોજયા.

## જીવન પર અસર

લોકાને એ પણ એક જિજાસા હોય છે કે ઉત્ત સંઘમાં સામેલ થયા બાદ એકત્રિત થયેલી વ્યક્તિત્વોના જીવન પર શું અસર થાય છે ? એનો સીધો ઉત્તર એ છે કે વ્યાપાર કરનારાઓએ આ સંઘમાં આવીને કાળાખંજર કરવાનાં છોડી દીધાં છે, રાજ્યાધિકારીઓએ લાંચ-ઇસ્વત લેવાનું છોડી દીધું છે. અને વિવિધ વ્યસનવાલા લોકાએ પોતાના લંખા સમયના વ્યસનોને છોડી દીધા છે. એથી વધારે અસર શું થઈ શકે ? તેમણે ખધા જ નિયમો રીતસર પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે કેટલીયે વ્યક્તિત્વોએ હજરોની સભા સમક્ષ પોતાના જીવનનું સિહાવલોકન કર્યું છે અને કરેલા પાપોનો પ્રચાતાપ કર્યો છે.

## સંખ્યા

હવે કેટલાક એવા આંકડાઓ આપવામાં આવે છે, કે જેનાથી આખુંતી-સંધની વ્યાપકતા તથા સાર્વજનિકતાનો પરિચય મળી જશે.

સંખ્યોની કુલ સંખ્યા—૫૦૮

તેમાં પુરુષ—૨૬૩

સ્ત્રીઓ—૨૧૫

પ્રાંતવાર જોઇએ તો આ સંઘમાં નીચેનો પ્રાંતોની વ્યક્તિત્વો સામેલ છે :

પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસા, બંગાળ, રાજ્યસ્થાન, મધ્યભારત અને મુંબઈ-

ધર્મ અને સંપ્રદાયની દશ્ટિએ જોઇએ તો આ સંઘમાં નીચેનો બર્ખ કે સંપ્રદાય માનનારાઓ સામેલ છે :

નૈત, વૈજ્ઞાન, આર્થસમાચ, હિન્દુ અને મુસ્લિમાન વર્ગોની દળિએ  
તો તેમાં નીચેના વર્ગો સામેવ છે :

(૧) વ્યાપારી વર્ગ : શરાખી, કાપડ, ર, સોનું, ચાંદી અને અવેરાતનો  
ખાંધી ટરનારા.

(૨) અધિકારી વર્ગ : કારકુન, મુનસદ, ન્યાયાધીશ, પ્રાંત અધિકારી  
( કલેક્ટર ) વર્ગે.

(૩) અન્ય વર્ગ : વકીલ, શિક્ષક, ડૉક્ટર, અનોના સંપાદક વર્ગે.

---

## આચાર્યશ્રીનું ભાષણ

અસંત શાંત અને ગંભીર વાતાવરણમાં-કે જેમાં સોય હું તો તેનો અવાજ પણ સંભળાય-આચાર્ય શ્રીતુલસીએ પોતાના ઉદ્ઘાટન-ભાષણની શરૂઆત કરી ભાષણ હું? એ તે સિહીની ગર્ભના છતી. મનુષ્યને પતનના પથે હોરી બનારી અનેતિકૃતાને ઉત્ત્વિનો રાખે હેખાડનારી નૈતિકતાની જેરદાર હાડવ હતી. સંસારને વિવાસના મુખમાં ધકેલનારા આધુનિક વિજ્ઞાન સામે શાશ્વત ધર્મનો પ્રયંક પોકાર હતો. જવાદામુખીના મુખ પર માયું રાખીને સુધુ રહેલા ગાંધેલ જગતને માટે પ્રાતઃકારીન સર્વના દિવ્ય પ્રકાશનું એક ઉલ્લંઘન દિરણું હતું. અને મહાસાગરના અયંકર તોઝાનમાં રાહ ભૂલી યથેલા જહાનેના જંગી કાઢાને સાચવી રહેલા કણુંધારો માટે પ્રકાશનો એક ર્થંક હતો. તેથી આપું ભાષણ અધૂર્વં શાંતિથી મંત્રમુખ બનીને સાંભળવામાં વ્યાવ્યં અને તેનો પ્રલાવ શ્રોતાઓના હૃદ્યમાં બહુ ઉડે પડ્યો. ભાષણ મૌખિક જ હતું. પરંતુ અહીં તે અદ્દસરને માટે લખાયેલું અને પ્રકાશિત કરાયેલું ભાષણ આપવામાં આવે છે કે કે કે કેના આધારે તે મૌખિક ભાષણ આપવામાં આપ્યું હતું.

આ રહ્યું તે અન્ય ભાષણ :

“ ભુદ્ધિનું દૂલ છે, તત્ત્વચિત્તન અને હેઠનો સાર છે, પ્રત ધારણ. આ ભારતીય દર્શનશાસ્ત્રોનો નિયોગ છે. એક કવિના શબ્દોમાં કહીએ તો—

બુદ્ધે: ફલ તત્ત્વવિશ્વારણં ચ,  
દેહસ્વચ્છ સારં બ્રતધારણચ ।

સંસારમાં પ્રાણીઓ અનંત છે. છતાં આ અનેનો સુદૂર સમન્વય જેવો માનવજીવનમાં થયો છે, તેવો બીજી ડેર્ચ જીવનમાં થયો નથી.

માનવના શરીરમાં કાર્યક્ષમતા છે અને સાથે સાથે બુદ્ધિમળ પણ છે. ભારતીય દાર્શનિકોના સ્વરમાં એજ વાણી ગુંજુ “સસ્તને રોધો અને તેને જીવનમાં ઉતારો.” તેના ઇલસ્વરિપે જ્ઞાનવાહ અને કિયાવાનો પ્રચાર થયો. ભગવાન મહાવીરે એ પ્રકારની પ્રગતા બતાવી-તપ્રગતા અને પ્રત્યાખ્યાન પ્રગતા. તોતપ્રે કે બધું યે જોણો અને હુઃખના હેતુઓને છોડો. પ્રાણીમાત્ર સુખના અલિલાષી છે, કોઈ હુઃખ ચાહતું નથી. સુખ આત્માનો ધર્મ છે, તે બહારથી આવતું નથી. અંતરમાં રહેનારે સુખ બાધ વસ્તુઓના આવરણુંથી દંકયેલું છે—દાયેલું છે, તેને ઓળખવાને માટે—પ્રકારમાં લાવવાને માટે આપણા સત્યશોધક તપસ્વીઓએ એક ઉપાય બતાવ્યો જેને આપણે ધર્મ કહેવા લાગ્યા અને આને પણ કંઈ રહ્યા છીએ.

### ધર્મનું સ્વરૂપ

“ધર્મો મંગલમુકિદે અહિંસા સંજમો તવો”—ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તેનું સ્વરૂપ છે—અહિંસા, સંયમ અને તપસ્યા. આ ત્રિવેણીના પાવન-સંગમમાં મનુષ્યને મનવાંછિત સુખનો લાલ થાય છે. આ માન્યતાના આધાર પર અસંખ્ય નર-નારીઓએ લૂણેસુડો રોટલો ખાઈને તથા ફાયાતૂણાં કપડાં પહેરીને પણ તે આનંદ માણ્યો કે જે વિશ્વસન્નાને પણ મળ્યો રાક્તો નથી. સત્ત્રાટો તે અંકિયન તપસ્વીઓના ચરણુંની ૨૯ માટે તલસતા અને તેમના સુખવૈભવતી દર્શાવી કરતા. આત્મશાનકા પ્રકારની સામે ભૌતિક વિજાનનું નક્ષત્ર તેનેહીન જણાય છે.

સમયનું ચક્ક ફરી રહ્યું છે. તેમાં આરોહ-અવરોહ, ઉતાર-ચન્દ્ર અવશ્ય થાય છે. એ ચક્ક ધૂમ્યું અને ભૂતવિજાન પર આવ્યું. આત્મા અને ધર્મ ઉપર દદ આસ્થા ન રેખી. ધર્ણા ખરા બુદ્ધિવાદીઓ ધર્મને કલાક, શોધણું અને સત્યાચારનો અભાડો સિદ્ધ કરવાને ઉલ્લિઠી પડ્યા. તેમના શિષ્ય-પ્રશિષ્યોએ પણ એજ રાગ આલાખ્યો. વિશ્વનું દઘિંદુ છેક ઝાંખું પડી ગયું.

ધર્મનું આચરણ ન કરવું તે એક વાત છે, આચરણ કરવું તે ખીજ વાત છે અને તેને ઉતારી પાડવો એ જીજ વાત છે. ધર્મને દુરુપ્યોગ કરવાથી મોટા મોટા અન્યાય થયા અને થઈ શકે છે. પણ તેથી એ સિદ્ધ થતું નથી કે ધર્મ ખરાબ છે. આપણે ધર્મના નામ પર થઈ રહેલી ઠગાધઓના પોષક નથી; પરંતુ સાથે સાથે ધર્મ જેવી હૈવી સંપત્તિની સાથે ચેડાં કાઢવાનું પણ ધૂંઘૂતા નથી. ધાર્મિક વિચારો અંગે ભગવાન મહાવીરની કાંતિ-ધોષણા આપણી સામે છે !—

“યિસં તુ ણીય જહ કાઢકૂઢ, હણાઈ સત્યં જહ કુળગહીયં ।

એસો વ ધર્મો વિષયોવવનો, હણાઈ વેયાલ ઇવ વિવનો ॥

અવધિથી ગ્રહણ કરેલું શસ અને કાલકૂટ ઐર જેવું ધાતક છે, તેવો જ ધાતક. ધર્મ પણ થઈ શકે છે કે જ્યારે તેમાં કામવાસના અને લાલસાનો ઉત્પાત મચે છે. ધાર્મિક એ ચેતવણીથી અજાણ ન હતા.

### આજનું વિજ્ઞાન

પોતાને ‘ભુદ્ધિજીવી’ માનવાનો આગ્રહ કરનારાઓને અમારો એ અનુરોધ છે કે તેઓ થોડું પાછું વાળાને જુઓ. આને વિજ્ઞાનનો રેંગદંગ કેવો છે ? તેનો ઉપયોગ કેવા કામો માટે થઈ રહ્યો છે ? એની ઝડપ નરસંહારની ભૂમિકા લગોલગ પહોંચી ગઈ છે. પદાર્થ વિજ્ઞાનની દર્શિકા વિજ્ઞાનને કોઈ ખરાબ કહી શકે તેમ નથી. એનો દુરુપ્યોગ નિર્દાને પાત્ર છે.

આપણે તરફથી ભુદ્ધિથી ધર્મ અને પદાર્થ વિજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ.

સુખ-શાંતિને અયેં તથા અંતિમ લક્ષ મોક્ષ પામવાને માટે ધર્મની આવશ્યકતા છે. જીવનની સુખસગવડો માટે ભૌતિક વિજ્ઞાને પણ અનુપ્યોગી કહી શકાય નહિ. દુરુપ્યોગ અંતેનો ખરાબ છે. ધર્મમાં

ચિકારોને વાગ્યદ થેવા બોઇને તેનો નાશ કરવાનું જેણોને સજાયું, તેમો આજે વિજ્ઞાનનો નાશ કરવાનું પણ કદાચ વિચારી રહ્યા હશે; કારણ હે ધર્મની સરળામણીમાં આજે વિજ્ઞાનનો ઉપયોગ ઘણો જ નીચા વોરણે ચાર્ચ રહ્યો છે. એતા ભય કર રહ્યું અતે ખતસનાડ પરિણામોથી આપ્યા ફુનિયા મેતાને મોતના મુખમાં પડેલો અનુભવી રહ્યા છે.

### અષ્ટુષ્ટોંઘર્થી અષ્ટુપ્રત

ધાર્મિકાને માટે અવસર સુંદર છે. તેમો શુદ્ધ ભિન્નિકાળે પહેંચાચીન અહિસા ધર્મની-વિશ્વમૈત્રીની વોધણાને ખુદંડ કરે અને હિસ્ક શક્તિઓને ચેક્ટવણી આપે. ધાર્મિક ડાઢનો નાશ કરવાનું વિચારતા નથી. તેમનું લખ્ય હોય છે—હુસ્પેનો અંત લાવવો. આજના વિચારઓ હિસ્ક પ્રાર્થિત્યો પર અહિસાની હિભાયત કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અષ્ટુષ્ટોંઘર્થી ચાસી ઉડેતા અષ્ટુપ્રતનું શરણ લેશે લયથી ભય વધે છે, હિસાથી હિસા વધે છે, લોભથી લોભ વધે છે. તેના પ્રતિકર માટે કોઈ બીજો જ ઉપાય રોધવો પડેશે.

અધી વ્યક્તિઓની નેતૃત્વ ભૂમિકા સરળી જ રહે, તેવું નથી તો પહેંચા કહી જન્મું કે નથી આજે તેની સંભાવના. લોડા ચરિત્ર શ્રદ્ધાર્થ ગયા—તેજ ચિતાનો વિષય છે, જનતાનું દફિયિન્હ જોડું અર્મ ગયું તે વળી વધારે ચિતાનો વિષય છે, જે દફિયિન્હ સાચું હોય, તો ચરિત્ર-સુધારણામાં બહુ મુશ્કેલી પડતી નથી. પણ તેનોજ અભાવ હોય તે સદ્ગ્યરની આશા કેવી? ‘મૂળ નાલિત કુતઃ શાશ્વત?’ એ કહેવત તહીન સાચી છે. ‘અહિસા, શત્રુ અને અપરિશ્રદ્ધી જ સંકટની દ્રષ્ટવ્યો જુસી હોય છે’, એટલું જ જે સમજવામાં આવી જાય, તો પણ સંક્રિત હોય શાનું? શાન અરાધર હોય તો ચરિત્ર-વિકાસ ચ્યામાં વખત લાગતો નથી. સત્યમાર્ગ પર ચાલનારો પોતાની મેળે દુદ્ધ્ય સુધી પહેંચી જાય છે.

મને એ કહેતાં બણો દર્દી થાય છે કે પશ્ચિમના વૈજ્ઞાનિકોનો  
પોતાની દાખિલેની છે. હવે તેમની એક ધર્મ પર અમદ્દ્યો છે. આંદે  
તેઓ વિજ્ઞાનને ભરમાસુર કહેવા સુંધરી પહોંચી ગયા છે. તેમની  
તુલ્યાકારી દાખિલે ચરિત્ર-વિકાસના તત્ત્વાની વધારે ચાહુણા છે. ભારતને  
કરી એક વાર એ તક સાંપરી છે કે જ્યારે તે પોતાના પુરાણા ગૌરવને  
નવીન અનાંદી શકે, પોતાની પૈતૃક મંપત્તિનો ઉપરોગ કરી શકે. ભારતીય  
વિચારકો આનું મૂહાંડન કરે.

### ત્યાગ અને સંયમનો આદર્શ

ભારતવાસીઓની સામે સદાયે ત્યાગ અને સંયમનો આદર્શ રહેલો.  
છે અને આજ પણ છે. મહાનતોની સુંદર વ્યવસ્થા ભારતીય  
વિચારકોની અદ્વિતીય ખુલ્લિપ્રતિલા છે. પરંતુ તે અધાને માટે સંભવિત  
નથી. તેથી આપણા આચાર્યોએ જનસામન્ધ્યને ધ્યાનમાં રાખીને  
અણુવતોની વ્યવસ્થા પણ કરી કે કે સર્વ સાધારણુને માટે સંભવીત  
તથા અત્યંત આવશ્યક છે.

### સંબન્ધી સ્થાપના

આ આવશ્યકતાને ખ્યાલમાં રાખીને એક વર્ષો પૂર્વ મેં અંણુવતી-  
સંબન્ધી સ્થાપના કરી. આ સંબન્ધ સર્વથી અસાંપ્રદાયિક છે કે જેણું રૂપદ્વિ  
વિધાન પાંચમી કલમમાં આ રીતે કરવામાં આવ્યું છે. ‘અંણુવતીમાં  
વિશ્વાસ રાખનારા પ્રત્યેક ધર્મ, પદ્ધતિ, (ડેમ) વર્ણ અને દેશના  
ઝી-પુરષો સંબન્ધના સભ્ય અનવાના અધિકારી રહેશે.’ સાંપ્રદાયિક અને  
ડેમાં ઝગડાયોની સમસ્યા આજીવની વિધમ સમસ્યાએ પૈકીની એક છે.  
વિશ્વનો બણો મેટો લાગ એ રોગથી બેરાયેલો છે. આપણે પ્રાણીમાત્રની  
સમાનતા પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે. બીજા દેશ અને બીજુ  
ડેમમાં જન્મ લેવાથી મનુષ્ય મનુષ્યનો દુઃખના બની શકતો નથી. તે  
વિચારવા માટે માળુસે દર્શાત કાઢવો ફરશે અને હિંદુ તથા હિમાગને  
દાંડા કરવા ફરશે.

પ્રત્યેક ભારતવાસીનું એ કર્તાવ્ય છે કે આ અણુવતોનો તે પોતે સ્વીકાર કરે અને ખીજોમાને પણ તેનો રવીકાર કરવાની પ્રેરણું કરે,

### ભ્રમ-નિવારણ

હાલ સંધના નેતૃત્વનો ભાર મારા પર છે, તેનો અર્થ એવો કરવાની જરૂર નથી કે સંધના સભ્યોને તેરાપંચ સંપ્રદાયના સભ્ય બનવું પડશો. કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખનાર આ સંધનો સભ્ય બની શકે છે, એ ખેલાં રૂપ્યાં કુલ્લોદ્ધિ ગયું છે, હમણાં તેના નેતૃત્વનો ભાર મેં એટલા માટે ઉપાડ્યો છે કે એની પ્રારંભિક વ્યવસ્થા સુદ્ધ બની જાય, સંયમની ચેતનામાં નવકાંતિ આવી જાય. ૧૮મી કલમ અનુસાર યોગ્ય સમય આવતાં તેના નેતૃત્વની ખીજ વ્યવસ્થા પણ કરી શકાય છે. એક વ્યક્તિએ મને પૂછશું—અણુવતી-સંધના નિયમો મને ધણું સારા લાગ્યા. પણ હું એ જણાવાને મધ્યથી ઝું કે સંધમાં દાખલ થતાં શું આપને મારે મારા ધર્માચાર્ય માનવા પડશે? શું વંદના કરવી પડશે? મેં જિતરમાં કહું કે એ કાઈ જરૂરી નથી અને મને એની ભૂખ પણ નથી. મેં જનજીવનને ઉચ્ચે લાવવા માટે આ કાર્ય કર્યું છે અને તેમાં જ હું સંતુષ્ટ ઝું. ૧૬ મી કલમમાં જણાવેલું ગ્રાયબિત આધ્યાત્મિક દંડ વિધિની સાથે સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં બળને માટે કોઈ સ્થાન નથી. ફદ્દ્યપરિવર્તન દ્વારા જ બધું કરી શકવાનો સંભવ છે.

અનુશાસન ( શિસ્ત ) વિના કોઈ પણ સમાજ જીવતો રહી શકતો નથી, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. તેથી અણુવતીએાએ સંધના નિયમ અને અનુશાસનનું પૂરી સાવધાનીથી પાલન કરવું પડશે. સંધના નિયમો તમોએ જોયા છે, જીવનમાં ઉતાર્યા છે. ધણુાખરા એક વર્ષ સુધી તેની સાધના કરી ચૂક્યા છો. એના પર પ્રકાશ પાડું, એની ઉપરોગિતા સહુને સમજવું તો તે યોગ્ય ગણાશે.

## કૂરતાનું પરિણામ

કૂરતા અધા અન્યાયોનું મૂળ છે. કેટલાક કોઈની હત્યા કરે છે અથવા તેમાં ભાગ લે છે; કેટલાક મનુષ્યોને અધૂત માને છે, તેમનો તિરસ્કાર કરે છે. આ અધું આપણા અંતરમાં ખુપાઈ રહેલી કૂરતાનું પરિણામ છે. તમે સમજતા હરો કે કોઈને અસ્પૃષ્ય માનીને તેનો તિરસ્કાર ન કરવાથી શું થવાનું પણ બીજું કંઈ નહિ તો તેનાથી ખુપાઈ રહેલી કૂરતા પર લારે પ્રહાર થરો, અહંકાર ધરી જરો, જાતીય જીવનનું એક ઝૂરું પ્રકરણ સમાપ્ત થરો. મનુષ્યોએ બીજને નીચ માન્યા. આશ્રિતો પર મનકાવતું કર્યું. પશુઓની બાબતમાં કંઈ વિચારું—પણ એટલો સમય જ કચાં છે? શું વર્ગ-સંધર્ષ એમાંથી તો જન્મ્યો નથી? કિયાની પ્રતિક્રિયા થાય છે. તમે એ શાશ્વત નિયમને કેમ ભૂલી જાઓ છો? આત્મહત્યા કેટલું મોઢું પાપ છે? પરંતુ આધ્યાત્મિક જગૃતિના અભાવે તે શાકભાજ જેવી સસ્તી બની રહી છે. પરીક્ષામાં નિષ્ફળતા ભળી, કુદુંખમાં થોડી અણુભનાવ થયો, બાપારમાં કાંઈક ખોટ આવી, કોઈ નાનકડી મુંઅવણું સામે આવીને ઉલ્લિ રહી કે તરત આત્મ-હત્યાનો દરતો લેવામાં આવે છે. ખ્રણું હત્યાનું કામ પણ કંઈ એંધું થતું નથી. અણુન્તી બનવાનો અર્થ છે—આ ખુરાઈઓથી બચવું. અહિસા અણુન્તમાં દાઢ ન પાવો, માંસ ન ખાવું, આગ ન લગાડવી, શિકાર ન કરવો, ગાળ ન દેવી વગેરે અનેક નિયમો છે. એ બધાની ઉપયોગિતા અત્યારે જ હું તમને બતાવી શકું, એ શક્ય લાગતું નથી.

વિશ્વની બ્યવસ્થાનો મૂળ આધાર સત્ય છે. તેની આજે શું સ્થિતિ છે. તે અધા જણોછો. તેથી વિરોધ હું શું કહું? વાતવાતમાં જૂદું છે. ખાવાપીવાની વાતથી માંડીને જીવનની સાથે સંબંધ રાખનારી પ્રત્યેક વાત પર અસત્ય છવાઈ ગયું છે. ન્યાયાધીશ, ખંચ, વજીલ,

સાક્ષી અને ગૃહસ્થ ગમે તેને જુએઓ; અસત્યની માત્રામાં સત્યની માત્રા અદૃશ્ય થઈ રહી છે. જેના પર આ જૂડનો અમલ થાય છે, તે દુઃખનો અનુભવ કરે છે. પણ ભીજના પ્રસંગમાં પાછો તે એ વાતને ભૂલી જાય છે. જેની વસ્તુ ચોરાઈ જાય છે, તેને દુઃખ થાય છે. પણ ભીજના અધિકારીને પચાવી પાડતી વખતે તે પોતાની સ્થિતિ યાદ કરતો નથી. કેવું સારું! જે પ્રત્યેક ખોડું કામ કરતાં પહેલાં માણુસ પોતાની હાવતને જીવાહરણ અનાવી લે લો?

અલિયર્ના વિષયમાં શું કહું? —કેવું કહું? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દરેક સ્થિતિને સુદૃઢ અને સુવ્યવસ્થિત રાખવા માટે અલિયર્ આવસ્યક છે. પૂર્ણ અલિયર્ કરોડ સાધના છે, જ્ઞાન અથલિયર્ પર કાણું રાખવો એ એકદમ જરૂર છે. અપ્રાઇટિક મેયુન, વેસ્યાવૃત્તિ આદિ દુષ્પ્રવૃત્તિઓના કડવાં ઇણથી કોણ અજાણું છે?

મનુષ્યમાં વિવેક હોય છે, ભલાભૂરાનું જ્ઞાન હોય છે પણ સંશોધન-રાક્ષસી સામે આવતાં જ તે અધું ભૂલાવી હે છે. તેથી તે અન્યાયમાં પ્રવૃત્ત થાય છે. અધિક પરિયહ્યે સામાજિક જીવન બોળવાણું બની ગયું છે. તરેણ તરેણની કુરૂદિયોનું પોપણ કરવાને માટે ધન કમાવાની ભાવના પ્રયત્ન બને છે અને તે માટે કાર્ય કે અકાર્ય બધા જીપાયોને અજમાવવામાં આવે છે. ‘કંમી કરો’ એ ધર્મનો મૂળ મંત્ર છે. ભોગ-સામગ્રીને વધારવી એ અયસ્સ નથી. ધર્માનુષ્યની વેદી પર બધા જવડાઓ આપોઆપ સ્વાક્ષા થઈ જાય છે.

શું હું એવી આશા રાખું કે તમે બધા આ તરફ ધ્યાન આપશો?

હું ધર્મયું છું કે આ સંધમાં પ્રત્યેક વર્ગની દરેક વક્તિ જોડાઈ જાય. એનાં દારો બધાને માટે ખુલ્લા રહે. આ લૌટિક વિગાનના

હુરુપ્યોગ અને સાંપ્રદાયિકતાને તિલાંજલિ આપે. એના દ્વારા દરેક મનુષ્યનો જીવનપથ પ્રશસ્ત બને. એ ભાવના સાથે હું મારું વક્તાવ્ય સમાપ્ત કરું છું અને એ વિશ્વાસ રાખું છું કે પ્રત્યેક વક્તિ એને સમજશો, એનું મનન કરશે અને એને જીવનમાં ઉતારવાનો સંદર્ભી પ્રયત્ન કરશે.

---

## પ્રતિ-ગ્રહણ-સંસ્કાર

### નવા સમાજનો પાયો

આચાર્યાંશીના ભાષણુની અસર એટલી ઊડી ધર્મ કે વાતાવરણ મુખ્ય  
કાર્યક્રમને બરાબર અનુકૂળ બની રહ્યું વાતાવરણ અત્યંત ગંભીર અને  
નિસ્તખ હોવા છતાં તેમાં અપૂર્વ ઉત્સાહ સમાયેલો હતો. અજ્ઞુવતી-  
ઓના ચહેરા ઉપર દઢતા અને સ્થિરતાનો ભાવ ઝગડી રહ્યો હતો.  
એમનાં હૃદય પોતાની જવાઅદારીનો અનુભવ કરી રહ્યાં હતાં. સર્વ્યાધ  
અને ધર્માનદારી એમના વિશ્વાસને નવું જીવન અર્પણ કરી રહી હતી.  
છુફ અને પ્રદ્લાદના જેવી વીરતા, ધીરતા અને બંધીરતા એમના  
સંકલ્પમાં સમાયેલી હતી. જેમ ગુરુ ગોવિદસિહે પાંચ ખાગઓને  
અમૃતનું પાન કરાવીને મૃત્યુથી, પણ ન ડરનારા અને સર્વ પ્રકારની  
સાંસારિક આમાઓથી રહિત (આલિસ) ખાલસોને માટે નવા સમાજનો  
પાયો નાખ્યો હતો, તેવું જ કોઈ લભ્ય, આકૃષ્ણ અને મનોરભ્ય દર્શય  
ખરું હતું. વર્તમાન યુગને જેતાં આચાર્ય શ્રી તુલસી વાસ્તવમાં  
એક નવા સમાજનો પાયો સર્વથી વિશુદ્ધ નેતિક આધાર પર નાખી.  
રહ્યા હતા.

શાંત વાતાવરણની નિસ્તખ્યતાનો પોતાના સ્થિર અને ગંભીર.  
દદ અને નિશ્ચિત શખ્દોથી લંગ કરતાં તેરાપંથી મહાસલાના મુખ્ય મંત્રી.  
સમાજ-ભૂષણ શ્રી છોગમલજી ચોપડા ભી. એ. બી. એલે. આચાર્યાંશીને  
પ્રત ગ્રહણ કરાવવા માટે વિનંતિ કરી. તેમણે કહ્યું 'જે આપણા  
જીવનનું નિર્માણ કરનારા અહિસા, સત્ય, અરતેય ખલાયર્ય તથા અપરિ-  
ગ્રહના પ્રતો સાંપ્રદાયિક હોય તો અમને સાંપ્રદાયિક કહેવડાવવામાં પણ  
કોઈ શરમ કે સંકોચ નથી. પરંતુ આ પ્રતો તો મનુષ્યને અંકિયન:

જીવનની મહાનતા પ્રત્યે લઈ જનારા વ્યાપક ગુણો છે. આચાર્યશ્રીને ભારી પ્રાર્થના છે કે અમને આ વરોનો સ્વીકાર કરાવે અને આશિર્વાદ આપે કે જેથી અમે તેને જીવનમાં પૂરા ઉતારી શકીએ.

એ રીતે ભહિલાઓ તરફથી શ્રીમતી લાગીનથીદેવી દસાણીએ નિવેદન કર્યું.

આચાર્યશ્રીએ અણુદ્રાત ગ્રહણ કરનારાં સ્વી-પુરુષોને અંતમુખ થઈને ધ્યાન ધરવાનો આહેશ આપ્યો. કેટલીક મિનિટોની પૂર્ણ નિસ્તબ્ધતા અને શાંતિ પણ મુનિ શ્રી નગરાજજી સ્વામીએ અહિંસા, સત્ય, અસ્તેય, ઘલઘર્ય તથા અપરિગ્રહને લગતી. પ્રતિજ્ઞાએનું કમશઃ વાંચન કર્યું અને હાજર રહેલા અણુનતીએએ પાંચે વાર ઉલા. થઈને તે પ્રતિજ્ઞાએને ગ્રહણ કરી. આચાર્યશ્રીએ પાંચે વાર તેમને ગ્રહણ કરાવવાની મહાન કૃપા કરી. એ સુંદર, મનોહર અને હૃદ્યગ્રાહી દશ્યનો ઘ્યાલ તો નજરે જોનારને જ આવી શકે. હાજર રહેલા નર-નારીએ મંત્રમુખ થઈને આ ખંડું દશ્ય નોઈ રહ્યા હતા.

ખંડી ખીજાં ભાષણો થયાં.

## ખીજાં ભાષણો!

( ૧ )

### જીવનનું નૈતિક માપ

સુપ્રસિદ્ધ વિચારક, લેખક અને કથાકાર શ્રી જૈતેન્દ્રજીએ પોતાના મનનીય ગહિતપૂર્ણ ભાષણમાં કર્યું કે—

આ પ્રસંગે ઐલતાં મને લજણનો અનુભવ થાય છે, લજણ સાથે છર્યાનો પણ. અણુનતી-સંધમાં મારું નામ આપી શક્યો નથી. આપી શક્યો હોત તો સારું થાત. તેમના લાભની હું પ્રશ્નાંસા કરું

છું કે જેઓ પ્રતિજ્ઞા લઈને અણુનતી બન્યા છે. વ્રતીનો માર્ગ સરળ હોતો નથી. તેમાં ખૂબ મુશ્કેલીઓ આવે છે. તે મુશ્કેલીઓને તેઓ પોતે જાણુતા હશે, પરંતુ તે અધીનો તેઓ સામનો કરશે. નતથી ચ્યુત નહિ થઈએ, એવો તેમણે નિર્ભયા કર્યો છે. આ વાત અતિ પ્રશંસનીય છે તેઓની ભાવના જોતાં મને વિશ્વાસ છે કે તેમની પ્રતિજ્ઞા તૂટ્યો નહિ; પણ વૃદ્ધ પામશે અને ફેલાશે. વળી આચાર્ય તુલસીગણી એમની સાથે છે. હું એમને જાણું છું એ મુજબ મને વિશ્વાસ છે કે અણુદાતી બંધુઓને તેમના તરફથી પ્રતિજ્ઞાનું પાલન થવામાં શક્તિ અને પ્રેરણું મળતી રહેશે.

આજની પરિસ્થિતિને સહુ જાણો છો. બ્રહ્માચાર છેલ્લી હુદે પહોંચ્યો છે. પૈસા કમાવાના માર્ગોમાં ભર્યાદાનો વિચાર જ ભૂલાઈ જવાય છે. આ હાલત ખાડામાં પાડનારી છે, પરંતુ ખાડામાં કોઈને પડતું નથી. શ્રી ગુલજારીલાલ નંદાનો એક દરાવ આવ્યો હતો. હું કહી શકું છું કે: તેમાં જે કાર્યક્રમ હતો, તેનાથી આ અણુવતી-સંઘના આદેશ અને નિયમો આગળ વધે છે. આ વધારે વ્યાપક છે, એની ભૂમિકા રાસ્તીય થી આગળ ધાર્મિક છે.

### આત્માનુ શાસન

અધાને અનુભવ થઈ રહ્યો છે કે આજે શક્તા ઢીલી છે. સિદ્ધાંત તો લોકો સારી રીતે જાણે છે. પણ વ્યવહારમાં તે કેવી રીતે મૂકી શકાય તે માટે તેમનું મન ડગમગે છે. તેથી વ્યવહાર પર અંકુશ રહ્યો નથી. તેને નિરંકુશ ચાલવા હેવામાં આવે છે. બહારના ઉપાયો એટલે કાયદા, અને હુકૂમતનો અંકુશ ખરી ભીમારીના ઢિલાજમાં કામ લાગતો નથી. તેથી રોગ મટતો નથી પણ અંદર જાય છે. કાયદાથી બચવા માટે તરેહ તરેહના ઉપાયો શોધી કાટવામા આવે છે અને ખુદ કાયદાપાલનની જવાબદારી ઉડાવનારા અધિકારીઓ તેમાં મદદ કરે છે. અંકુશ અંતરનો:

જ કામ આવી શકે છે, જે સ્વેચ્છાએ ગુહણુ કરેલો હોય. એનું નામ છે આત્માનુશાસન. એ પદ્ધતિથી નૈતિકતાનું પ્રમાણ વધે છે અને બહારની રોક ટોક ઓછી આવશ્યક જગ્યાય છે.

આને અણુભૂત લેનારા લોડા આ દુનિયાના જ આદમી છે. સિદ્ધાન્તી નહિ, પણ વ્યવહારી. બધા કામધંધાવાળા છે. ધણુખરા ધનદાન છે અને મોટા વ્યાપારના માલિક છે. તેઓને દુનિયાનો ત્યાગ કરવાનો નથી. દુનિયામાં રહીને જ ચાલવાનું છે. પરંતુ સાથે ધર્મને પણ રાખવાનો છે અથવા કહે કે ધર્મની સાથે એના હેતુથી દુનિયામાં રહેવું છે. નૈતિક માપથી જીવનને ગાળવું છે નૈતિકતામાં સ્વાર્થનો નાશ નથી. માત્ર તેને પરમાર્થને આધીન રાખવાની ચેષ્ટા છે. આ વાત નાની સૂતી નથી. બહુ મોટી છે. કેટલીકમાં સ્વાર્થ પરમાર્થને પોતાને આધીન રાખવાનો પ્રયત્ન કરતો જેવાય છે.

### સંખ્યા વિરુદ્ધ ગુણુ

હાલમાં અણુભૂતીઓની સંખ્યા છ્સોથી થોડી વધારે છે. પરંતુ આ દેશ તો બહુ મોટો છે. તેના સાગર સમ વિસ્તારમાં આ સંખ્યા ટીપાં જેવી ગણી શકાય. જ્તાં એ ડીક જ છે કે સંખ્યા પર વધારે ધ્યાન નથી અપાયું જો ગુણ પર જ લક્ષ્ય હોય તો સંખ્યા પોતાની મેળે કચાંની કયાં પહોંચી જય છે. મેં જેવું છે કે અણુદ્રોતી-સંધને તેટલો લોલ સંખ્યાનો નથી કે જેટલો લોલ-આગુહ ગુણુનો છે. આ જતની સંખ્યાની અલપતા બહુ મોટાં પરિણામો લાવી શકે છે.

સંખ્યાને વધારે મહત્વ આપનાર આજનું વિશાન છે. અંક ગણિત તેનો આત્મા છે. તેનું સુખ્ય લક્ષ્ય પરિણામ પર જ રહે છે. તે દસ્તિએ મોટા મોટા નકશાએ બને છે. ખાનો ઘડાય છે, મશીનો એકત્ર થાય છે અને કારખાનાંએ ઉભાં થાય છે. તેના જેર પર ઉત્પાદન બહુ મોટા પાયે કરવામાં આવે છે. પરંતુ તેનાથી શાંતિ

અને સુખચેતનાની સુર્ખિનું શર્જન થાય ખરે ? ના, એવું થતું હોય તેમ જેવામાં આવતું નથી—જોઈ શકતું નથી. વ્યક્તિ જરૂર અંક નથી, પણ જીવંત છે—સહૃદય છે. તેના સરવાળા અને ગુણુકારના આધાર પર માનવજગતની સમસ્યાઓનો ઉકેલ થઈ શકે નહિં. આજનું વિજ્ઞાન જે હિંસા-અહિંસા જેવા હૃદય અને ચૈતન્યના પ્રશ્નો પ્રત્યે એકાળજી રાખીને ચાલે છે, તે સમાધાન અને શાંતિનો માર્ગ લાવી શકે, એવી કોઈ સંભાવના નથી.

### આહિસક દર્શનની શોધ

તથી જ પર્યિયમનો વિચારક વર્ગ આજે કોઈ પણ જાતના અપવાદ વિના એવો વિચાર કરવા લાગ્યો છે કે ‘આપણી માપ અથવા મૂલ્યની ફળિ અદ્વિત્વાની જરૂર છે. કારણ કે આધુનિક અર્થશાસ્ત્ર અને તેના આંકડાઓ જીવન વિકાસમાં વધુ કામ આપી શકતા નથી. તેમાંથી તો સ્પર્ધા અને સંદર્ભ આવશ્યક બનતા જય છે અને યુદ્ધ પાણું ડેલાવાને બદલે નાભુક આવતું જય છે. આમ જોઈએ તો કેટલીક સદીઓથી પદાર્થ વિજ્ઞાનના આધારે પર્યિયમનું જીવન ‘ઉન્નતિ’ તરફ જાહેર રહ્યું છે. પણ એ ઉન્નતિની આગળ યુદ્ધ અનિવાર્ય બનીને આવી જ પહોંચે છે. એટલે ત્યાંના વિચારકોને હવે એવો સંશ્યય થવા લાગ્યો છે કે જેને આપણે ઉન્નતિ માની રહ્યા છીએ તે ખરેખર ઉન્નતિ છે કે અવનતિ ? તેમણે આજપર્યત માની લીધેલી ઉન્નતિ સાચી હતી, એ અદ્ધા પણ હવે ડગી ગઢ્યે છે, તેથી તેઓ બીજી અદ્ધાની તપાસમાં છે. હવે તો એવા માર્ગની—એવા ઉપાયની પ્રતિક્ષા થઈ રહી છે કે જે એક જાતિને બીજી જાતિ સાથે એવા સંબંધથી જોડી શકે કે જેનું પરિણામ અથડામણુમાં ન આવતાં સહકારમાં આવે; સંશ્યના સ્થાને સ્નેહ જગૃત થાય. તાત્પર્ય કે એક સર્વોદ્યમી અહિસક દર્શનની આવશ્યકતા છે.

## ધર્મ અને કર્મ

હમણું જ આપણી વચ્ચે ગાંધીજી થઈ ગયા, જેએ સત્યની પ્રતિના અને અહિંસાનું સાધન લઈને ચાલ્યા. તેઓ લૌકિક દિને પણ બીજા કરતાં ઓછા સફળ નથી થયા. સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નોને તેમણે સત્ય અને અહિંસાની નીતિ દ્વારા ઉકેલ્યા છે. તેમના જીવનકાળમાં આપણું બધાને લાગ્યું કે સત્યનો આગ્રહ અને અહિંસાની સાધના સિદ્ધાંત કરતાં યે વધારે તો બ્યાવહારિક છે. તે શાસ્ત્રીય છે, પરંતુ તેનાથી યે વધારે તો માનવીય છે. તેનો ઉપયોગ તાત્કાલિક છે. આજના સવાલોને આજુએ રાખીને તેની શોધ થઈ શકે નહિ અને તેને બાજુએ રાખીને આજના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે નહિ. સિદ્ધાંત અને બ્યવહારને જુદા પાડવા એ ભયંકર છે. અને તેમાં જે અંતર છે, એથી તો અદ્ધા અને પ્રયત્નને વધારે બળ મળતું જોઈએ.

પરંતુ લોકો માનવા લાગ્યા છે કે ગાંધીજીનું જીવન તો એમના સાથે ગયું. એની ખૂબી તો એમના જીવતા સુધી જ રહી. હવે તે વાત આગળ ચાલવાની નથી. માનો કે આપણું અધિકાર પ્રાપ્ત થયો છે, જેથી ગાંધીજીના આદર્શ સિદ્ધાંતોનું બંદળ છાંટીને સાહિત્યમાં અલગ સુરક્ષિત રાખી દઈએ અને બ્યવહારમાં માત્ર બ્યવહારના નિયમોથી જ ચલાવીએ. પરંતુ વિચારમાં અને આચારમાં, આદર્શમાં અને બ્યવહારમાં આવી ફાયર સારી નથી. તેનાથી મન બ્યા બને છે અને સંશ્યની હાલત પેદા થાય છે, અને સંશ્યાત્માનો તો નાશ જ છે. તેથી એવી અખંડ અદ્ધાની જરૂર છે જે જીવનને વહેંચાયેલું જુએ નહિ, વહેંચે નહિ, પરંતુ સમગ્ર ભાવથી અહણું કરે અને તેને એકત્રિત તથા સંયુક્ત કરે. તો જ ધર્મ અને મર્મની ખાઈ પૂરાશે અને બંનો એક બીજાના પૂરક બનશે.

અહીં કાંઈક તેવું જ દસ્ય જોઈ રહ્યો છું. અદ્ધાએ લોકોના દ્વિતીને ઉસરાબ્યા છે અને તેમને ડેટલીક સંકલ્પની શક્તિ આપી છે. સત્ય

અહિસાને સામે રાખીને કેરલાક લોકાએ નિયમ લીધા છે કે નેચો પોતાના વ્યાપારમાં અને વ્યવહારમાં, સંક્ષેપમાં પોતાના કર્મને ધર્મની સાથે ચલાવશે. આ સ્વરૂપમાં ધર્મ નિઃસંદેહ પ્રેરક થઈ શકે છે. માત્ર સિદ્ધાંતમાં તો તે શાસ્ત્રાર્થનો વિષય અતી જાય છે. આચરણમાં લાવીને હેખાડવું પડશે કે વૈયક્તિક અથવા સામૂહિક જીવનને ધર્મના આધારે જ ધરીને ડેવી રીતે ઉન્નત અનાવી શકાય છે.

હું માનવા દર્શ્યું છું કે આ જે પગલું ભરવામાં આવ્યું છે, તે પહેલું હોય. એના પરિણામે બીજું ભરશે, પછી ત્રીજું અને એ રીતે શરૂ કરેલી યાત્રા વગર અટક્યે જ આગળ વધતી જશે. પહેલું પગલું જ મુશ્કેલ હોય છે. તેના માટે દાખિને સ્થિર અને સંકલ્પને મજબૂત કરવો પડે છે. જે તે આગલું પગલું ન ઉપાડે તો પાછલું પગલું સ્વયં બંધનનું કારણ અતી જાય છે. પગલું ભરીને ત્યાં જ સ્થિર થઈ જવું એ કાર્ય ગતિ નથી. ત્યાથી આગળ જ ચાલતા રહેવું જોઈએ. બધી સ્થિતિનો સ્વીકાર કરવો પરંતુ કોઈ પણ સ્થિતિથી અંશાઈ ન જવું એ ધર્મ તથા ધાર્મિકનું લક્ષણ છે.

આશા રાખી શકાય કે અણુપત્તી-સંધ 'અ' થી શરૂ કરીને ત્યાં જ થોબી જશે નહિ; પણ તેનાથી આગળ વધશે. આજે જીવનનું કેન્દ્ર ધન બનેલું જણાય છે, એવી ધોષણા માત્રથી કામ ચાલશે નહિ, પરંતુ જ્યાં કેન્દ્ર છે સાં અર્થાત આત્મામાં આત્મસ્વીકૃત સ્વેચ્છા અમની યથાર્થ પ્રતિષ્ઠા કરવી પડશે. અહિસાએ આગળ આવાને શ્રમ અને ધનના કોયડાને ઉકેલવો પડશે. ઉત્પાદન અને વહેંચણીની રીતને એવી રીતે ફેરવી નાખવી પડશે કે તે અહિસાથી પ્રેરિત હોય અને અહિસામાં જ પરિણામે. જ્યાં મુખી પદાર્થને બદલે આત્મા કેન્દ્ર નહિ બને, સંગહિત સત્તાના કાયદાઓને બદલે દરેકના અંત:કરણમાં રહેલા નેતૃત્વ નિયમો કેન્દ્ર નહિ બને, રાજથી વધારે પ્રજા કેન્દ્ર નહિ અને અને ધનવાનને બદલે શ્રમજીવીઓમાં તે કેન્દ્રનો અનુભવ નહિ થાય તાં

મુંદી સંધનું અને અહિસાનું કામ પૂરું થયું છે એમ માનવાનું કારણ નથી. આટલું કર્યા સિવાય વર્ચ્યે કોઈ ર્થળે વિશ્રાંતિ લેવાની જરૂર નથી.

આણુગતી-સંધના આજના દસ્યથી આરા અંધાય છે કે ગાંધીજીએ જે કાર્ય અધૂરું મુક્યું તે હવે પૂરું થશે. આપણી દઘિની મોટી ખામી એ છે કે આપણે સફળતાનું મૂલ્ય ગુણુથી નહિ પણ પરિમાળું અને આકારથી જોવા મુચ્છીએ છીએ લૌટિક વિચાર અણું આ જગાએ લાચાર છે મેં જેણું કે અહીં સંખ્યા પર જોકે ધ્યાન છે, પણ ગુણુનું મહત્વ વધારે છે. સભ્યો ઢીલા હોય, તો ચેલાઓની મોટી સંખ્યા પણ શું કામની? ચુસ્ત અને સમર્પિત થોડા પણ ધ્યું ફળ વાવી શકે છે. દુનિયાદારીના કામકાજ અંગે જે પક્ષો રચાય છે, તેમાં આ જ વસ્તુની લારે ખામી હોય છે. તેમનું લક્ષ્ય સભ્યો કોણ છે? તેના પર નહિ પણ કેટલા છે, તેના પર રહે છે. બધી સફળતા સંખ્યામાં જ અંકાય છે. અને ત્યારે સત્યને પણ સંખ્યામાં જ સમજુ લેવામાં આવે છે. આજની લોકશાહીનો આધાર લગભગ એવો જ છે. જેના મત વધારે તેની જ બોલાયાલા. અને લધુમતીવાળાએ સદા એવી જ શીકરમાં હોય છે કે તેઓ કચારે અહુમતીવાળા બની જય. એટલે તેઓનું કામ વિરોધ અને ટીકાએ કરવામાં જ સમાપ્ત થાય છે. આવી લોકશાહી શરૂઆતથી જ અર્થર્થીન છે. સંખ્યાના પળ પર નભનારી લોકશાહી આને બહુ સફળ જણુંતી નથી. હજુ એ સમયને વાર છે કે જયારે તેમાં સંખ્યાના સ્થાને સત્ય દાખલ થાય અને હાથ ઉંચા કરનારા લોકતંત્રનો બદલે હુદયનું નૈતિક તંત્ર ખડુ થાય. તે પોતાના કામકાજમાં ધર્મનું તરત્વ દાખળ કરવાથી બની શકશે. ત્યારે ઓછામતો એછ માન્ય અને અનાદરણીય નહિ હોય. અને તેમને કોઈ લય રાખવાની જરૂર પણ નહિ હોય. ત્યારે લધુમતીનો પ્રક એક મૂંજવનારો કોયડો નહિ હોય તે અવિશ્વસ્ત અને ભયભીત બનવાની હાડતમાં રહેશે નહિ અને બહુમતીવાળા

સંખ્યાના જેર પર નહિ પરંતુ સેવાઅળના આધાર પર શાસનાઝિથે. અર્થાત् ત્યારે અહિસા જીવનતું સાચું મૂલ્ય બનશે. તેના વિનાની લોકશાહી સહા એક હથ્યુ સત્તાને આમંત્રણ આપનારી છે.

આજના સંયોગોમાં આત્મઅદ્ધાની ભારે ખામી છે. દરેક જણું સંપત્તિ અને સત્તા તરફ હોડી રહેલ છે. તે જગતને પકડવા માટે જય છે, પણ જ્યારે તે મૂડીમાં આવતું નથી, ત્યારે ઉશ્કેરાઈ જય છે. સ્વત્વ ગુમાવીને અહાર રમે છે. એનું કસણાજનક દશ્ય ચારે આજુ જોઈ દેલે. અહારની તૃષ્ણામાં અંતરનું નરક લઈને આપણે ઓગળ વધી રહ્યા શીંઘે. આમ ક્યાં પહોંચી શકશે? ચિનાય રસાતાલ. એનો ડાઈ અંત નથી. આવા સમયે અદ્ધાવાળો પુરુષ ને આમ તો અંકિયન અને સાધનથી રહિત છે પણ અદ્ધાની સંપત્તિવાળો અને અદ્ધાળઅથી અળવાન છે, તે જ શાંતિનો માર્ગ અતાવી શકે છે.

હું અખુદતી-સંધમાં સામેલ થયેલા અંધુઓને તેમના આ સાહસિક અને પવિત્ર કાર્યને ધનવાદ આપું છું.

( ૨ )

### અંતરાત્માનું મહાજાગરણ.

સ્વતંત્ર હિન્દી પવાર શ્રી વિષ્ણુદાત મિશ્ર ‘તરણી’ એ પોતાના પ્રભાવથાળી આવણું કર્યું હૈ—

અખુત્તી-સમાજના આ દીક્ષાંત મહોત્સવમાં આજે ને કાંઈ થધ રહ્યું છે, તે એક નવી ચેતનાનું પ્રતીક છે. તે ચેતના ડેવળ આચાર્ય તુલસીની પ્રેરણા છે કે જેણે મનુષ્યના નિલ જીવનમાં આત્મઅળનો માર્ગ દેખાઓ છે. અખુત્તાના માર્ગને આપણે એવો વાવહારિક જીવનમાર્ગ કહી રહીએ કે જેમાં ડાઈ. પણ વ્યક્તિ આત્મઅદ્ધા વડે અસ્તુ સંસારમાં સત્તમાર્ગ પર ચાલવાનું સાફસ પોતાની જાતે જ

કરી શકે અને પોતાની સાથે ચાલનારને પણ તે આપો શકે. મેં અણુપત્રતીમોના નિયમો વાંચ્યા છે. જે નિયમો છે, તે નવા નથી. પરંતુ નવીનતા એ છે કે આચાર્ય તુલસી જેવા એક ધર્માચાર્ય સત્ય, અહિસા, સહિપ્લંગતા, સદ્ભાવના, સદાચાર આદિ ઉત્તમ ગુણોને માત્ર ઉપરેશની વસ્તુ માનતા નથી. તેમનામાં એ તપસ્યા છે કે જેના વડે તેઓ આ સંસ્કૃત જીવન-વક્ષણોને હેઠિક ચર્ચાનો એક ભાગ બનાવી હેવા છુંછે છે. જે લોકો આજે અણુપત્રતોને ધારણું કરીને સંસાર મહાસાગરમાં આચાર્ય તુલસી જેવા કુશળ કર્ણધારની રાહઅરી નીચે જીવનનૌકા પર સવાર થયા છે, તેમનો ભૂતકાળ જમે તેવો હોય પણ લવિષ્યકાળ નિઃસંશય ઉજાવળ છે. આજે જે લોકોએ અણુપત્રતનું બીડું અડખ્યું છે, તેઓ એક નવા, સદાચારી અને સહનશિલ મનુષ્ય સમાજના અથવી છે.

### સામાજિક ન્યાયની પ્રેરણા

પરંતુ અણુપત્ર ડોર્ચ નવો પંથ નથી. જે તે પંથ હોત તો આજે આપણે જુદા જુદા ભતો અને સંપ્રદાયોનો સંગમ અહો જોઈ શકત નહિ. અણુપત્ર નથી તો અપરિયણ કે નથી ઘનચર્ચ. આચાર્ય તુલસીએ ગૃહસ્થી અને ગૃહસ્થ-મર્યાદાઓનો વિચાર કરીને સીધા-સાદા નિયમોની રૂચના કરી છે, જેથી મનુષ્ય મનુષ્યનો અનુચિત લાલ ન ઉડાવે, એક બીજાનું શોષણ ન કરે. ડાળાં બજારો ન કરવાં, બાપારમાં જૂદું ન બોલવું વગેરે એવી આખતો છે કે જેના પર અનુશ રાખવાને માટે કરવામાં આવેલા સરકારી કાયદા-કાનુનો નકામા સાખીત થયા છે. આચાર્ય તુલસીએ કમજોરીના પુતલા સમાન મનુષ્યોના તે રથાન પર સામાજિક ન્યાયની પ્રેરણા કરી છે કે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. અંતરાત્માના આ વિવેક-મહાજગરણુના ચોકીદાર આચાર્ય તુલસીની નિષ્કપત્ર અને છલરહિત તપસ્યાનું જ એ પરિણામ છે કે જેના લાધે આજ છસોથી વધારે મનુષ્યો વ્યક્તિગત, સામાજિક,

પરિવારિક, વ્યાપારિક આદિ જીવનના જુહા જુહા ક્ષેત્રોમાં સત્ય અને અહિસાના મૂલાધારને હૃદયંગમ અનાવીને, નવા અળ અને ઉત્સાહથી ન્યાયયુક્ત સમાજની રચનાના અય્યૂત અની રચા છે. ઐયેવા વિવેકને જેમણે અણુપત્તી-સંધન નિયમો દ્વારા પ્રાપ્ત કર્યો છે, તે અધા અણુપત્તી છે, પણ લલે તેઓ આજે આ દીક્ષાંત સમારોહમાં સામેલ ન હોય. અણુપત્ત ગ્રહણ કરવા માટે નથી જરૂર આચાર્યની કે નથી જરૂર સાક્ષીઓની. અણુપત્તીની આસ્થાનું કેન્દ્રભિંડુ આચાર્ય અને વિચારમાં સત્ય અને અહિસાનું પાલન છે અને તે પાલન પણ ક્રીધ રાજ્યનીક ઉદ્દેશથી નથી, કે જેથી આત્માળા સમાજ અને સંસારની રચના થઈ શકે. આ રીતે અણુપત્ત યુગધર્મ છે. આ યુગધર્મને જે જનવિદ્યમાન અને સરળ શુદ્ધ રૂપમાં આચાર્ય તુલસીએ રજૂ કર્યો છે, તેમાં જ માનવજીતિ અને માનવપરિવારના કર્તા મનુષ્યનું અનિધ રહેલું છે.

### કહિન પ્રવાસ

પરંતુ અણુપત્તી-સંધની મજબુત ઘણી કર્ણણ છે. તે યુગધર્મનું આદ્યવાન પણ છે અને ચેતવણી પણ છે. અમે જોયું છે કે આ જ દિલ્હી નગરીમાં વર્તમાન યુગના અહિસાના સહૃદી મોટા પ્રચારક મહાત્મા ગાંધીનું ખૂન પ્રાર્થના સ્થળમાં વિના કારણે થયું હતું. હિસા અને અહિસાની આ અથડામળુ શેતાન અને કર્ણદરના સંબર્ષની માડુક સહાયી ચાલતી આવી છે. હિસાએ આજ સુધીમાં જગતનો ક્રીધ પણ સમર્થયાનો ઉકેલ કર્યો નથી, અને તેના અળ પર જે કંદ્ચ ઉકેલો કરવામાં આવ્યા છે તે અસ્થાયી નિવડ્યા છે. તેથી જ આજે અહિસા અને સલ આવહારિક મૂલ્ય વરાવે છે. હિસાની આ પ્રચંડ દાવામિને ખુઆવવા માટે આજે છેસો. વ્યક્તિઓએ આચાર્યશ્રીની સામે પ્રતિસાઓ ગ્રહણ કરી છે. તે અવાએ સમજવું જોઈએ કે અણુપત્ત ક્રીધ ધાર્મિક કે પંથગત વસ્તુ નથી. તે તો સતત જીવન-આચરણ છે, જે નીચાને

ઉપર લાવતું ચાહ્યું જય છે. આ સતત જીવન-અચરણમાં અણુપ્રતી એટલા ઉંચે આવશે અને અણુપ્રતીના જીવનનું પાલન કરીને સમાજમાં તેઓ ને ચાદર્શી ઉપરિથિત કરશે, તે જ અણુપ્રતને સ્થાયી બનાવી શકશે. એથી વિવેકનું ભાગું બાંધીને સત્યમાં પરમ શ્રદ્ધા રામતાર એવા છસો વિશ્વાસીઓએ આને એક પ્રતિજ્ઞા લીધી છે. હવે તેમનું જીવન સમાજને માટે છે. સામાજિક ન્યાય અને સામાજિક મર્યાદાઓ ઈસ્થિર કરવા માટે આ એક મહાન પ્રયોગ છે અને અણુપ્રતીઓનું કર્તા-પાલન એ વાતનો નિશ્ચય કરશે કે આ દેશમાં સત્ય અને અહિસા અંતે જાળવલ્યમાન જીવન-સત્ય છે.

( ૩ )

### એક વ્યક્તિની શક્તિ

શ્રીમતી દુર્ગાંશુ શાસ્ત્રીએ પોતાના સરક અને સ્વાભાવિક લાઘુણમાં કલ્યું કે—

મને થોડા શખ્ફો ઓલવા હેવા માટે ને સન્માન અને આદર દર્શાવવામાં આવ્યાં છે, તેના માટે હું આપને તથા આપના સંધને ધ્યાવાદ આપું છું. મેં આચાર્ય શ્રીતુલસીમહારાજનાં દર્શન કર્યાં અને તેમની સાથે ડેટલીક વાતચીત કરવાનો પ્રસંગ મળતાં પ્રસન્નતા અનુભવી. આચાર્યશ્રીના લક્ષ્ણ તથા અનુયાયી શ્રાવક-શ્રાવિકાઓને હું અભિનંદન આપું છું કે તેઓ આ જરૂરાદી અને ધર્મરહિત જમાનામાં આવા આદર્શ ચરિત્ર આચાર્યશ્રીનું નેતૃત્વ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા છે. તેઓ જૈન ધર્મના ચુસ્ત તેગાપંથી મંપ્રદાયના અનુયાયી હોવા છતાં એટલા ઉદાર અંતઃકરણવાળા છે કે તેમને ખીજ ધર્મના વિરોધની ભાવના સ્પર્શ મળું શકી નથી. તેઓ અધ્યા ધર્મ અને સંપ્રદાયના લોકોની સાથે સપ્રેમ વાર્તાકાળ કરે છે અને તે દરમિયાન અન્ય કંઈ આચાર્યોમાં નેમ પોતાના પથને ઉંચો માનવો અને ખીજ

ધર્મ તथા માર્ગોની નિંદા કરવી આવિ કોઈ પણ પ્રકારની ભાવના રાખતા નથી.

હું પોતે નૈન ન હોવા છતાં આપની વર્ચ્યે એટલા માટે જ આવી હું કે મહારાજશ્રીના કથન મુજબ એમના અલ્લુગતોને અહણું કરનાર અને આચરણમાં મૂકનાર નૈન જ હોવા જોઈએ એવો કોઈ આગ્રહ નથી. હું એમ માતું હું કે નૈન કોમના જ નૈનો છે એવું નથી. નિર્ધિકરોએ ઉપરોક્તાં માર્ગ અનુસાર જેઓ પોતાના જીવનને નિયમબદ્ધ રાખવાને માટે તૈયાર હોય અને જેઓ તેમના ઉપરિષ્ટ માર્ગ પ્રત્યે અક્ષિત, સ્નેહ અને આદર ધરાવતા હોય, તેઓ બધા જ વાસ્તવિકતાએ નૈન છે, નૈન કહેવરાવવાને યોગ્ય છે.

આજના હિસાપ્રધાન યુગમાં નૈન ધર્મનું સ્થાન અતિ ઉંચું છે. આજનો યુગ એવો ચાલી રહ્યો છે કે એક દેશ ભીજ દેશની સાથે, એક પાડોશી ભીજ પાડોશીની સાથે અને એક ભાઈ ભીજ ભાઈની સાથે એરવેર, દ્રોહ, ધર્મ અને શત્રુતાની ભાવના રાખે છે તથા એક ભીજનો વિધ્યંસ યા વિનાશ કરવાની અથવા એક ભીજ ઉપર અલ્યાચાર કરવાની પ્રકૃતિ ચલાવે છે. આવા યુગમાં નૈનધર્મ એક જનવલ્યમાન ભરાલની માઝેક અંધકારમય જગતને જીવદ્યા, અહિસા તથા ત્યાગમય જીવનનો સહૃપ્રેશ આપીને મનુષ્ય જીવનને માટે સાચો તથા ઉત્તમ માર્ગ બતાવે છે અને સન્માર્ગ તરફ દોરવાની શક્તિ ધરાવે છે.

આ ધર્મના સહૃથી મોટા નતો પાંચ છે :

(૧) સત્ય. (૨) અહિસા. (૩) અલ્લાચર્ય. (૪) અસ્તેય તથા  
(૫) અપરિયદ.

આ પાંચ નતો એટલા મોટા અને ઉપરોગી છે કે જો સમસ્ત ભારતના નરનારીઓ તેને યથાશક્તિ મનસા-વાચા-કર્માદ્યું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી લે તો સંભવ છે કે આપણો દેશ જલદી અભીષ્ટ ઉત્તતિને

પ્રાપ્ત થાય અને આજના વધિત જગતને માટે એક આદર્શ સમાજ બની જય. આપ બધાને અભિનંદન આપતાં મને હર્ષ થાય છે કે આ પતોને મન-વચન-કાયાથી બરાબર પાળનાર મૂર્તિમંત ધર્મવિતાર આચાર્ય શ્રીતુલસી મહારાજના નેતૃત્વ અને સાક્ષીત્વમાં આને તમે સેંકડોની સંખ્યામાં આણુવત ગ્રહણ કરવાની પ્રતિસા લીધી છે અને તેના પાલનનું આજીવન પણ લીધું છે. આ પવિત્ર પતોનું પ્રતિસા-પૂર્વક પાલન કરનારા નરનારીઓ માત્ર પોતાના જીવનને જ નહિ, પરંતુ પોતાના સમાજને પણ કૃતાર્થ કરશે અને તેને સુખ તથા શાંતિ પ્રાપ્ત કરવામાં મદ્દગાર થશે. આ મારી આશા જ નથી, પણ દ્વારા વિશ્વાસ છે.

ને દેશમાં એક વ્યક્તિ પણ નેક, શાંતિપ્રિય અને અહિસા-પ્રતી હોય છે, તો તે દેશ કેટલો ઉજત અને અગ્રગામી બની શકે છે, તેનું જવખંત ઉદાહરણું આપણું સ્વર્ગીય મહાત્મા ગાંધીના જીવનમાંથી મળે છે. ને એક જ વ્યક્તિ સમાજમાં ધાતક અને હિસા-પ્રિય નીકળી આવે તો કેટલી હાનિ પહોંચાડે છે, કેટલું પતન કરે છે, તેનું ઉદાહરણું નાયૂરામ ગોડસે છે કે જેનું કૃત્ય આપણે ભૂલી શકતા નથો. તેથી આપણા દેશ, સમાજ અને દુનિયા માટે આ દિવસ શુભ છે કે જ્યારે સેંકડો વ્યક્તિ અહિસા તથા સત્યનો પવિત્ર માર્ગ ગ્રહણ કરવાની પ્રતિસા લેવાને એકત્ર થઈ છે. આવા મંગળકાર્યમાં દિલ્હીના નાગરિકો હાજર થઈને આપને ધન્યવાદ આપે તેમાં કોઈ આસ્થાર્થ નથી.

નૈતે ધર્મ તથા ખીજ બધા ધર્મો પોતાના અનુયાયીઓને સહાચારના માર્ગ ચલાવવાનો નિરંતર પ્રયત્ન કરે છે. પરંતુ કામ, કોધ, લોલ, મોહ, મદ, માત્સયને વશ થઈ તે અનુયાયીઓ સ્વાર્થ સાધનની આશામાં પોતાના જીવનને બરખાદ કરે છે અને પોતાનાનું ધર્મને પણ કલાંકિત કરે છે. તેથી

તમોને મારો એ જ આગ્રહ છે કે આચાર્યશ્રીએ અણુવતોની જે દીક્ષા આપી છે, તેના પાલનમાં તમો કચારે પણ શિથિલ ન થશોં અને કોઈ પણ વખતે એવો વિચાર સુધાં પણ આવવા ન હેશો કે એના પાલન વિના તમે સ્વાર્થ સાંકના કરી શકશો. તમારો સ્વાર્થ તો એ જ છે કે તમે સુખી થાઓ, તમારો સમાજ સુખી થાય, તમારો દેશ સુખી થાય અને અણુ કે મહાન સર્વ પ્રાણીમાત્ર સુખી થાય. આ ઉદ્દેશ જે સિદ્ધ થઈ શકે તો અહિસા અને સત્યના માર્ગથી જ સિદ્ધ થઈ શકે. જે કોઈ એનાથી વિરુદ્ધ વર્તાને સુખી બનવાની ઘણા કરતું હોય તો તે મૃગતૃણ્યા છે. વૈર, હિંસા ધૃણ્યા તથા વિદ્રોહનાં ખીજે વાવીને તમે સુખ, શાંતિ કલ્યાણ તથા ઉન્નતિનું ફળ કેવી રીતે પામી શકો ! તેથી તમે લોડાએ આને જે પ્રતિગાઓ લીધી છે અને જે માર્ગનું અવલંબન કરવાનો નિશ્ચય કર્યો છે, તે ખચિત સર્વોત્કૃષ્ટ છે અને તમારું પરમ કર્તાદ્વય છે કે તમે એના પર દદ્તાથી કાયમ રહો.

શુભ અને કલ્યાણ કાર્યોમાં ગ્રાયઃ વિધન આવે જ છે અને પુશ્ટિર પોતાના ભક્તાની દદ્તાની પરીક્ષા કરવા માટે અનેક પ્રલોભનો મોકલે જ છે. એમાં ન ફસાતાં તમે અટલ પ્રતિત રહો, એ જ મારો તમને આગ્રહ છે. હાજર રહેલી આવિકાઓ તથા અહેનોને મારો મુખ્ય આગ્રહ એ છે કે તેઓ ધર્મના માર્ગ પર અટલ રહે અને પોતાના કુદુંબને આચાર્ય શ્રીતુલસીજ મહારાજે અનાવેલા સન્માર્ગની સામગ્રી પીરસતી રહે. કોઈ પણ સમાજના જીવનને ઊંનત કરવામાં સ્ક્રીઓનું આચરણ, તેની ધાર્મિક ઇચ્છિ, તેના દ્વારા ચલાવવામાં આવતું કૌદુર્યિક જીવન અને ખાળેડો તથા યુવાન પર પડતો તેમનો પ્રભાવ મુખ્ય ભાગ ભજવે છે. તેથી આપણા શાસ્ત્રોમાં સામાજિક ધર્મની વ્યવસ્થા માટે સ્ક્રીઓના જીવન અને સચ્ચારિત્ર પર વિશેષ ધ્યાન અપાયેલું છે. ભારતમાં આજ વણ્ણાં પ્રકારનું દુઃખ, સામાજિક દુર્વ્યવસ્થા તથા પતન જોવામાં આવે છે, વળા પ્રમાણુમાં ગરીબાઈ પણ વધારે છે, તેમ છતાં ખીજે દેશાની અપેક્ષાએ

સુખશાંતિ વધારે જણ્યાય છે, તેનું એક સુખ્ય કારણ એ છે કે આપણા દેશની સ્વીઓ તુલનાતમક દર્શિએ વધારે સહાયારિથી, પતિતતા અને ધર્મપરાયણ રહેલી છે. તેથી બહેનો ! જે વધારે ઉન્નતિ કરવી હોય તો તમારે વધારે દદ અને ધર્મપરાયણ બનતું જોઈએ.

### આચાર્યશ્રીના આશીર્વાદ

આચાર્ય શ્રીતુલસીએ અધિવેશનની સમાપ્તિ કરતાં અણુવત ગ્રહણ કરનારા નર-નારીઓને આશીર્વાદ આપ્યા. તેઓશ્રીએ કહ્યું કે આજના આ પુનીત ગ્રસંગે હું અણુગતી બંધુઓ અને બહેનોને ખાસ સંદેશો આપું છું કે તેઓ કોધ, માન માયા, લોભ આદિ દુષ્પ્રવૃત્તિઓથી પોતાને અચાવે અને ખીજાએને પણ એનાથી અચવાની પ્રેરણ કરે. એ દુષ્પ્રવૃત્તિઓ ગુણોની હાનિ કરનારી છે. લગ્વાન મહાવીરના એ વાક્યોને તમે સદ્ગુરુના રાખને કે—

ઉવસમેળ હણે કોહં, માણ મહદ્વિયા જિણે ।  
માયા મઞ્ચાવ ભાવેળ, લોહો સંતોસાઓ જિણે ॥

અથાંત-કોધને શાંતિથી જુતો, માનને મૃદુતાથી જુતો, માયા અથવા લભયાને સરળતાથી જુતો અને લોભને સંતોષથી જુતો.

તેઓ આજે એક આધ્યાત્મિક નૈતિક નિયંત્રણમાં આવી ગયા છે. તેમની જવાબદારી ઘણ્યા અંશે વધી ગઈ છે. તેને તેઓએ સલ્ય અને ધ્રમાનદારીથી સદ્ગુરુના કરવાની છે.

હું તેમને આશીર્વાદ આપું છું કે તેઓને યથેષ્ટ શક્તિ અને સાહસ પ્રાપ્ત થાઓ જેથી તેઓ સંઆમમાં જનારા યોક્ષાની માફક પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે અને સહૃદળ થાય. આજના આ દુષ્પ્રિય અને વિકૃત વાતાવરણમાં સંભલ છે કે વતપાલનમાં વિઝો અને વિપત્તિઓનો સામનો કરવો પડે. હું ધૂંચ્છું છું કે બધા લાધુભહેનો દફ્તા, સાહસ, પુરુષાર્થ અને શક્તિથી છાતીને મજબૂત કરીને અહગ બને.

त्याबाद महावीर प्रलुना चरणोमां नीचेनां लज्जनथी अद्धांजलि  
अर्पणु करवामां आवी. हाजर रहेला वधा त्वी-पुरुषोंसे आचार्यश्रीना.  
स्वस्मां पेतानो स्वर मेणवीने प्रलुवंहना करी. आचार्य श्रीतुलसी  
विरचित ऐ वंहना आ रही :

महावीर प्रलुके चरणोमें, अद्धाके कुसुम चढायें हम ।  
उनके आदर्शोंका अपना, ज्ञवनकी ज्योति जगायें हम ॥  
तप-संयमभय शुभ साधन से, आराध्य चरणु आराधन से ।  
बन मुक्ता विकारोंसे सहसा, अथ आत्मविजय कर पायें हम ॥  
८८ निष्ठा नियम निलाने में, हो ग्राणु वसी प्रणु पाने में ।  
मनज्ञूत मनोभव छो ऐसा, कायरता कभी न लायें हम ॥  
यश-लोलुपता पद-लोलुपता, न सतायें कभी विकार-व्यथा ।  
निष्काम स्वपर-कल्याणु काम, ज्ञवन अर्पणु कर पायें हम ॥  
गुरुटेव चरणोमें लीन रहे, निर्लिंक धर्भक्षी बाट बहें ।  
अविचल-दिल सल अहिसाका, दुनिया का सुपथ दिखायें हम ॥  
ग्राणी ग्राणीसह मैत्री सजें, धृष्या-मत्सर-अलिमान तजें ।  
कहनी करनी छक्सार बना, 'तुलसी' तेरा पथ पायें हम ॥

छेवटे नीचेनुं गीत गवाया बाद अत्यंत उत्साहपूर्ण वातावरणमां  
अधिवेशननी कार्यवाही साडाचार वागे समाप्त थई.

हो हमारा जे विरोध, हम उसे समझें विनोद ।  
सत्य सत्य-शोध में, तब ही सङ्कलता पायेंगे ॥  
कुट्टों से नहीं धरणरायेंगे ॥

सत्य का वल है अदृष्ट, जूठ आभिर जूठ जूठ ।  
दूध पानीका निषेड, सत्य से दिखलायेंगे ॥  
साहस सदा खड़ायेंगे ॥

दीपां के धक्कोंते लाल, क्या वरणे तेरे झुश हाल ।  
 वाह वाह काम कमाल, मानव हेष्ट सिर डोलायेंगे ॥

अपना हृदय कुलायेंगे ॥

तेरे ज्वनका आँखूत, अतलाता यह संध संजूत ।  
 हुःभम सुषमां या सतयुगडी, रथना हम अतलायेंगे ॥

ज्योंकी त्यां रथ पायेंगे ॥

करे याचना हम सभ एक, अटल आत्मअल हो अतिरेक ।  
 'सत्य' शिवं सुनहरभु' का हम साक्षात्कार करायेंगे ॥

ज्वन-ज्योति जगायेंगे ॥

अलिनंदन हो वारंवार, अलिनंदन हो वार हजर ।  
 'तुलसी' तन मन रूं रूं भे, गुरुवर को सहा वसायेंगे ॥

नहीं पलबर भी विसरायेंगे ॥

---

# પારિશિષ્ટ (૧)

## આણુપ્રતા

આણુવતી-સંધના પહેલા વાર્ષિક અધિવેશનમાં જે પ્રતિગાઓ લેવામાં આવી તે નીચે મુજબ છે :—

### (૧) અહિસા પ્રતા

અહિસાના સંખ્યમાં નીચે જણાવેલી પ્રતિગાઓનું પાલન આણુપ્રતિને માટે અનિવાર્ય છે :—

૧. ચાલતાં-કરતાં નિરપરાધ ગ્રાણીની સંકલન, લક્ષ્ય અથવા વિધિપૂર્વક હિસા કરવી નહિ.
  ૨. ડાઈ ખાસ વ્યક્તિ કે ખાસ પક્ષની હત્યા કરવાનો ઉદ્દેશ રાખનારા મંડળ, પક્ષ કે સંસ્થાના સભ્ય અનવું નહિ તથા એમના કાર્યોમાં ભાગ લેવો નહિ.
  ૩. સ્વદેશની બહાર અનેલા વસ્ત્રો પહેરવાં કે ઓફ્વાં નહિ.
- અપવાદ**—ખાસ સંયોગોમાં તથા વિદેશવાસમાં ઉપર્યુક્ત નિયમ લાગુ પડતો નથી.
૪. રેશમી અને તેનાં જેવાં હિસાજન્ય વસ્ત્રોને પહેરવાં તથા ઓફ્વાં નહિ.

**અપવાદ**—કૃતગ્રહણ પૂર્વેના વસ્ત્રોની વપરાશમાં ઉપરના અને નિયમો બાધક નથી.

૫. ડાઈ પણ વ્યક્તિને અસ્પૃષ્ય માનીને તેનો તિરસ્કાર કરવો નહિ.
૬. મોટાં જમણાવારો કરવા નહિ અને રાજકીય નિયમ હોય તો તેનું ઉક્ષધન કરવું નહિ.

નોંધ—જ્યાં પોતાના નજીકના સંબંધીઓ અને બીજુ આમંત્રિત બ્યક્ટિતાઓ મળીને ૧૦૦ થી વધારેની સંખ્યા એકનિત થાય, તેને મેટો જમણુવાર ગણુવામાં આવશે.

૭. નિયમ નિષિદ્ધ જમણુવારમાં ભોજન કરવા જરૂરું નહિ.
૮. વિશ્વાસધાત કરીને ડોઝના ફુદ્યને આધાત પહોંચાડવો નહિ.
૯. કાયદા અને વ્યવહારિક દણ્ઠિથી પશુઓ પર વધારે લાર ભરવો નહિ.
૧૦. પોતાના આશ્રિત જીવોની ખાદ્ય-પેય વસ્તુઓનો કલુષિત ભાવનાથી વિચ્છેદ કરવો નહિ.
૧૧. આશ્રિત અને અનાશ્રિત પ્રાણીઓ પ્રત્યે કૂર વ્યવહાર તથા પ્રહાર કરવો નહિ.
૧૨. ચિકિત્સાના કારણ સિવાય ડોઝ પ્રાણીનો અંગ વિચ્છેદ કરવો નહિ. તપાવેલા સળિયા કે બીજ કષ્ટદાયક ઉપાયોથી નિશ્ચલાદિ નિશાનો કરવાં નહિ.
૧૩. ડોઝ પ્રાણીને કઠોર બંધનથી બાંધવું નહિ.
૧૪. આત્મહત્યા કરવી નહિ.
૧૫. ભૂષુહત્યા કરવી નહિ.
૧૬. માંસ-જેમાં ધંડા, માંસ, સર્વ, ચરખી અને રક્તનો પણ સમાવેશ થાય છે—ખાતું નહિ.
૧૭. દાર પીવો નહિ.
૧૮. દાર, માંસ, માછલી તથા ધંડા આહિનો વ્યાપાર કરવો નહિ.
૧૯. શિકાર કરવો નહિ.
૨૦. અળગણુ પાણી પીવું નહિ.

૨૧. કસાઈનું કામ કરવું નહિ. કરનારને સહકાર આપવો નહિ, અને કસાઈપણાનું કામ કરનારી કંપનીના શેર લેવા નુહિ.
૨૨. જન્મ, વિવાહ, તહેવાર આદિ પ્રસંગોએ આતશબાળ કરવી નહિ કે કરવામાં સંમતિ આપવી નહિ.
૨૩. તપસ્યા (ઉપવાસ) ના કારણે જમણુવાર કરવો નહિ અને તે માટે થતા જમણુવારમાં ભોજન કરવા માટે જવું નહિ.
૨૪. શોકચ, જેડાણી, દેરાણી તથા નણુંદ આદિ સાથે તથા તેમનાં ખાળડો સાથે દુર્ઘટાનું કરવો નહિ.
૨૫. મરનારની પાછળ રિવાજ તરીકે રોવું નહિ.
૨૬. ભાંગ, ગાંઝે, ચરસ, તમાકુ, જર્દી આદિ ખાવા-પીવા કે સુંધરવાના કામમાં લેવો નહિ.
૨૭. વિવાહ તથા હોળી આદિ પર્વોમાં ગંદા ગીત અને ગાળી બોલવી નહિ તથા અશ્લીલ બ્યવહાર કરવો નહિ.
૨૮. હોળીના પર્વોમાં રાખ વગેરે ગંદાં પદાર્થો ખીજ પર ફેંકવા નહિ.
૨૯. મતુજ્ય દ્વારા એંચાતી રીક્ષામાં એસવું નહિ.
૩૦. કોઈ પણ પ્રકારના મૃત્યુ-ભોજનમાં જમવા માટે જવું નહિ.  
અપવાદ—શોક બતાવવા ખીજ ગામમાં ગયેલી બ્યક્ટિઓને આ નિયમ લાગુ પડતો નથી.
૩૧. કોધાદિ વશ કોઈને ગાળ દેવી નહિ.
૩૨. લાલ કે દ્વેશ વશ આગ લગાડવી નહિ.

## (૨) સત્યઘત

સત્યના સંબંધમાં નીચેની પ્રતિશાયોનું પાલન અણુતીઓને માટે અનિવાર્ય છે :-

૧. જમીન-મકાન, પશુ-પક્ષી, સોના-ચાંદી, ધન-ધાન્ય તથા ધી-તેલ આટા વગેરે ખાદ્ય પદ્ધારો અથવા અન્ય ડોઢું વસ્તુની લે-વેચ કરતાં તેના પ્રકાર, માપ, તોલ, સંખ્યા વગેરે ખાખતોમાં અસત્ય એલાવું નહિ.
૨. સમજીભૂતીને ઓટો નિર્ણય યા ફેંસલો આપવો નહિ.
૩. ડોઢ વ્યક્તિ, મંડળ, પક્ષ, અથવા ધર્મ વિરોધ પ્રત્યે આક્ષેપાતમક નીતિથી ભાંનિત ફેલાવવી નહિ કે જૂઢો આરોપ મૂકવો નહિ.
૪. ન્યાયાધિરા અને પંચ આદિની સમક્ષ અનર્થકારી અસલ સાક્ષી આપવી નહિ.
૫. ડોઢ વ્યક્તિ પાસેથી જૂદું ખત અથવા દુસ્તાવેજ લખાવવો નહિ. જેમકે ઇપિયા ૧૦૦, આપીને ૨૦૦) નું ખત લખાવવું વગેરે.
૬. સ્વ અથવા પર કન્યા-પુત્રના વિચાર આદિ વિષયમાં અસલ એલાવું નહિ. જેમકે ડોઢ આંધળા ને દેખતી અને ડોઢ સંચચરિત્રાને દુસ્થારિત્રા કહેવી.
૭. ઓટો કેસ કરવો નહિ કે કરવામાં સંમતિ આપવી નહિ.
૮. ઓટો આરોપ કે કલંક મૂકવું નહિ.
૯. વ્યક્તિગત સ્વાર્થ અથવા દેખથી ડોઢનો મર્મ (ગુપ્ત વાત) ઉંધાડો પાડવો નહિ.
૧૦. ડોઢને ભિત્રબાવ દેખાડીને અનિષ્ટકારી સલાહ આપવી નહિ.
૧૧. ખાતરી આપીને કે બંધન કરીને તેનો ધનકાર કરવો નહિ.
૧૨. ઓટો દસ્કત બનાવવા નહિ કે બનાવવાની સંમતિ આપવી નહિ.
૧૩. જૂહા રેશનકાર્ડ બનાવવા નહિ.
૧૪. ડોઢને ઓદું પ્રમાણુપત્ર આપવું નહિ.
૧૫. ઓટી જહેર ખખર કરવી નહિ.

## (3) અચૌર્ય પ્રત

અચૌર્યના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિશાઓનું પાલન આણું  
પ્રતીઓને માટે અનિવાર્ય છે :—

૧. તાળું તોડીને, ભીંત વગેરેમાં ખાતર પાડીને, ગાંઠી કે તીનેરી  
ઘોલીને, ધાડ પાડીને કે ખિરસ્કું કાતરીને ક્રાઈ વસ્તુની ચોરી  
કરવી નહિ.
૨. ભીજની પડેલી વસ્તુને ચોર વૃત્તિથી લેવી નહિ.
૩. રાજ્યનિષિદ્ધ વસ્તુઓનો વેપાર કરવો નહિ.
૪. રાજ્યનિષિદ્ધ વસ્તુઓને ભીજ દેશમાં લઈજાઈને અથવા અીજ  
દેશમાંથી લાવીને વેચવી નહિ.
૫. ક્રાઈ ચીજમાં ભેળસેળ કરીને કે નક્કીને અસલ તરીકે ઓળખા-  
વીને વેચવી નહિ. (ભેળસેળ—જેમ કે દૂધમાં પાણી, ધીમાં  
વેળણેખલ અને આટામાં સિંગોડાનો લોટ વગેરે. નક્કી ને અસલ  
તરીકે ઓળખાવવા, જેમ કે કલયર મોતીને સાચું મોતી કહેવું )
૬. લે-વેચમાં જૂદાં તોલમાપ કરવાં નહિ.
૭. એક પ્રકારની વસ્તુ બ્યતાવીને ભીજ પ્રકારની વસ્તુ આપવી નહિ.
૮. સારા માલને વટાવ કાપવાની દાનતથી ખરાય અથવા તુકશાન-  
વાળો ઠરાવવો નહિ.
૯. ક્રાઈ સંસ્થાના દ્રસ્ટી, અધિકારી કે કાર્યકર્તા વગેરે થઈને તેના  
ધનમાલનું અપહરણ કે સ્વાર્થવશ અપવ્યય કરવો નહિ.
૧૦. ઝાટા સિક્કા કે નોટા બનાવવી નહિ, તેમજ બનાવવાની સંમતિ  
આપવી નહિ.

૧૧. ઇંકિટ વિના રેલ્વે વગેરેમાં મુસાફરી કરવી નહિ. નોંધ-અસુક રાજનૈતિક પક્ષની નીતિ અનુસાર તે પ્રકારના રાજનિયમોનું ઉક્ષાંધન કરવું પડે તો પ્રતિસાઓને આધ આવશે નહિ.
૧૨. કોઈ સોદામાં ગાળો ખાવો નહિ.
૧૩. ચોરીની વસ્તુ ખરીદ્વી નહિ અને ચોર ને ચોરી કરવામાં સહાયતા આપવી નહિ.

#### (૪) અલ્ફાર્થ પ્રત

અલ્ફાર્થના સંઅંધમાં નીચે જણાવેલી પ્રતિસાઓનું પાલન અણુદ્રાતીઓ માટે અનિવાર્ય છે.

૧. વેસ્થાગમન કે પરસ્ક્રીગમન કરવું નહિ.
૨. કોઈ પણ પ્રકારનું અપ્રાકૃતિક મૈથુન કરવું નહિ.
૩. દિવસે સંભોગ કરવો નહિ.
૪. ૪૫ વર્ષની ઉંમર પછી વિવાહ કરવો નહિ.
૫. રાજકીય કાયદાઓમાં દશવિલી વિવાહની ઉંમરથી ઓછી ઉંમરે વિવાહ કરવો નહિ.
૬. જ્યાં શીખલંગનો પ્રસ્તુગ કે આશાંડા જણાય, ત્યાં નોકરી કરવી. નહિ કે રહેવું નહિ.
૭. એકલી પરસ્ક્રી સાથે એક ૧૮ ઓરડામાં રાત્રિ-શયન કરવું નહિ.
૮. એકલા પસ્પુરુષની સાથે ઝરવાં જવું નહિ, રમવું નહિ કે સીમેમાં વગેરેમાં જવું નહિ.
૯. વેસ્થાનું નૃત્ય કે ગાન કરવવું નહિ.

૧૦. વેશ્યાનું નૃત્ય જોવાના ઉદ્દેશથી તે માટે યોગયેકા સમારંભમાં ભાગ લેવો નહિ.
૧૧. કોઈ ખીને ઝાસલાવીને, ધમકાવીને, શીયાડીને કે લોભાવીને તેની સાથે વિવાહ કરવો નહિ.

નોંધ-ઉપર અતાવેકા મહિલાઓના નિયમો પુરુષોને અને પુરુષોના નિયમો મહિલાઓને લાગુ થાય છે.

#### (૫) અપરિયહુ પ્રત

અપરિયહના સંબંધમાં નીચે જણાવેલી પ્રતિજ્ઞાઓનું પાદન આણુભતીઓને માટે અનિવાર્ય છે.

૧. વ્યાપાર અંગે કાળાં બજાર કરવાં નહિ.
  ૨. લાંય લેવી નહિ.
  ૩. પહેરામણી, આણું આદિ ભીજને ત્યાં જોવા જરૂર નહિ તથા પોતાને મળેલી પહેરામણી વગેરે ગોડવીને ભીજને અતાવવી નહિ.
  ૪. પોતાના લોલાની ખાતર રોગીની ચિકિત્સા કરવામાં અનુચિત વિલંબ કરવો નહિ.
  ૫. એક દિવસમાં ખાવાપીવાની વરતુંઓ ૩૧ થી વધારે વાગ-રવી નહિ.
  ૬. ઝિપિયા લઈને કન્યા-પુત્ર આદિનો વિવાહ-સંબંધ કરવો નહિ.
  ૭. એક ભીજથી વધારે ધરેણું પહેરવું નહિ.
- ( આ નિયમ માત્ર પુરુષો માટે સમજવાનો છે. )
૮. વોટ, મત કે સાક્ષી આપવા માટે પૈસા માગવા નહિ અને આપવા પણ નહિ.

૬. જુગાર રમવો નહિ.
૧૦. તપસ્યા ( ઉપવાસ ) અંગે આભૂષણ વગેરે લેવાં નહિ.
૧૧. દોષિત અને હલકટ રીતોથી નોકરી, ઈજરો કે લાયસન્સ આદિ મેળવવાં નહિ
૧૨. હોટેલ રેસ્ટારેન્ટ નો ધંધો કરતાં માંસ, માછલી, છંડાં આદિનું ખાણું તૈયાર કરવું નહિ, પીરસવું નહિ તથા પીવા માટે દાડ આપવો નહિ.
૧૩. ધર-ભૂમિ, સોનું-ચાંદી, ધન-ધાન્ય, દ્રિપદ-ચતુર્પદ તથા ધરનો સામાન અને પરચુરણ વસ્તુઓ આદિ પરિગ્રહના પરિમાણ થી વધારે રાખવી નહિ—સંધરવી નહિ. ( પોતે ધારેલું પરિમાણ સંધ-પ્રમુખને જણાવવું પડશે.)

### સાંખના

૧. દરેક વર્ષે એક અહિંસા દિવસ પાળવો.
૨. દરેક મહિને એક ઉપવાસ કરવો. જો બની શકે તેમ હોય નહિ તો દરેક મહિને એ દિવસ એક વખતથી વધારે વાર ખાવું નહિ.
૩. પ્રતિહિન ઓછામાં ઓછું ૧૫ મિનિટ આત્મ-ચિંતન કરવું
૪. દરેક મહિને ઓછામાં ઓછું ૧૫ દિવસ ખલાયર્સ પ્રત પાળવું.

### અહિંસા દિવસનો કાર્યક્રમ

૧. ઉપવાસ અવશ્ય કરવો.
૨. કોઈ પણ મનુષ્ય, પણ, પક્ષી વગેરે પર સોમાન્ય કે વધારે પ્રણાસ કરવો નહિ.
૩. પણુંચો પર સવારી કરવી નહિ.

૪. અસત્યમાત્રનો ત્યાગ કરવો.
૫. પૂર્ણ ધ્યાનનું પાલન કરવું.
૬. ડાઢને કડવું વેણ કહવું નહિ.
૭. પોતાના અચાવ માટે પણ હિંસાત્મક પ્રત્યાક્ષમણ કરવું નહિ.
૮. એક કલાક સુધી આધ્યાત્મિક રૂપાધ્યાય કરવો.
૯. અર્ધો કલાક આત્મ-ચિંતન કરવું. જેમાં વર્ષ જરૂરિયાન કરેલી ઓટી પ્રવૃત્તિઓ યાદ કરી આત્મનિદા કરવી.
૧૦. પોતાના માતા-પિતા ભાઈ તથા અન્ય કુદુર્મી અને પોતાના નોકર તથા કામ કરનારાઓ વગેરે જેઓ નિરંતર સંપર્કમાં આવતાર છે, તેમાંથી જેઓ ભળે તેમને સાક્ષાત્ અને ન ભળે તેમને પોતાની ભાવનાથી વર્ષભરમાં થયેલા અસ્ત્રવ્યવહાર માટે અમાવવા (ક્ષમા માગવી) અને તેમને પોતાના તરફથી ક્ષમા આપવી.
૧૧. ખાસ આચોજન દ્વારા અહિસા આદિ સિદ્ધાંતોનો અને શક્ય હોય તો ‘અખુતી-સંધ’નો પ્રયાર કરવો.

### આત્મચિંતન

૧. ભૌતિક સુખોમાં આશકતા ચાહતે આત્મોનતિના મુખ્ય લક્ષને ભૂલ્યો તો નથી ?
૨. સ્વ-પ્રશંસા અને પર-નિદાથી પ્રસન્નતા તો નથી થઈ અને સ્વ-નિદા અને પર-પ્રશંસાથી અપ્રસન્નતા તો નથી થઈ ?
૩. પોતાના મોઢે જ પોતાનાં વખાણું તો નથી કર્યાં ?
૪. ડાઢનો જૂઠો પક્ષ લઈને ઝગડો નથી કર્યો ? અને ડાઢનું અપમાન કરવાની ડાશિશા તો નથી કરી ?
૫. ડાઢની નિદા તો નથી કરી ?

૬. કોઈની ઉન્નતિ અને ઐશ્વર્ય જોઈને ધર્ષા તો નથી કરી ?
૭. ખીજની ખરાખરી કરવા માટે નૈતિક જીવન થી અણ કરનારું કામ તો નથી કર્યું ?
૮. કોઈની સાથે તોછડાઈ તો નથી વાપરી ? એલવામાં અર્હીલ શખ્દોનો ઉપયોગ તો નથી કર્યો ?
૯. વડીલ અને વૃદ્ધોની અવહેલના કે તેમનો અવિનય તો નથી કર્યો ? પોતાના માતાપિતા આદિ પૂજ્યજનોના સન્માનમાં કોઈ અવિનય તો નથી કર્યો ?
૧૦. અવિનય, ભૂલ કે અપરાધ થતાં કૂમાયાચના કરી કે નહિ ?
૧૧. આળક-આળિકાએઓ કહેલું ન માનતાં તેમને નિર્દ્દિયતાથી માર્યાં તો નથી ?
૧૨. જૂદું એલીને પોતાની ભૂલ ઝુપાવવાની કોશિશ તો નથી કરી ?
૧૩. સ્વાર્થથી કે વિના સ્વાર્થે કોઈ જૂઠી વાતનો પ્રચારતો નથી કર્યો ?
૧૪. કોઈની કોઈ વસ્તુ ચોરી તો નથી ?
૧૫. પરસ્ત્રીને પાપદાષ્ટી તો નથી જોઈ ? અથવા પરપુરુષને પાપ દાષ્ટી તો નથી જોયો ?
૧૬. અપ્રાકૃતિક મૈથુન તો નથી કર્યું ?
૧૭. ધન મેળવવા માટે વિશ્વાસધાત આદિ અમાનવોચિત કામ તો નથી કર્યું ?
૧૮. કોઈની સાથે કોઈ માનસિક, વાગ્યિક અને કાયિક હિંસા તો નથી કરી ?
૧૯. આજે મને ડેખ તો નથી આવ્યો ? આવ્યો તો કેમ, કોનાપર, કેટલી વાર ?

૨૦. કોઈને હગવાની કે ઇસાવવાની કોશિશ તો નથી કરી ?
૨૧. ભાંગ, ગાંઝે, ચરસ આદિ નશાવાળી વસ્તુએ વાપરી તો નથી ?
૨૨. પોતાના વિચારે સાથે સહમત ન થનારાએનો દેખ તે નથી કર્યો ?
૨૩. જીલ્લની લોલુપતાને લીધે વધારે ખાંધું-પીધું તો નથી ?
૨૪. ગંજુપો, ચોપાટ, ડેરમ વગેરે રમવામાં સમયને બરાબાદ તો નથી કર્યો ?
૨૫. ધરની કે પડોશની બ્યક્ટિટએ સાથે ઝગડો તો નથી કર્યો ?
૨૬. કોઈ અનૈતિક અથવા અપ્રિય કામોભાં ભાગ તો નથી લીધો ?
૨૭. કોઈની સાથે બ્યક્ટિટગત અથવા સમૂહડપમાં કોઈ કાવતણે કે દગે તો નથી કર્યો, ને દેશ, સમાજ અને વર્ગને અશાંતિ પમાડવાની સાથે આત્માને પણ જ્ઞાનિ ઉપજાવે ?
૨૮. ઐટો ખર્ચ તો નથી કર્યો ?
૨૯. કાળા બાળરની કોઈ વસ્તુ ખરીદી કે વેચી તો નથી ?
૩૦. જુગાર, સટો, તેજભંડી વગેરે પ્રવૃત્તિ તો નથી કરી ? અથવા તે સંબંધી કોઈને પ્રેરણું તો નથી આપી ?
૩૧. વિધવા સ્વી આદિને અપશુકન માનીને તેનું દ્વિલ તો નથી દુખાવ્યું ?

### નારી સમાજ માટે ખાસ

૧. ધરેણું વગેરે બનાવવા માટે પતિને હેરાન તો નથી કર્યો ?
૨. સાસુ, નણુંદ, નેઠાણું, દેરાણું આદિ કૌદુર્બિક સ્વજનોની સાથે દુર્ભાગ્યા, દેખ કે કલહ તો નથી કર્યો ?

૩. શોકચ, જોડાણી નણુંદ આહિ ખીજના આળાંતી સાથે દર્ખિં વ્યવહાર તો નથી કર્યો ?
  ૪. ડાઈ વિધવા અહેનતું અપરાખ્યાથી અપમાન તો નથી કર્યું ?
  ૫. હેંઘાવ, શ્રુતિંગાર કે વિષયવાસનાઓમાં શક્તિ અને સમયનો અપવ્યુય તો નથી કર્યો ?
  ૬. દ્વિસભરમાં કયા અનુચિત, અપ્રિય અને અવગુણ પેશ કરનારા કાયો કર્યો ? અને કઈ સુદર શિખામણું અહુણું કરી ?
-

## નિયમો

૧. આ સંગરુનનું નામ 'આણુવતી સંઘ' રહેશે
  ૨. ઉદેશ.
- [ક] જાતિ, વર્ણ, દેશ, ધર્મનો બેદ ન રાખતાં ભાનવમાત્રને સંઘમના માર્ગ આગળ વધારવા.
- [ખ] લોકોને અહિસા, સત્ય, અચોર્ય અલ્લયર્ય અને અપરિયતનાં પ્રત ધારણ કરાવવા.
- [ગ] આધ્યાત્મિકતાના પ્રચાર દ્વારા જીવનમાં નૈતિકતાનું ધોરણ ઉંચાય કરવું.
- [ધ] અહિસાના પ્રચાર દ્વારા વિશ્વઅંધૃતવ અને જગતશાંતિને પ્રસરાવવી.
૩. આ સંઘમાં જોડાનાર વ્યક્તિ 'આણુવતી' કહેવાશે
  ૪. સંઘમાં કોઈને લેવાનો અધિકાર ભાત સંઘ પ્રમુખને રહેશે.
  ૫. અહિસામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ ધર્મ, દળ, જાતિ, વર્ણ અને દેશનાં લ્યી પુરુષ આ સંઘનાં સભ્ય થઈ શકશે.
  ૬. આણુવતિને સંઘના નિયમો અને આજાઓનું પાલન કરવું પડશે.
  ૭. સૌ સભ્યો પરસ્પર મૈત્રીભાવ રાખશે.
  ૮. આણુવતિએ લીધેલી પ્રતિજ્ઞાઓને વતરે પાળવી પડશે.
  ૯. કોઈ આણુવતિ બીજા આણુવતિને નિયમ, આજા અથવા પ્રતિજ્ઞાનો ભંગ કરતાં જોશે તો તે તે વ્યક્તિને જગૃત થવા કહેશે અંગર સંઘ પ્રમુખને જણાવશે. તે સિવાય પ્રચાર કરશે નહિ.
  ૧૦. દરેક આણુવતિ, સંઘે પ્રત્યે સર્વભાવ અને વક્ષાદારી રાખશે અને સંઘની નિંદા કરશે નહિ અને કોઈએ કરેલી નિંદાને ઉત્તેજન આપશે નહિ.

૧૧. દર વખે મહા સુદ્ધ પાંચમ અથવા નક્કી કરેલી તીથીએ, નક્કી કરેલા સ્થાને સંધના સભ્યોનું — આણુપ્રતીએઓનું — સંમેલન થશે જેમાં ધાર્યાં ખરું ખરું દરેક સભ્ય હાજર રહેશે.
૧૨. દર પેખવાડીએ ઓળામાં ઓછું એક વાર લીપેલી પ્રતિજ્ઞાએઓનું સમરણ અને લાગેલા દોષોની આંતર સમિક્ષા કરી. આત્મ શુદ્ધિ કરવી પડશે.
૧૩. સભ્યોમાં પરસપર કડવાશ થઈ હોય તો પંદર દિવસની અંદર ક્ષમાયાચના કરવી, આ સંભવિત ન અને તો સંધ્યપ્રમુખને જણું કરવી રહેશે.
૧૪. કોઈ પણ નિયમમાં સ્પષ્ટિકરણ, સુધારણા, પરિવર્તન અગ્ર ઉમેરવા વિંસ્ટ સંધ્ય પ્રમુખ કરશે જે સર્વ સભ્યોને માન્ય રહેશે.
૧૫. આ સંધમાં જોડાનાર એક કેબે નિયમો ન પાળી શકે તેમ હોય તો તે સંધ્ય પ્રમુખને જણું વશે અને તેને બદલે બીજા ખાસ નિયમો સ્વિકારી સંધમાં જોડાઈ શકશે.
૧૬. તર્કદારીએ યોગ્ય છતાં કદિ કોઈ અનિષ્ટનીય કાર્ય કરશે તો તેને પ્રાયશ્ચિત્ત કરવું પડશે.
૧૭. સંધના સર્વોપરી સંચાલક અથવા સંધ્ય પ્રમુખ તેરાપંથ સમાજના વર્તમાન આચાર્ય રહેશે.
૧૮. યોગ્ય પરિસ્થિતિમાં સંધ્ય પ્રમુખ દ્વારા સંધના નેતૃત્વની બીજી વ્યાસ્થા કરી શકાશે.
૧૯. નિયમ, આગા અથવા પ્રતિજ્ઞા ભંગનું પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર સંધના પ્રમુખને રહેશે.

## પરિશાષ્ટ (૨)

### શુલોચના સંદેશા

આણુગતી-સંવના પ્રથમ વાર્ષિક અધિવેશનને અંગે પ્રાપ્ત થયેલા સંદેશાએ નીચે મુજબ છે :—

વડા પ્રવાનની અસમર્થતા

પ્રિય મહોદ્ય !

તમોએ આચાર્ય શ્રીતુલસીના નેતૃત્વમાં થનારા આણુગતી-સંવના પ્રથમ અધિવેશન અંગે પાઠવલો આમંત્રણ પત્ર વડા પ્રધાનને મળ્યો, કંન્યવાડ.

અમયના અભાવે વડા પ્રધાન હાજર રહેવાને અરજા છે.

ભવદીય

પ્રાણુનાથ શાહી

પ્રાઇવેટ સેક્ટરી

માનનીય વડા પ્રધાન.

### નૈતિક પુનરૂત્થાન

મુંબઈના ગવર્નર (રાજપાલ) સર મહારાજસિંહે સફલતા માટે નીચેનો તાર મોકલ્યો હતો કે—

“નૈતિક પુનરૂત્થાનના પવિત્ર કાર્યમાં આણુગતી-સંવને સર્જાતાતી શુલ કામનાએ સહિત્ય પડવું છું.”

### અલિનંદન

મુંબઈના વડા પ્રધાન શ્રીયુત બાલ ગુંગાધર એરે મુંબઈથી નીચેતી મતદાનનો તાર મોકલ્યો હતો :

“હું (અષ્ટુવતી) સંધને અભિનંદન આપું છું અને આશા રાખું  
છું કે તે પોતાના કાર્યમાં સફળ થાય.”

### સમાજનું મહાકસ્યાણું

મુંબઈ ધારાસભાના અધ્યક્ષ શ્રી ડે. એસ. ફિરોહિયા તરફથી કાખા-  
ચેલા તા. ૩૦થી એપ્રિલના પત્રમાં જણાયું હતું કે :

‘આચાર્ય શ્રીતુલસીજીની છતછાયામાં ૩૦ મી એપ્રિલે થનારા  
અષ્ટુવતી-સંધના વાર્ષિક અધિવેશન અંગેતું નિમંત્રણ મુંબઈ ધારાસભાના  
અધ્યક્ષ માનનીય ડે. એસ. ફિરોહિયાને મળ્યું. ધ્યાન-

“તેમને એ જણીને હર્ષ થયો કે સાદાછ અને સલની જીવન-  
પ્રણાલિકાને અપનાવનારા લોકોનો આ સંધ, વર્તમાન સંયોગોમાં,  
ખાતરીપૂર્વક સમાજનું મહાકસ્યાણું કરશે. તેઓ અધિવેશનને સફળતા  
છુંછે છે અને વિનંતિ કરે છે કે તે ૬૦ પ્રતિજ્ઞાઓ કે ને સંધના  
નિયમો છે, તેની એક નકલ તેમને સૂચના માટે મોકલવામાં આવે.”

### મધ્ય માર્ગનું અનુસરણું

આસામના તત્કાલીન મર્વન્દર અને આજના ભારત સરકારના  
વ્યવસાય મંત્રી શ્રીયુત શ્રીપ્રકાશજીએ શિલેંગથી ૪ થી મેના પત્રમાં  
લખ્યું હતું કે—

પ્રિય શ્રી સત્યહેવળ,

તમારા ૨૭ મી એપ્રિલના પત્ર માટે ધ્યાન. જનતાના નૈતિક  
પુનરૂત્થાન માટે તમે ને રીતે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેમાં  
હું દિલચ્સ્બી લઇં છું. તમારા કાર્યનો સુંદર પ્રલાલ પડી રહ્યો છે—  
તે જણીને મને હર્ષ થયો. મને આશા છે કે શપથ લેનારી વ્યક્તિઓ  
પોતાતી પ્રતિજ્ઞાઓનું પાલન કરવાને શક્તિમાન નિવંશે.

માનવ સ્વભાવની મર્યાદાને લક્ષ્યમાં રાખવી એ ધ્યાણ સારું છે. કું માનું છું કે આપની પ્રતિશાઓ એ વાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જે આપણે એવા આકરા શાપથ લઈએ કે જેનું પાલન કરવું માનવ-શક્તિની અહારનું હોય, તો દરેક ડાળે આપણું લથ અને સુશકેલીએનો અનુભવ થાય. જીવનમાં આપણે જે ઈચ્છાએ છીએ તે છે સંયમ, નિયમિતતા અને અનુશાસન (શિરસ્ત) નહિ કે સર્વનિષેધ અથવા અત્યંત કઠોર વૈરાગ્ય. આપણે જણીએ છીએ કે કેટલા યે પ્રયાસો એ કારણે જ નિષ્ફળ ગયા કે તેમાં એવી પ્રતિશાઓનું નિર્માણ કરવામાં આગ્યું હતું કે જેનું પાલન કરવું એ સાધારણું મનુષ્યની શક્તિ અહારનું કરી હતું. મધ્યમાર્ગનું અનુસરણ કરવું અને એ રીતે ભલા-ઝૂરાની વચ્ચે સમતોલપણું કાયમ રાખવું સર્વોત્તમ છે.

મને યાદ કરવા માટે ધન્યવાદ.

તમારો,  
શ્રીપ્રકાશ.

### દુર્ધરનો અનુશ્રદ્ધ

એહિસાના તત્કાલીન વડા પ્રધાન અને આજના ભારત સરકારના ઉદ્ઘોગ મંત્રો શ્રી હરેકૃષ્ણા મહેતાએ કટ્ટક થી નીચેના આશયનો તાર કર્યો હતો :

‘સમર્સ્ત સંસાર ખાસ કરીને ભારત શાંતિ અને ઉન્નતિ ચાહે છે. જે લોકો શાંતિ અને ઉન્નતિને માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ દુર્ધરના અનુશ્રદ્ધને પાત્ર છે. પરમાત્મા તમારો પ્રયત્નોને સહિતા અર્પણું કરો !’

### આર્થીવર્ણ

ભારતના માઝ ગવર્નર જનરલ અને સરકારના ખાસ પ્રમાન શ્રી રાજગોપાલાચારી તરફથી તેમના મંત્રીએ જણાવ્યું હતું કે—

શ્રી રાજગોપાલાચારી અણુવતી-સંઘને પોતાના આશીર્વાદ મેડલે છે અને દિક્ષિમાં થનારા એના પ્રથમ અધિવેશનની સફળતાની આશા રાખે છે. તેમના અભિપ્રાય થી જનતાના નૈતિક અને સાંસ્કૃતિક ઉંચારની દશામાં આ પહેલું પગલું છે.

### સંઘના ઉદ્દેશો પ્રત્યે સહાનુભૂતિ

નેધરલેન્ડ (ઝય) ના એકાંગીએ પોતાના પત્રમાં જણાયું હતું કે—  
પ્રિય મહાશય,

તમારે ૨૭ મી એપ્રિલનો પત્ર મળ્યો.

તમારા સંઘના મૌલિક ઉદ્દેશો પ્રત્યે હું સહાનુભૂતિ ધરાવું છું.  
સહિષ્ણુતા, ધ્યાયર્થ (ધનિદ્રા-નિગ્રહ), સત્ય, ધર્માનદારી અને વિશ્વસ-  
નીયતા—એ એવા ગુણો છે કે જેને આજકાલની દુનિયામાં પૂરતું  
પ્રેત્સાહન આપવામાં આવતું નથી.

આ ગુણોના સંચાર અને પ્રચારના ઉદ્દેશથી જે કંઈ આંહોલન  
કરવામાં આવે, તે માનવ સમાજના આલારને પાત્ર છે.

આ ભાવનાથી પ્રેરાધને હું તમારા સંઘની દેશે પ્રકારતી સફળતા  
દર્શાવું છું.

તમારા,

એ. ડી. લેપિંગ

નેધરલેન્ડ (ઝય) નો રાજ્યાદ્ય

### નિસ્તરુત પ્રચારની આવસ્યકતા

સિધના વયોવૃદ્ધ અને સુપ્રસિદ્ધ આર્યનેતા શ્રી તારાચંદ આર.  
ડી. ગાજરાએ મુંબઈથી આચાર્યશ્રીને એક પત્ર લખતાં જણાયું  
હતું કે—

પૂજય આચાર્યજી,

આપના સંઘ સંઅંધી સમાચારો જણીને મને ધર્યો હ્યું  
થયો. આ સંઅંધી મેં આપની એક પુરિતકા વાંચી. આપના વિચારો

ઉત્તેજ છે અને પ્રયત્ન ઉત્તમ છે. પરંતુ હું એક વિનામ્ર સૂચના કરવા મધ્યથી હું. તે એ કે આપણા બધા સારા જિદ્દો એટલા માટે જ અધૂરા રહી જય છે કે એના માટે ખૂરતો અને તીવ્ર પ્રયાર કરવામાં આવતો નથી. દાખલા તરીકે ધૂમ્રપાનનો વિરોધ કરનારાઓ કોઈ કોઈવિશ્વ એનો વિરોધ કરે છે, જ્યારે તમાકુનો વેપારી એનો પ્રયાર નિરંતર ચાલુ રાખે છે, કે જેનું વર્ણન કરવું શક્ય નથી. દરેક વખતે એના પ્રયારકો એના વિભિન્ન માલની પ્રકાંસા કરતાં અને જાતા-અગ્રવતા ગલી જવીમાં ધૂમી રહ્યા હોય છે.

સેથી હું નભતાપૂર્વક નિવેદન કરીશ કે જે આપ આપના ઘેયમાં સંકળ થવા હુંચાતા હો, તો આપ ભારત અને પાકિસ્તાનની બધી લાખાઓમાં લાખોની સંખ્યામાં પુસ્તિકાઓ તથા હસ્તપત્રો પ્રગટ કરે અને આ અને દેશોના બાળકોને મહત વહેંચો.

કેટલાક અનુવાદો કરવામાં હું આપને મદદ ઇપ થવા તૈયાર હું.

આપનો,

તારાચંદ વ્યાર. ડી. ગાજરા,

એમ. એ. બી. ડી.

### ઉદ્દેશ પ્રશસ્ત અને પવિત્ર

અગનજવાડી વર્ધાથી શ્રી મશિવાલાએ લખ્યું હતું હે—

શ્રી અંત્રીજ,

આપનું આમંત્રણ મળ્યું,

આપના ઉદ્દેશો પ્રશસ્ત અને પવિત્ર છે. હું આથી રાખું હું કે આપ અનેક જૈનો અને બીજાઓમાં ફળું અખૂબતેનું કરમણઃ અધિકાધિક પ્રમાણમાં-પાલન કરવાનો ઉત્સાહ પેતા કરી શકશો.

આપનો,

દિસોસલાલ મશિવાલા.

## સંખ્યા નહિ પણ ગુણ

મહાત્મા ગાંધી અને દેશભક્તા રોડ જમનાલાલચા બજારના સાથી શ્રીમાન શ્રીકૃષ્ણાસજી જગ્યાએ બજારવાડીથી લખ્યું હો—

ભાઈ શ્રી સત્યદેવજી,

અણુકતી-સંધની વાયતમાં તમારો તારીખ ૨૭-૫-૫૦ નો  
પત્ર મને આજે મળ્યો. એક મહિનાથો છું અહીં ગેરહાજર હતો.  
કલે જ આચ્છો છું. આ સંધ સંખ્યાએ કેટલુંક મેં વર્તમાનપત્રેમાં  
પણ વાંચ્યું છે. સંધના સભ્યોની સંખ્યા કરતાં ગુણ પર વિશેષ ધ્યાન  
રાખવું જોઈએ

તમારું અને તમારા ધરવાળાઓનું સ્વાસ્થ્ય સારું હશે.

તમારો,  
શ્રીકૃષ્ણાસ જગ્યા

## જગતનું કલ્યાણ

શાંતિનિકેતન બોલપુરના આચાર્ય ગુરુહ્યાલ મહિલકે સુંધરથી  
લખ્યું હતું હો—

શ્રીમતી,

સરેન નમસ્કાર. તમારો તાં ૨૫-૩-૫૦ નો કૃપાપત્ર શાંતિ-  
નિકેતન થઈને અહીં મળ્યો છે. તેની સાથે એક નકલ ‘અણુકતી-સંધ  
અને અણુકતી’ ની પણ મળી છે. બંને ને માટે ધ્યાદ.

તમારા સંધનું અધિકેશન કે હિલ્લી ખાતે મળવાનું છે. તેની  
સર્વાન્તરા માટે પ્રાર્થના કરે છું. તમારા સંધના શુલ્ક કામથી જગતનું  
કલ્યાણ થાગ્યો, એવી મારી આસા છે.

અનુધીય,  
ગુરુહ્યાલ મહિલક

## ઉત્તમ યોજના

‘અધિક ભારતીય રામરાજ્ય પરિવદ્ધના કાર્યોલય નિગમબોધ ધારાં દિલ્હીથી શ્રી કર્પાત્રીજ મહારાજે લખ્યું હતું કે—

‘અષ્ટુષ્ટતી-સંધની યોજના ધર્ષી ઉત્તમ છે.’

## ઉત્તમ કામ

પંજાબ પ્રાંતીય મહાસભા-સમિતિના પ્રધાન અને ભારતીય સંસ્કૃતના સભ્ય જાની ગુરુમુખસિહ મુસાફરે એક પત્રમાં લખ્યું હતું કે—

“એ સાંભળાને હું ધર્ષો ખુશ થયો છું કે આચાર્યાંશી તુલસી જનતાનું નૈતિક ધોરણ ઊંચે લાવવાનો યત્ન કરી રહ્યા છે. એ સંબંધમાં તેઓએ ઽઠો મી એપ્રિલે દિલ્હીમાં એક અધિવેશન પણ રાખ્યું છે. મારો કાર્યક્રમ બહાર જવાનો ન હોત તો આ પ્રસંગમાં સામેલ થઈને ધર્ષો ખુશ થાત. આચાર્યાંશીએ એક ધર્ણા ઉત્તમ કામનું બીડું અડ્પ્યું છે. હું તમામ લોકોને વિનંતિ કરું છું કે તેઓ આ અધિવેશનમાં સામેલ થાય અને લાલ ઉડાવે.”

## સાંબંધકોનો સંધ

શ્રી ભારત નૈત મહામંતુલના અધ્યક્ષ શ્રી રિષલદાસજી રાંકાએ વધોથી લખ્યું હતું કે—

‘પ્રિય શ્રી પન્નાલાલજ,

તમારો પત્ર મળ્યો. મારી હાર્દિક ધર્ણા એ છે કે હું અષ્ટુષ્ટતી-સંધના સંમેલનમાં હાજર રહ્યું. આને ત્રિપાઠીજીનો તાર પણ મળ્યો. મેં અચલસિહજીને તે મર્તલબનો તાર પણ કર્યો છે. પરંતુ આગરાવાળા ન માને અને મને ઉતારી લે તો હું લાચાર છું. આઈ પુનમચંદજી રાંકા અસ્વરથ છે. તેઓ આગરા જનાર નથી. જો તેઓ મને ઉતારી નહિ. લે તો રજી મેં એ અવશ્ય આવીશ. ત્યારે આપની મુલાકાત જરૂર થશે.. જો હું ન આવી શકું તો મારો નીચેનો સંભળાવી હેઠે :—

ધર્મને સમરણ કરવાની, ગોખ્લી જવાની કે ભસ્તક નમાવવાની જ વરતુ ન રાખતાં હૈનિક જીવનમાં કામ આવે તેવો બનાવવાનો છે. ત્યારે જ એના દ્વારા આત્મવિકાસ સાધી શકાશે. નહિ તો તે ખાઈપીને સુખી રહેનારા લોકાનો સાચ્ચિક મનોવિનોદ અથવા દેખાવ બની જાય છે. અણુશ્રતી-સંધની યોજના ધર્મને જીવનમાં ઉતારવા માટે થઈ રહી છે. તેથી એને હું સાધકોનો સંધ માનું છું. મારા જેવો સાધક સાધનામાં આગળ વધનારા સંધના અધિવેશનની સહૃદતાને માટે ભગવાનને પ્રાર્થના જ કરી શકે. તેને કષ્ટ કહેવાનો કે સદેશ આપવાનો અધિકાર નથી.

રિષભદાસના પ્રણામ.

### દેશનું નૈતિક ધોરણ

આચાર્ય ચૈનસુખદાસજી નૈન, પ્રિન્સીપાલ નૈન સંસ્કૃત કોલેજ જયપુરથી લખે છે કે—

### શ્રીમાનું સત્યહેવળ વિઘાલંકાર !

અણુશ્રતી-સંધના પ્રથમ અધિવેશનનો નિમંત્રણ-પત્ર પ્રાપ્ત થયો. ધન્યવાદ. હું એની સહૃદતાને ધૂચ્છું છું. ખરેખર આવા સંધાની આ વખતે ધણી જરૂર છે. દેશનું નૈતિક ધોરણ નીચે પડી રહ્યું છે. તેને ઉપર લાવવા માટે આવો સંધ કે પ્રયત્ન સહૃદ થઈ શકે છે.

આપનો,  
ચૈનસુખદાસ.

નીચે જણાવેલા મહાનુભાવોના પત્રો પણું મળ્યા હતાઃ—

૧. શ્રી માવલંકર, અધ્યક્ષ ભારતીય ચાર્ચામેંટ.
૨. ભારતના મુખ્ય સેનાપતિ.
૩. શ્રી ડે. સન્થામન્સું સ્ટેટ મિનિસ્ટર, ભારત સરકાર.
૪. ઉપનિવેશ મંત્રી, ભારત સરકાર.

૫. ભારતમાં રહેલા સિલોનના એલચી.
  ૬. ભારતમાં રહેલા અમેરિકાના એલચી.
  ૭. ભારતમાં રહેલા પાકિસ્તાનના એલચી.
  ૮. અર્થ, ઉદ્ઘોગ અને પુરવડી મંત્રી, વિધાર.
  ૯. શ્રીમતી મૃદુલા સારાભાઈ.
  ૧૦. શ્રી સ્યામલાલ વર્મા, જ્યાપુર.
  ૧૧. શેડ પુનમચંદ રાંઠા, નાગપુર.
  ૧૨. શ્રીયુત શ્રીકૃષ્ણસિહ, વડા પ્રધાન, વિધાર.
  ૧૩. ભારતમાં રહેલા સોવિયેટના એલચી.
  ૧૪. ભારતમાં રહેલા કેનેડાના હાઈ કમિશર.
-

## પરિશાષ (૩)

### અણુપત્તી-સંધનું અંતરંગ અધિવેશન

( અંતરંગ-અધિવેશનની આ સંક્ષિપ્ત કાર્યવાહી અહીં એટલા માટે પ્રકૃત કરવામાં આવે છે કે અણુપત્તીને અહણુ કરનારના જીવન પર અનો કેવો પ્રભાવ પડે છે, તે જણી શકાય. એ દર્શિયે આ વિવરણ ખાસ ઉપયોગી છે. )

અણુપત્તી-સંધનું એક અતરંગ અધિવેશન વૈશાખ શુદ્ધ બારશને રોજ મળ્યું. આ અધિવેશનનું મુખ્ય પ્રથોક્ષણ એ હતું કે આચાર્યશ્રી સાધનાકાલના અનુભવોથી માહિતગાર થાય. તેઓ શ્રી અણુપત્તીએને ભવિષ્યનું માર્ગદર્શન કરાવી શકે તથા અણુપત્તી-સંધ અગેનું પોતાનું વિશિષ્ટ દિન મિઠુ રજૂ કરી શકે. આ પ્રસંગે અણુપત્તીએ અને અણુપત લેવાની ભાવના રાખનારી વક્તિએને જ હાજર રહેવા દેવામાં આવ્યા હતા.

લગ્નાય એ વાગે આચાર્યશ્રીનું શુલ્લાગમન થયું. અણુપત્તીએ કેટલાક વખતથી તેમના આગમનની રાહ પૂરેપૂરી આતુસ્તાથી જોઈ રહ્યા હતા. મંગલાચરણના તરીક અમર ગાવામાં આવ્યું.

### સિદ્ધાંતસોફન

ત્યાર પછી આચાર્યશ્રીની સૂચના મૂજાય મુનિશ્રી નગરાજનું સ્વામીએ પ્રારંભિક ભાષણુ આપ્યું. તેમણે જણાયું કે જ્યા વર્ષે દ્વારાય શુદ્ધ નીજના દિવસે આચાર્યશ્રીના છરકમલોથી સંભળી સ્થાપના ચાહી. અને એ આનંદી વાત છે કે આજ સુધીમાં તેમાં પાંચ સો જેટલી અંજિયે દાખલ થઈ ચૂકી છે. અધ્યેત્ય આચાર્યશ્રીના આહેશ અનુસાર આપ વધાને અણુપત અને તેની પરિલાખા સમજાવવાનો અવસર મને યથાસમય પ્રાપ્ત થતો રહ્યો છે.

પ્રત્યક્ષ અનુભવની વાત કહું તો આજના સામાજિક વાતાવરણમાં ડેટલાઇન નિયમોનું પાલન અતિ કદિન જણાય છે. તેથી જ આજે પ્રત-સંરોધનના પ્રસંગે અનેક જાતની સૂચનાઓ આવી રહી છે. આચાર્યશ્રી તેના પર બગાબર ધ્યાન આપશે. પરંતુ મને એમ લાગે છે કે એમાંની ડેટલીક સૂચનાઓ અંગત અગવડો અને અનુકૂળતાની દર્શિયે કરવામાં આવી છે. તેથી આપ બધાને મારી ભલામણ છે કે જે કાંઈ વિચાર કરવામાં આવે તે વ્યક્તિગત હિતની દર્શિયે ન કરતાં સંધની દર્શિયે કરવામાં આવે. તમે એવો વિચાર ન કરશો કે જે આ નિયમો આવા ને આવા જ રહેશે તો હું અણુવતી બની શકીશ નહિ. આ નિયમો સંધને માટે આવશ્યક છે કે નહિ, તે દર્શિબિદ્યુથી વિચાર કરશો તો સંભવ છે કે નિયમોમાં વધારે અપવાહ કરવાની કે સુગમતા લાવવાની જરૂર તમને નહિ જણાય. હું આરા રામું છું કે આજે તમે આચાર્યશ્રીની સમક્ષ પૂર્ણ ઉત્સાહ અને આત્મઅળનો પરિચય આપશો.

### આચાર્યશ્રીનું ભાષ્ય

આચાર્યશ્રીએ શાંત અને ગંભીર મુદ્રાથી ભાષ્યનો પ્રારંભ કર્યો.

અણુવતી ભાષણો અને અહેનો !

હવે સાધનાનો સમય સમાપ્ત થઈ ચુક્યો છે. તમે જે નિયમોની સાધના ડેટલાઇન વખતથી કરતા આવ્યા છો તે કાલથી ત્યાગના રૂપમાં આપેના જીવનમાં ઉતારવાની રહેશે. ત્યાગનું મહત્વ આપં બધા જણ્ણો છો અને માનો છો. ગમે તેવી વિષમ રિથ્તિ સામે આવી જય, પણ ત્યાગને તોડવાની વિચાર કરવો જોઈયે નહિ. ત્યાગનું મૂલ્ય પ્રાણુથી પણ અનેક જણું અધિક છે. આર્ય સંસ્કૃતિમાં ત્યાગથી વધારે કોઈ માત્રસિક શ્રૂંખલા નથી.

ત્યાગના સંબંધમાં વિચારવાનું માત્ર એટલું જ છે કે અણુવતી સંધના નિયમો, જે મોટા ભાગે આજના વાતાવરણને દર્શિ સંમક્ષ

રાખીને બનાવવામાં આવ્યા છે, તેની પ્રતિજ્ઞાએ જીવનભાર માટે એક સાથે આપવી કે અમુક મુહૂર પર્યાત ? હું માતું છું કે સંસાગમાં કણે કણે અનેક પરિવર્તનો થઈ રહ્યા છે, તેમાં યે આજના યુગમાં અધિક. કટેલાક નિયમો આજે સહજ સાધ્ય હોય, તે થીજા વખતે સામાજિક જીવનમાં માત્ર કષ્ટસાધ્ય જ નહિ પરંતુ અસાધ્ય પણ બની જાય. કરેલા ત્યાગમાં વૃદ્ધિનો સંભવ છે, હાસનો નહિ. એથી મારા વિચારો મુજબ એ યોગ્ય ગણ્યાય કે આ પ્રથમ અવસર પર બધા નિયમોનો ત્યાગ માત્ર એક વર્ષ માટે જ કરાવવો અને પછી તેને વ્યાવહારિકતાની કસોટી પર કસી જોવો. એનું તાત્પર્ય એ નથી કે વર્ષ પછી તમે દૈયકિતક રૂપમાં સ્વતંત્ર થઈ જશો અને આગળ પર ત્યાગ ગ્રહણ કરશો. કે નહિ. તમારે બધાએ એ વિચાર કરીને આગળ વધવાનું છે કે ‘સંધના પણ નિયમો હોય તેનું યાવજીવ પાલન કરવું’ અને મારે એ વિચારવાનું છે નિયમો કચાં સુધી વ્યવહાર્ય છે. વર્ષ પછી નિયમોની બાધ્યતમાં કરી વિચાર કરવાને માટે હું સ્વતંત્ર રહીશ.

ભીજ કે વાત મારે કહેવાની છે, તે એ છે કે આડંબર યા. દેખાવને માટે અણુપ્રતી બનવાનું નથી. અણુપ્રતી ચવાનો અર્થ આત્મ-પ્રેરણાથી સંયમ તરફ આગળ વધવાનો છે. ધણ્યા ભાગે લોકો નિયમોને અથવા પરિભાષાઓને એંચીતાણીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા. કરે છે. એ યોગ્ય નથી. આવશ્યક તો એ છે કે જીવનનો રંગઢંગ અદ્દીને સ્વયં નિયમોને અનુકૂળ બની જવું. જો તમે એમ ચાહતા હો કે અમે કેમ જીવી રહ્યા છીએ, તેમજ જીવીએ અને અણુપ્રતી પણ બનીએ, તો એ કેમ થઈ શકશે ?

### સંખ્યાનો મોહ નથી

નિયમ મુજબ કાઠને અણુપ્રતી-સંખ્યાનો દાખલ કરવાની જવાબદી મારા ઉપર છે. મને મોટી સંખ્યાનો મોહ નથી. નાની સંખ્યાનો ભય નથી. હું ધર્યશું છું કે અણુપ્રતીએ લલે થોડા બને, પણ તેઓં

અધ્યાત્મિક આધ્યાત્મિક વરોધર જીવનારા બને. તે જ માં પરમ લક્ષ્ય છે, તે જ મારે ખાસ પ્રયત્ન છે. અખુલતિઓ નામમાત્રના બનાવવા નથી, પણ ખરેખરા બનાવવા છે. સાધુ-સંધની જ્વાબદારી મારા પર છે. અધા સાધુઓની દેખરેખ મારે રાખવી પડે છે. સાધુઓ ભારતવર્ષના ખૂલ્લો ખૂલ્લામાં જાય છે. ત્યાં ને કોઈ સાધુ કાંઈ પણ ખૂલ કરે તો પણો આવતાં પ્રાયાધિત પદ્ધતિ મુજબ તેને દંડ દેવામાં આવે છે. તેનો જ નિયમ અખુલતિઓ માટે પણ છે. તમો એમ ન સમજતા કે તે માત્ર ચોપડીમાં રાખવા માટે જ છે. કોઈ પણ સ્થળે કોઈ અખુલતી પાઠનમાં તુટી કરશે તો સંભવ છે કે જનપર પરાએ તે મારા સુધી અવસ્થા આવી પહોંચશે. તે પ્રસંગે મારું કર્તાબ્ય એ હશે કે યોગ્ય તપાસ બાદ ઉપયાસ વગેરેના ઇપમાં આધ્યાત્મિક પ્રાયાધિત આપણું. તેની ચેતનાશી હું આજ થી જ બધાને આપી દઉં છું. ધર્મી વ્યક્તિઓને લાંબા વખત સુધી અખુલતોની સાધના કરી ચૂકી છે, તેમણે ત્યાગ કરવો પડ્યો. જેઓ પોતાને ત્યાગને અનુષ્ઠાન પૂરેપૂરા ન બનાવી શકે, તેઓ પોતે જ વિચાર કરી લે કે તેમણે શું કરવાનું છે હાં, સાધનાની બાધતમાં એટલું તો હું પણ આવસ્યક સમજું છું કે જેઓ ત્યાગ લેવાનો સંક્રમણ કરી ચૂક્યા છે અથવા કરે છે, તેઓ સંયોગાનુસાર આજે જ ત્યાગ લેવાને માટે તૈયાર નથી પણ તેઓ ત્યાગ લેવાની ચોક્સ મુદ્ત અતાધીને તેટલા સમય સુધી પોતાનું નામ સાધનામાં રાખવી શકે છે આ વર્ષે નવેસરથી અખુલતી-સંધમાં દાખલ થનારા, ઇચ્છે તો, એક વર્ષે સાધનામાં રહી શકે છે.

ભાષ્યાની વર્ચ્યે વર્ચ્યે આચાર્યશ્રી ઉક્ત વિષયે પર અખુલતિઓના વિચાર કેવા છે, તે પ્રશ્નો પૂછીને જાણી લેતા હતા. એ વિચારો સાથે ચેતાના વિચારોનો સમન્વય કરીને તેઓશ્રી દરેક સમસ્યાને નિર્ણયના તત્ત્વકુદ્દે પહોંચાડતા હતા. એકત્રંત્ર અને જનતંત્ર વર્ચ્યેનો આ માર્ગ જણ્ણે સુંદર જણ્ણાતો હતો.

આ રીતે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર પ્રકાશ ઇંકારાં છેવટે આચાર્યશ્રીએ જાણુંયું કે હવે હું એ જાણવા ધર્મશ્રું ખું કે તમે જાણું દ્વિસથી સાધના કરી રહ્યા છો—અખુતતોનું પાલન કરી રહ્યા છો, તો એ વિષયમાં તમારા અનુભવો કેવા પ્રકારના છે? તમારા જીવનમાં કોઈ મહત્વનું પરિવર્તન થયું કે નહિ?

### અંગત અનુભવો

આ પરથી કેટલાક અખુતતીએઓએ જીભા થઈને પોતાને થયેલા અનુભવો પરિષ્ઠને સંબળાવ્યા, જે વાસ્તવિક રીતે અખુતતોની સફળતાના ઘોટક હતા. તેમાંથી કેટલાક અહો રજૂ ફરવામાં આવે છે.

એક ભાઈએ કહ્યું: ‘અખુતતોની સાધના સ્વીકાર્ય મણી સામાજિક જીવનમાં કેટલીક મુશ્કેલીએનો અનુભવ થયો. મણુ મારા નિયમાં હું દદ રહ્યો. એનું ઇણ મને સારું મળ્યું. મારા એક તદ્દન નશીકના સંબંધી મારું નામ પોતાના એક હેસમાં સાક્ષી રૂપે લખાવવાને ધર્મજીતા હતા. મેં કહ્યું. “નામ લખાવતું હેઠળ તો લખાવો. તેમાં કાંઈ હરકત નથી. પણ હું અખુતતી હોઈને નિયમ મુજબ અસત્ય સાક્ષી આપીશ નહિ. સત્ય સાક્ષીથી એનું કામ પતે તેમ ન હતું, તેથી તેણે મારા પર ધર્મશ્રું દયાલુ કર્યું. પરંતુ મારા નિયમમાં હું દદ રહ્યો. આથી જે કે કુદુંખીએ નારાજ થયા, પણ મને ધર્મ આત્મબળ પ્રાપ્ત થયું.

એ રીતે બીજી એક પ્રસંગે સાક્ષી આપવાને માટે હું જેટાં અસે અને સાક્ષી આપી. ન્યાયધીરે જાણ્યું કે આ અખુતતી છે, એટલે મારી સાક્ષીને સાચી માનીને તે મુજબ જ ઇંસલો આપ્યો. હવે આપ ક્રિયાર કરો કે અખુતતને લીધે દુનિયામાં આપણી કેટલી શાખ વધી છે અને વધશે. આપણે પણ આપણું વર્તન શાખ મુજબ રાખતું જોઈએ ત્યારે તે સ્થિર બનશે. વધારેમાં અખુતતીએ કહ્યું: ‘આચાર્યવર! મેં મારી દણિથી બધા નિયમોનું વિધિવત્ પાલન કર્યું છે. જ્ઞાન

સાધનાના કોઈ પણ નિયમને હું પૂરી રીતે પાણી શક્યો ન હોઉં તે જીવનથા જોગ છે. માટે આપણી મને જે કાંઈ ગ્રાયર્સિયત ફરમાવશો, તેનો હું સહ્યું સ્વીકાર કરીશ.’

એક ખીજ અણુવતીઓ કહ્યું : ‘હું દ્વારી કરું છું.’ જ્યારે અણુવતી થયો ન હતો, ત્યારે બહુ સાધારણી વર્ચ્યેથી ગાળો ખાઈ જતો હતો. પરંતુ સાધનાનો સ્વીકાર કર્યા પછી મેં એક પણ દ્વિસ— એક પણ વાર ગાળો ખાદ્યો નથી. તેથી મારી આવક જરૂર થઈ છે, પણ આત્મસંતોષ ખૂબ મળ્યો છે, તે એથી કે હું એક આદર્શને વાગ્યી રહ્યો છું.’

એક ભાઈએ કહ્યું : ‘સામાજિક સ્થિતિ નિયમોને પ્રતિકૂળ છે. તો પણ થોડા અણુવતીઓને લીધે તેમાં ભારે અસર પડતી હોય તેમ જરૂરી થાય છે. ધણા દેકાણે થનાગ મોટા ભોજન-સમારંભો જરૂરિના સંબંધી અણુવતીઓને સામેલ કરવા જાતર જ નિયમથ્ય જની જાય છે. અર્થાત્ બસો-ચારસો માણુસોની જગતો માત્ર રૂપ કે રૂપો ને રાજકીય નિયમ હોય તેથીજ વ્યક્તિઓ પૂરતો તે મર્યાદિત થાય છે. હું ને શહેરનો રહીશ છું, ત્યા અણુવતી હોવાના કારણે અધા જરૂરીયારમાં સામેલ થઈ રાકતો નથી. જનતાઓ જ્યારે મારું હાજર ન રહેવાનું કારણું જાણ્યું ત્યારે તેણે અણુવતી-સંબંધ અને તેના નિયમોનું હાર્દિક સ્વાગત કર્યું.’

ત્યાર પછી એક અણુવતીએ કહ્યું કે મોટા જરૂરીયારમાં ભાગ ન લેવાનું સહૃદી વધારે કૂળ તો મેં અનુભાવ્યું છે. મારા તહેન જરૂરિના સંબંધીને ત્યા વિવાહ હતો. ખીજ ગામ જાન ગઈ. સંયોગવરસાત્ મારે પણ જાનની સાથે જરું પડ્યું. અધા જાન્યા જતજતના ભોજન કરતા. મારા એકલાની સીધી-સાધી રસોધ જુદી અનતી. કોધ કોધ વાર ભિત્રો રાણે પણ મારતા કે જોયું અણુવતી અનવાનું કૂળ ? મિડાઈ આંખથી જોઈ શકો છો, પણ ખાઈ રાકતા નથી. કંઠે એક દ્વિસ

અકુરમાત્ર ખાવામાં કોઈ એવી એરી વરતુ આવી ગઈ કે મારા સિવાય  
બધાને ઉલટી અને આડા થવા લાગ્યા. મેં પણ કહ્યું કે જોયું અણુવતી  
ન થવાનું હુણ ?

એક જણે કહ્યું : 'મેં તો અનુભવ કર્યો કે અણુવતી થવાથી  
મનુષ્યની અંતર્દૃષ્ટિ ખુલી જાય છે. એને પ્રત્યેક કામમાં પાપ થવાનો ડર  
લાગે છે દરેક કાર્યમાં તેને વિચાર કરવો પડે છે કે આ કામ મારા માટે  
ચોણ્ય છે કે નહિ ?

આ રીતે બીજા અણુવતીઓએ પણ પોતાના જુદા જુદા અનુભવો  
સંભળાયા ને બણ્ણા રસિક અને શિક્ષાપ્રદ હતા.

આ કાર્યક્રમ પણી અણુવતીઓએ જુદા જુદા નિયમો બાળતમાં  
પૂછેલા પ્રશ્નોનો આચાર્યશ્રીએ ખુલાસો આપ્યો. ત્યાર બાદ આચાર્યશ્રીએ  
સમગ્ર અણુવતીઓને ઉદેશને પૂછ્યું કે નિયમો બનાવનાર હું છું અને  
પાણનાર તમે છો, તો તમારી દાખિએ આ નિયમોને વધારે સરળ બનાવવા  
જેવા છે કે કટોર ? તે પરથી મોટા લાગે જવાબ આપ્યો કે આ નિયમોને  
વધારે સરળ બનાવવાની જરૂર નથી. તેને કુમશઃ વધારે કર્દક બનાવવામાં  
જ અમારા જીવનનું ઉત્થાન છે, અમારા જીવનનો વિકાસ છે. અમારે  
અમારા જીવનને નિયમોને અતુફૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

તે પછી ઉમેદવાર અણુવતીઓએ પોતાનાં નામ આચાર્યશ્રીને  
સમર્પિત કર્યા અને લગભગ અઢી કલાકની મહત્વપૂર્ણ કાર્યવાહી પણી  
સેંકડો મંગળ ભાવનાઓ સાથે અધિવેશન સમાપ્ત થયું.



પ્રાપ્તિ સ્થાન :

રમણપિકચંદ મેતીચંદ ઝવેરી,

૧૫૭, ઝવેરી બાજર,

મુખ્યાઈ નં. ૨.

ટેલિફોન નં. : ૨૮૪૦૬





## नया प्रकाशन—

- ✿ विश्व-स्थिति
- ✿ धर्मध्याव ( प्रथम लाग )
- ✿ धर्मध्याव ( दुसरा लाग )
- ✿ मेरा युग
- ✿ आपू
- ✿ सचिन शावक-प्रतिष्ठभव्य
- ✿ पदार्थवाद
- ✿ आत्म-साधना
- ✿ शुग-धर्म तेरा पथ
- ✿ तीन-संहेश
- ✿ आंखें आली
- ✿ त्याग
- ✿ अछुतती-संघ और अछुतत
- ✿ ज्ञान-क्षण आदि
- ✿ संहेश ( प्रवचन संथान )

**आठश्वर्स साहित्य-संघ,**

सरहारशाहुर ( राजस्थान )